

# શેઠ માણોકલાલ જેઠામાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.



માહિતી (મેળવવાના) અધિકાર

અધિનિયમ - ૨૦૦૫

અધિનિયમની કલમ-૪(ખ) હેઠળની વિગતવાર

માહિતી આપતી પુસ્તકા/માર્ગદર્શિકા

પ્રસિદ્ધ કર્યા તારીખ : ૩૦-૦૬-૨૦૨૩

## **માહિતીનો અધિકાર અધિનિયમ - ૨૦૦૫**

(સને ૨૦૦૫નો અધિનિયમ ક્રમાંક ૨૨)

**-ઃ પ્રસ્તાવના :-**

લોકશાહીના આદર્શની સર્વોપરિતા જાળવવા અને જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય અને તેના નિયંત્રણ હેઠળના પુસ્તકાલયોની માહિતી નાગરિકો સરળતાથી મેળવી શકે ઉપરાંત માહિતી અધિકારના વ્યવહારું શાસનની રચના કરવાના હેતુથી જાહેર વ્યવહારમાં માહિતીની જાહેરાત કરી કાર્યક્રમ સંચાલનની નાગરિકોને જાણકારી આપવાનો અભિગમ છે.

સાર્વજનિક પુસ્તકાલયોમાં પ્રજાના સંસ્કારો અને સંસ્કૃતિનો વારસો સચ્ચાયેલો પડ્યો છે. પુસ્તકાલય પ્રવૃત્તિને મુખ્યત્વે માહિતી, શિક્ષણ, સાહિત્ય અને જ્ઞાન સાથે સીધો સંબંધ છે તેમજ વાચન સામગ્રીનો સંગ્રહ, જાળવણી, પ્રચાર અને પ્રસાર કરવાની કામગીરી પુસ્તકાલય સાથે સંકળાયેલી છે. પુસ્તકાલય એ “જ્ઞાનની પરબ્ર” કે “જ્ઞાનમંદિર” જેવા ગૌરવવંતા પદને શોભાવે છે. પુસ્તકાલય, પુસ્તક અને વાચનના કારણે માનવી શિક્ષિત અને જાગૃત બને છે. પરિણામે કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ થયો છે. સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં પુસ્તકાલયોનો ફાળો ઘણો મોટો રહ્યો છે. માનવીના ચારિત્ર્ય ઘડતરનું કામ પુસ્તકો કરતા હોય છે.

માહિતીનો અધિકાર અધિનિયમ ૨૦૦૫ની કલમ ૪ (૧) (ભ) મુજબ શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયની માહિતી પ્રસિદ્ધ કરવા કુલ ૧૭ નિયમ સંગ્રહો તૈયાર કરી રજૂ કરવામાં આવ્યા છે.

(યોગેશ જે. પટેલ)

જુનિયર સહાયક ગ્રંથપાલ  
(જાહેર માહિતી અધિકારી)

(ડૉ. બિપીન જે. મોદી)

ગ્રંથપાલ,  
શેઠ મા.જે. પુસ્તકાલય,  
અમદાવાદ.  
(એપેલેટ ઓથોરીટી)

## અનુક્રમણિકા

ક્રમ	પ્રકરણ નં.	પ્રકરણની વિગત
૧.	૧	વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો
૨.	૨, ૬	અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૩.	૩	દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિષ્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ
૪.	૪, ૫	કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને રેકૉર્ડ
૫.	૭	નીતિ અથવા તેના અમલીકરણના ઘડતરના સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના નામ દ્વારા રજૂઆત માટેની વિદ્યમાન હોઈ ગોઠવણીની વિગતો
૬.	૮	વ્યવસ્થા તંત્રના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો માટે ખૂલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ
૭.	૮/૧૦	અધિકારી અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર
૮.	૧૧	યોજનાઓ, સૂચિતખર્ય અને વહેંચણીપરના અહેવાલોની વિગતો દર્શાવતી તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર
૯.	૧૨	ફાળવેલ રકમો અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત
૧૦.	૧૩	આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાઓની વિગતો
૧૧.	૧૪	ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અને તેને ઉપલબ્ધ અથવા તેને ધરાવેલ માહિતીને લગતી વિગતો
૧૨.	૧૫	જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા વાચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો
૧૩.	૧૬	જાહેર માહિતી અધિકારીઓના નામ, હોદા અને બીજી વિગતો
૧૪.	૧૭	ધરાવવામાં આવે તેવી બીજી માહિતી

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-ઓક્ટીવ ડિસ્કલોઝર નં. ૧  
પુસ્તકાલયના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો

# શેઠ માણોકલાલ જેઠામાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫

પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નં. ૧

પુસ્તકાલયના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો

૧:૧ પુસ્તકાલયનો હેતુ / મહત્વ :

‘જ્ઞાનના જેવું પવિત્ર આ જગતમાં અન્ય કોઈ નથી’ આ કથનને ચરિતાર્થ કરતા મા.જે. પુસ્તકાલયના આ જ્ઞાનમંદિર (ટેમ્પલ ઓફ નોલેજ)નો જ્ઞાનદીપક સતત પ્રકાશિત રહ્યો છે. પૂર્વ દિશામાં સવારના ઉગતા સૂરજના સોનેરી કિરણો તેના પ્રવેશ દ્વારે જ્ઞાનના સાથ્યા પૂરી પુસ્તક, વાચન અને પુસ્તકાલય સેવાઓને અજવાળવાનું કાર્ય કરે છે. અમદાવાદ મહાનગરના નગરજનોને પાયાની જરૂરિયાતો પૂરી પાડતું ભ્યુ. કોર્પો. અભાલ વૃદ્ધ સૌ કોઈને પુસ્તક અને વાચન સેવાઓ પૂરી પાડી સંસ્કારસભર સમાજ નવરચના કરવાનું અને ચારિત્ર્ય ઘડતરનું કાર્ય કરે છે. આ પુસ્તકાલય ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન અને સંવર્ધનનું કાર્ય કરે છે. માત્ર વાચકને કેન્દ્ર બિંદુમાં રાખી રૂચિને અનુરૂપ વાચન સામગ્રી પૂરી પાડવા સમાજમાં વાચન ટેવ ઊભી કરી તેને પોષવાનું કાર્ય પુસ્તકાલય કરે છે. પરિણામે આજે આ પુસ્તકાલય સાચા અર્થમાં સમાજનું વિશ્વ વિદ્યાલય બન્યું છે. આ દિશામાં પુસ્તકાલય થકી સર્વોત્તમ જીવન જીવવાનો માર્ગ કે માર્ગદર્શનના પાઠો ભણાવવા ગ્રંથમાં સંકલિત થયેલી ઉત્તમ સુવિચારોના માધ્યમથી માનવી ચિંતનશીલ બન્યો છે અને તેથી જ દરેક દિશાએથી શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાય છે. આ રીતે પરિવર્તનની પળ પણ સાર્થક બને છે. ઉપરોક્ત સદ્ગુણો અને સત્કાર્યોની સ્થાપના સામૂહિક ધોરણે થવાથી સમાજ-સેવાનું મહત્વનું કાર્ય થઈ રહ્યું છે. મા.જે.ના પાયામાં પૂજ્ય બાપુએ રાખેલા સત્ય, અહિંસા, સાદગી અને સદ્ભાવનાના પથરો પડ્યા છે અને ગુજરાતના પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર પટેલના શુભ હસ્તે આ પુસ્તકાલય સેવાઓ ખુલ્લી મુકવામાં આવી છે ત્યારે લોકકલ્યાણ, દઢ સંકલ્પ, પ્રમાણિક નીતિમત્તા અને પારદર્શક વહીવટના ગુણો મા.જે.ની સેવાના અણુએ અણુમાં પ્રસરી રહ્યા છે.

૧:૨ પુસ્તકાલયના કાર્યો-ફરજો :

ગુજરાત રાજ્યના ગૌરવ અને ગરિમા સમું, ભારતના સાર્વજનિક પુસ્તકાલયોની શ્રેષ્ઠીમાં પ્રથમ હોળમાં અગ્ર સ્થાને આવતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પુસ્તકાલય પ્રવૃત્તિઓમાં શિરોમણી સમું આ પુસ્તકાલય સને ૧૯૭૮ થી સતત વિકસનું રહ્યું છે. સમૃદ્ધ વાચનસામગ્રી, વિવિધ શાખા-પ્રશાખાઓમાં વિસ્તરેલા જ્ઞાનને વિવિધ વિષયો અને ભાષાના માધ્યમથી નજીકથી પુસ્તક સ્વરૂપે જોવાની, માણવાની, પામવાની સુંદર સુવિધા, વ્યક્તિગત સંપર્ક સાથેની સધન અનુલયસેવા, ત્વરિત માહિતીસેવા, અભાલ-વૃદ્ધ સૌને અનુરૂપ ગ્રંથસેવા, વાચનસેવાઓ બાળપુસ્તકાલયથી શરૂ કરીને સીનીયર સીટીઝન સુધીના સામાન્ય વાચકો, જિજ્ઞાસુઓ, વિદ્યાર્થીઓ, માહિતીવિદો, શિક્ષણ શાસ્ત્રીઓ, સંશોધકોને જરૂરિયાત અનુસારની વાચનરૂચિને સતત પોષતી અને પ્રોત્સાહિત કરતી વિપુલ વૈવિધ્યસભર વાચનસામગ્રી વિવિધરંગી વિસ્તરણ, સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિજ્ઞાનું માધ્યમો દ્વારા માહિતી સ્ત્રોતનો રસાસ્વાદ માણવાની સામાજિક અને સાંસ્કૃતિક સેવાકીય સંસ્થા એટલે આપણું મા.જે. પુસ્તકાલય.

એકવીસમી સદી માહિતી યુગના નવા કિરણો સાથે આવી છે. કોમ્પ્યુટર, ઇન્ફર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુનિકેશન ટેકનોલોજી, પ્રિન્ટિંગ ટેકનોલોજી, સંચાર માધ્યમ અને વિજાણું માધ્યમના ઉપકરણોએ વૈશ્વિક સ્તરે નવીનીકરણો સ્થાપિત કરી જ્લોબલાઈઝેશનના નવા અભિગમો અપનાવ્યા છે. સમય, સંજોગો અને પરિસ્થિતિને અનુરૂપ પરિવર્તન સાધવાની દિશામાં પણ વિકાસ સાધવાના પ્રયત્નો હાથ ધરાયા છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પુસ્તકાલયો - વાચનાલયોના માધ્યમથી સ્થાનિક લોકોને સેવાઓ આપવાનો પ્રયાસ કરેલ છે. પ્રજાચક્ષુંઓ માટેનો ઓડિયો વિભાગ, મા.જે. પુસ્તકાલયમાં રેફરન્સ એન્ડ રીસર્ચ સેન્ટર અને જ્ઞાન વિહાર વિદ્યાર્થી વાચનાલયની સેવાઓનો લાભ વાચકો લઈ રહ્યા છે. હાલમાં કોમ્પ્યુટર એપ્લીકેશન, ડિજિટાઈઝેશન, લાયબ્રેરી ઓટોમેશન, વૈશ્વિક જ્લોબલાઈઝેશન અને ડિજિટલ લાયબ્રેરી થકી ઓનલાઈન સેવાઓ આપવાનું શરૂ કરેલ છે.

### ૧:૩ સંક્ષિપ્ત ઇતિહાસ :

ઐતિહાસિક દાંડીકૂચના ગ્રારંભે મહાત્મા ગાંધીએ આશ્રમના પુસ્તકો થકી સાર્વજનિક પુસ્તકાલયની રચનાનો વિચાર પ્રદર્શિત કર્યો. જે ૨૭મી જુલાઈ ૧૯૩૭ના રોજ જી પ્રેસ જર્નલમાં પ્રગટ થતાં બીજા જ દિવસે શેઠ રસિકલાલ માણેકલાલ તરફથી રૂ. ૫૫,૦૦૦ ની સખાવત ગ્રંથાલય ભવનના નિર્માણ માટે મળતાં તેઓ શ્રીના પિતાની સ્મૃતિમાં ‘માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય’ અસ્તિત્વમાં આવ્યું. સાહિત્યકારો, સાહિત્યરસિકો અને જ્ઞાનપિપાસુઓમાં “મા.જે.” ના હૂલામણા નામથી આ પુસ્તકાલય તેના ગ્રારંભથી જ ભવ્ય ભૂતકાળ સાથે ઉજ્જવળ વર્તમાનના સુર્વણાંકિત પૃષ્ઠો થકી વધુ દૈદિયમાન અને સુવાસિત બન્યું છે. પૂજય બાપુજીના કરકમલોના સ્પર્શે ખાતમુહૂર્ત પાભ્યા બાદ પાંચેક વર્ષમાં જ્યાપુરી સ્થાપત્ય ધરાવતું ભવન તૈયાર થતાં ૧૫મી એપ્રિલ ૧૯૩૮ના રોજ આ પુસ્તકાલય ભારતના લોખંડી પુલ્ઘ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈના શુભહસ્તે જાહેરજનતાના લાભાર્થી ખુલ્લુ મુકાયું. શેઠ શ્રી રસિકલાલ તરફથી કમશા: વિશેષ અનુદાનો મળતાં ‘સુભદ્રાબેન માણેકલાલ વાચનાલય’ અને ‘બાળકિશોર વિભાગ’ પણ અસ્તિત્વમાં આવ્યા. ૧૪મી જૂન ૧૯૫૫ના રોજ તે વખતના મુંબઈ રાજ્યના પંત પ્રધાનશ્રી મોરારજ દેસાઈના હસ્તે “બાળકિશોર વિભાગ” ખુલ્લો મુકાયો. ૧૯૫૦માં અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. ૫૦,૦૦૦/- નું વિશેષ અનુદાન મળતાં અલગ ગ્રંથભંડારની રચના થઈ. ૧૯૫૭માં પુસ્તકોને બંધ કબાટોના બંધનમાંથી મુક્ત કરવામાં આવ્યા. ૧૯૭૪ અને પછીના વર્ષોમાં રૂ. ૧૬.૫૦ લાખની રકમ ભૂ. કોર્પોરેશન તરફથી મળતા ગ્રંથાલય ભવનનું વિસ્તરણ કરવામાં આવ્યું. વર્ષ ૨૦૦૪-૦૫ માં રૂ. ૨૨.૦૦ લાખની કેપિટલ રકમમાંથી રેફરન્સ એન્ડ રીસર્ચ સેક્શન તથા જ્ઞાનવિહાર - વિદ્યાર્થી વાચનાલય વિભાગ અસ્તિત્વમાં આવ્યો. અ.ભૂ. કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૨-૧૪માં રૂ.૫.૩૫ કરોડના ખર્ચે પુસ્તકાલયના નવીનીકરણ અને રીટ્રોફીટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી જેમાં વાતાનુકૂલિત ઓડિટોરિયમ અને લીફટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. તા.૦૧-૦૬-૨૦૨૧ના રોજ શેઠ મા.જે. પુસ્તકાલય ખાતે ડિજિટલ લાયબ્રેરીનો શુભારંભ કરવામાં આવેલ છે.

અનેકવિધ માહિતી માધ્યમોના પડકારો વચ્ચે ગ્રંથાલયસેવાને સતત અગ્રેસર અને જીવંત રાખવા ગ્રંથાલય સેવાઓનું ફલક અત્યંત વિસ્તરણ રહ્યું છે. તેના સેવાફલક ઉપર માત્ર વયસ્કો જ નહીં અપિતું સૌ નાના ભૂલકાઓ, બાળકો, કિશોરો, મહિલાઓ, સિનીયર સિટીઝન તેમજ પ્રજાચક્ષુંઓ વગેરેને પણ આવરી લેવામાં આવ્યા છે. વૈવિધ્યસભર વિસ્તરણ સેવાઓ અને વિશેષ કરીને ‘સાહિત્ય વર્તુળ’ સાહિત્ય ચોરાની સાહિત્યિક પ્રવૃત્તિએ મૂક સાહિત્યને જીવંત બનાવી માત્ર અમદાવાદને જ નહીં અપિતું સમગ્ર ગુજરાતને ગુંજતું કર્યું છે. નગરજનો માટે આ પુસ્તકાલય ગૌરવ બની રહ્યું છે.

## સંક્ષિમ માહિતી

સ્થાપના વર્ષ	: ૧૯૩૮
અનુદાન	: અમદાવાદ ભુનિસિપલ કોર્પોરેશન
વ્યવસ્થા	: મા.જી. પુસ્તકાલય, વ્યવસ્થાપક મંડળ
અંદાજીત કુલ ખર્ચ	: ૮,૦૮,૬૭,૨૨૬=૦૦
કર્મચારીગણ	: પુસ્તકાલયના શીર્ખુલ પર મંજૂર થયેલ મહેકમ કુલ ૧૧૮ કર્મચારીઓ હાલમાં ભરેલી જગાઓ કુલ ૫૧
વ્યાવસાયિક	: ૨૫
અર્ધ - વ્યાવસાયિક	: ૦૬
બિન - વ્યાવસાયિક	: ૨૦
વાચકસેવાઓ	<p>સામાન્ય : વર્તમાનપત્રો - સામયિકો</p> <p>: અધ્યયન (સંદર્ભ)</p> <p>: અધ્યયન (વિદ્યાર્થી)</p> <p>ગ્રંથપરિકમણ : વયસ્ક</p> <p>: બાળકિશોર</p> <p>: મહિલા</p> <p>: શાખા પુસ્તકાલય (વિજયનગર - મણીનગર- વાસણા - હિમતલાલ પાર્ક) અને વાચનાલય (નરોડા - વેજલપુર - અમરાઈવાડી)</p> <p>: આંતર ગ્રંથાલય</p>
પ્ર-લેખન માહિતીસેવા	<p>: અનુલય (સંદર્ભ)</p> <p>: માહિતી</p> <p>: પ્રતિલિપિ</p>
વિભાગીય	<p>: બાળ-કિશોર વિભાગ</p> <p>: પ્રજ્ઞાયક્ષુઓ માટેનો ઓઝિયો વિભાગ</p> <p>: મહિલા વિભાગ</p>
વિસ્તરણ	<p>: ગ્રંથ પ્રદર્શન</p> <p>: સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ</p> <p>: વિસ્તરણ પ્રવૃત્તિઓ</p> <p>: કોમ્પ્યુટર</p> <p>: શ્રી ચંદ્રકાંત કર્સ્ટીઆ મ્યુ. પુસ્તકાલય - વિજયનગર</p> <p>: માણભટ પ્રેમાનંદ મ્યુ. વાચનાલય - નરોડા</p> <p>: કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહ મ્યુ. પુસ્તકાલય - હિમતલાલ પાર્ક</p> <p>: આચાર્યશ્રી સુબોધસાગર સુરીશ્વરજી મહારાજશ્રી શાખા પુસ્તકાલય - વાસણા</p> <p>: ડૉ. શ્યામાપ્રસાદ મુખજી મ્યુ. વાચનાલય - વેજલપુર</p> <p>: શામળ ભાડુ મ્યુ. વાચનાલય - અમરાઈવાડી</p> <p>: આત્મા સાયન્સ એન્ડ ટેકનોલોજી શાખા પુસ્તકાલય - મણીનગર</p> <p>: અ. મ્યુ. કો. પુસ્તકાલય ખાતુ, વાચનાલયો-૫૫, બાલભવન-૦૪</p>

શિક્ષણ વિભાગ	: વાચનાલય
	: અધ્યયન (કિશોર)
	: અધ્યયન (વયસ્ક)
ગ્રંથભંડાર (સામાન્ય)	: દેય
	: અદેય
ગ્રંથભંડાર (વિશિષ્ટ)	: અમદાવાદનો વારસો - અમદાવાદનો અક્ષરરેહ - અમદાવાદની અસ્મિતા
વિશિષ્ટ વિભાગ	: પંડિત સુખલાલજી પ્રજાચક્ષુ વિભાગ
વિશિષ્ટ સાહિત્ય	: ગાંધી સાહિત્ય
	: રીસર્ચ એન્ડ રેડી રેફરન્સ વિભાગ
	: કોમ્પ્યુટર એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ
	: ડોક્યુમેન્ટ - ઈન્ફર્મેશન
નવા ઉમેરાયેલા ગ્રંથો	: ૪,૩૬૦
કુલ ગ્રંથસંગ્રહ	: ૮,૦૧,૭૭૩
સામાચિકો	: ૫૦ + ૧૦૫ (ભેટ)
કુલ સભ્ય સંખ્યા	: ૨૫,૦૮૧
	: વાર્ષિક સભ્ય સંખ્યા - ૫૨૮
	: આજીવન સભ્ય સંખ્યા - ૨૩,૮૪૮
	: શાનવિહાર વાચનાલય સભ્ય સંખ્યા - ૬૦૩
	(મા.જે. પુસ્તકાલય / શાખા પુસ્તકાલયો / વાચનાલયો)
કુલ ગ્રંથપરિકમણ	: ૮૧,૧૩૮
	(મા.જે. પુસ્તકાલય / શાખા પુસ્તકાલયો / વાચનાલયો)

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડિસ્કલોગર નં. ૨  
પુસ્તકાલયના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટીવ ડિસ્કલોગર નં. ૬  
પુસ્તકાલયની પાસે અથવા પુસ્ત.ના નિયંત્રણ હેઠળ હોય  
તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૧.	ગ્રંથપાલ	(૧) વ્યવસ્થા અને સંચાલન (૨) વહીવટી બાબતો (૩) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાયજન, સંકલન (૪) આયોજન (૫) મહેકમની તમામ બાબતો (૬) નાણાંકીય આયોજન (૭) નિરીક્ષણ અને કંટ્રોલ (૮) પુસ્તકાલય પ્રચાર અને પ્રસાર (૯) સહકાર - સમન્વય (૧૦) વહીવટી અધિકારી - પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ - પુસ્તક પસંદગી સમિતિ (૧૧) પુસ્તક અને વાચન સેવાઓ (૧૨) ભવન વિસ્તરણ અને આયોજન (૧૩) મોર્ડનાઇઝેશન (૧૪) કોમ્પ્યુટરાઇઝેશન - લાયબ્રેરી ઓટોમેશન - ડિજિટલ લાયબ્રેરી ઓનલાઈન સેવાઓ (૧૫) પુસ્તકાલય સેવાઓનો વિકાસ (૧૬) વિસ્તરણ પ્રવૃત્તિઓ (૧૭) સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (૧૮) વહીવટી અને નાણાંકીય નીતિવિષયક બાબતો (૧૯) નવીન આયોજન (૨૦) પુસ્તકાલયની ટેકનીકલ બાબતો (૨૧) ટ્રેનિંગ (૨૨) નાગરીક અધિકાર (૨૩) માહિતી અધિકાર (૨૪) અંદાજપત્ર (૨૫) વાર્ષિક વહીવટી અહેવાલ (૨૬) પુસ્તકાલય, શાખા પુસ્તકાલયો અને વાચનાલયની વ્યવસ્થા અને આયોજન (૨૭) વાંચનલક્ષી સેવાઓ (૨૮) મ્યુ. કોર્પોરેશનના પુસ્તકાલયો/વાચનાલયો તેમજ બાલભવનો	નીતિવિષયક બાબતો અંગેની ફાઈલ રેકર્ડ, ટ્રસ્ટીડ, કર્મચારીઓના સી.આર. રિપોર્ટ

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૨.	સહાયક ગ્રંથપાલ (વહીવટ) (જુયા ખાલી)	(૧) વહીવટને લગતી બાબતો (૨) કર્મચારીઓની વ્યવસ્થા, પ્રશ્નો અને નિરાકરણ (૩) સેવાઓની સંપૂર્ણ દેખરેખ અને માર્ગદર્શન (૪) કર્મચારીઓની શિસ્ત વર્તણૂક અને અનિયમિતતા સંદર્ભે ઈન્કવાયરી અંગેની તમામ બાબતો (૫) કોર્ટ કચેરીમાં ચાલતા કેસો અને વકીલોને પૂરી પાડવાની માહિતી (૬) સ્ટાફ ટ્રેનિંગને લગતી બાબતો (૭) કર્મચારીઓની રજા, પેશગી, મેડીકલ, પગાર, છ.પી.એઝ., વીમો, ઈન્કમટેક્ષ જેવી તમામ બાબતો (૮) અંદાજપત્ર અને નાણાંકીય બાબતો (૯) પ્રિ-ઓડિટ અને આવેલા વાંધાઓને લગતી બાબતો (૧૦) ભવન વિસ્તરણ અને આનુષાંગિક બાબતો (૧૧) મેન્ટેનન્સ સંબંધી તમામ બાબતો (૧૨) સ્ટાફ વેલ્ફેર અંગેની બાબતો (૧૩) શાખા પુસ્તકાલયો (૧૪) માહિતી અધિકાર (૧૫) નાગરીક અધિકાર (૧૬) મહિલા વિભાગ (૧૭) બાળકિશોર વિભાગ (૧૮) પ્રતિલિપી સેવા (ઝેરોક્ષ), લેમિનેશન (૧૯) જાળવણી અને નિભાવ (૨૦) વાર્ષિક વહીવટી અહેવાલ (૨૧) વર્ગાકરણ (૨૨) અનુલય સેવા (૨૩) ગ્રંથ સંસ્કરણ (૨૪) ડિજિટલ લાયબ્રેરી ઓનલાઈન સેવાઓ (૨૫) ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવેલ અન્ય બાબતો	(૧) જાહેર માહિતી અધિકાર અંગે આપેલ માહિતીની ફાઈલોનો રેકર્ડ (૨) વાર્ષિક અહેવાલ, અંદાજપત્ર (૩) પ્રો-એક્ટિવ ડિસ્કલોગર (૪) ખાતાકીય તપાસ - ઈન્કવાયરી રિપોર્ટ (૫) અ.મ્યુ. કોર્પો. વહીવટી નાણાંકીય સરક્યુલરોની ફાઈલ અને સ્ટાફ સરક્યુલર

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
3.	સહાયક ગ્રંથપાલ (ટેકનીકલ/કોમ્પ્યુટર) (જગ્યા ખાલી)	(૧) કોમ્પ્યુટર અને સંલગ્ન બાબતો (૨) ટેકનિકલ કામગીરીની બાબતો (૩) કોમ્પ્યુનિકેશન (૪) પરિગ્રહણ શાખા (૫) બાઈન્ડિંગ અંગેની તમામ બાબતો (૬) ઈ-બુક્સ ઈ-જર્નલ્સ (૭) ઓનલાઈન લાયબ્રેરી સર્વિસીઝ (૮) એજયુકેશનલ એન્ડ વોકેશનલ ગાઈડન્સ (૯) ઈન્ફર્મેશન ટેકનોલોજી (૧૦) રેફરન્સ સેવાઓ (૧૧) રેડી રેફરન્સ સેવાઓ (૧૨) વિસ્તારણ સેવાઓ (૧૩) પુસ્તકાલયની આંકડાકિય માહિતી (૧૪) વગ્કિરણ, (૧૫) ગ્રંથાલય સંસ્કાર (૧૬) આર્ટ એન્ડ પિક્ચર ગેલેરી (૧૭) ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તેવી બાબતો (૧૮) માહિતી અધિકાર	

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - આધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૪.	સહાયક ગ્રંથપાલ (શાખા પુસ્તકાલયો) (જુયા ખાલી)	(૧) શાખા પુસ્તકાલયોનું સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા (૨) પુસ્તકાલયો (શાખા)ની સેવાઓની બાબતો (૩) વર્ગાકારકા - અનુલય સેવાઓ (૪) વિસ્તરણ સેવાઓ (૫) શાખા પુસ્તકાલયોના નવીન આયોજનો અને વિકાસ અંગેની બાબતો (૬) ગ્રંથ સંસ્કરણના કાર્યો (૭) શાખા પુસ્તકાલયો અને વાચનાલય (૮) આંકડાકીય માહિતી અંગેની બાબતો (૯) ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તેવી બાબતો	(૧) રિપ્લેસ બુક રજીસ્ટર (૨) દૈનિક વર્તમાનપત્ર નોંધણી રજીસ્ટર (૩) સામાયિક નોંધણી કાર્ડ / રજીસ્ટર (૪) ટેલિફોન બિલ નોંધણી રજીસ્ટર (૫) ઈશ્યુ થયેલ પુસ્તકોનું વર્ગાકૃત રજીસ્ટર (૬) સભ્યપદ અરજિફોર્મ (૭) સામાયિક વાઉચર નોંધણી રજીસ્ટર

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - આધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૫.	જુ. સહાયક ગ્રંથપાલ	(૧) વર્ગાકરણ (૨) પુસ્તક આપ-લે વિભાગ (૩) સભ્યપદ નોંધણી વિભાગ (૪) સામયિક વિભાગ અને વાચનાલય (૫) ગ્રંથભંડાર - સુપરવિઝન (૬) તમામ વિભાગોનું સુપરવિઝન (૭) ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તેવી બાબતો (૮) શાખા પુસ્તકાલયો / વાચનાલયો  નોંધ :- સહાયક ગ્રંથપાલની ત જગા ખાલી હોવાથી તે તમામ કામગીરીનો ચાર્જ જુનિયર સહાયક ગ્રંથપાલશ્રીને આપેલ છે.	-

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - આધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૬.	ટેકનિકલ આસીસ્ટન્ટ (૨ જગ્યા ખાલી)	(૧) વર્ગિકરણ (૨) ગ્રંથસંસ્કરણ (૩) ગ્રંથ ગોઠવણી (૪) અનુલય સેવા - ત્વરિત સંદર્ભ સેવા - રેડી રેફરન્સ (૫) માહિતી સેવા (૬) પુસ્તક, વાચન અને વાચક સેવાઓ (૭) ન્યુ એરાઇવલ્સ (પુસ્તકો રીલીઝ કરવા) (૮) ગ્રંથભંડાર નિરીક્ષણ અને કંટ્રોલ (૯) ગ્રંથભંડારમાંથી બુક રિડિંગ અંગેની બાબતો (૧૦) અન્ય સંસ્થામાંથી આવતા વિદ્યાર્થીઓને પુસ્તકાલયની મુલાકાત માહિતી આપવી. (૧૧) ગ્રંથપાલશ્રી તરફથી સંંપવામાં આવે તેવી બાબતો.	રીલીઝ કરવામાં આવેલ પુસ્તકોનું રજીસ્ટર

# શોઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - આધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૭.	જૂનિ. ટેકનિકલ આસી.	(૧) વર્ગાકરણ (૨) ગ્રંથસંસ્કરણ (૩) ગ્રંથ ગોઠવણી (૪) અનુલય સેવા - ત્વરિત સંદર્ભ સેવા - રેડી રેફરન્સ (૫) માહિતી સેવા (૬) પુસ્તક, વાચન અને વાચક સેવાઓ (૭) ન્યુ એરાઇવલ્સ (પુસ્તકો રીલીઝ કરવા) (૮) ગ્રંથભંડાર નિરીક્ષણ અને કંટ્રોલ (૯) ગ્રંથભંડારમાંથી બુક રિડિંગ અંગેની બાબતો (૧૦) અન્ય સંસ્થામાંથી આવતા વિદ્યાર્થીઓને પુસ્તકાલયની મુલાકાત માહિતી આપવી.  (૧૧) ગ્રંથપાલશ્રી તરફથી સંંપવામાં આવે તેવી બાબતો  નોંધ :- ૧ જૂનિ. ટેક.આસી.ને સર્વેયરની તમામ ફરજો આપેલ છે.	રીલીઝ કરવામાં આવેલ પુસ્તકોનું રજીસ્ટર

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૮.	ઓફિસ સુપ્રિટેન્ડન્ટ (જગ્યા ખાલી)	<p>(૧) પુસ્તકાલયના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ કર્મચારીઓની સેવાકીય તમામ બાબતો હેડકલાર્ક મારફતે કરાવવી. (૨) તમામ વિભાગોની વહીવટી વ્યવસ્થાકીય બાબતો સંભાળવાની રહેશે. (૩) પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળે કરેલા ઠરાવોના અમલ અને ગ્રંથપાલશ્રી અને સહા. ગ્રંથપાલશ્રીના માર્ગદર્શન મુજબ પુસ્તકાલયનો વહીવટ અને વ્યવસ્થાકીય સંચાલનકીય કાર્યવાહી સંભાળવી (૪) પુસ્તકાલયના વહીવટી કામો સંભાળતા કર્મચારીઓને તેઓના કામમાં માર્ગદર્શન આપવું અને વહીવટી કામગીરી કરાવવી. (૫) પુસ્તકાલયમાં કર્મચારીઓની મુશ્કેલીઓ સાંભળી તેમની રૂબરૂમાં સમજણ આપવી. યોગ્ય નિકાલ માટે માર્ગદર્શન આપવું (૬) એસ્ટાભીશમેન્ટને લગતી બાબતો, બિલકલાર્ક, સિનિયર કલાર્ક અને હેડકલાર્ક કરેલી કાર્યવાહીની ચકાસણી કરવી (૭) પુસ્તકાલયનો પ્રા-ઓડિટ વિભાગ, મેન્ટેનન્સ વિભાગમાં કરેલી કાર્યવાહીની ચકાસણી કરવી (૮) જી.પી.એફ., રોસ્ટર અંગેની કામગીરીઓની ચકાસણી તેમજ માર્ગદર્શન આપવું (૯) પુસ્તકાલયના કર્મચારીઓના જુદી જુદી કોર્ટો, ટ્રીબ્યુનલો, તપાસપંચો, કચેરીઓમાં દાખલ થયેલા કે દાખલ કરવાના દાવાઓ જેવી આનુષાંગિક બાબતો સંભાળવી (૧૦) અ.ભ્ય. કોર્પો. તરફથી પુસ્તકાલયમાં આવતા જરૂરી તેમજ અગત્યના પરિપત્રોમાં વહીવટના સંદર્ભમાં અમલ કરાવવાની કાર્યવાહી કરવી (૧૧) પુસ્તકાલયના કર્મચારીઓની જે તે વિભાગોમાં ગોઠવણી કરવા ઉપરાંત જરૂરિયાત સમયે વિભાગોની કામગીરી યોગ્ય રીતે ચાલે તે માટે કર્મચારીઓની ગોઠવણા, વ્યવસ્થા કરવી. (૧૨) પુસ્તકાલયના વહીવટના સંદર્ભમાં તમામ પ્રકારનો પત્રવ્યવહાર કરવો (૧૩) એકાઉન્ટશ્રી ગેરહાજરી દરમ્યાન તેમના વતી જે તે બિલોમાં સહી કરવાની તેમજ તેમની કામગીરી સંભાળવાની રહેશે. (૧૪) પુસ્તકાલયના ગ્રંથપાલશ્રી દ્વારા અન્ય જે પણ કામગીરી મૌખિક કે લેખિતમાં સોંપે તે કામગીરી કરવાની રહેશે. (૧૫) કોઈ મેટર</p> <p>ઉપરોક્ત તમામ બાબતો સહા. ગ્રંથપાલ વહીવટ મારફતે ગ્રંથપાલશ્રી સમક્ષ રજૂ કરવાની રહેશે.</p>	કર્મચારીઓ અને અન્ય પાર્ટીઓ સાથેની કોઈ મેટર સંબંધિત રેકર્ડ

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-ઓફિચિયલ ડિસ્કલોગર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૮.	એકાઉન્ટન્ટ	<p>(૧) પુસ્તકાલયની તમામ નાણાંકીય વ્યવસ્થા અને આનુષ્ઠાંકિક તમામ કામગીરી. (૨) પુસ્તકાલયનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવું. (૩) વાર્ષિક અંદાજપત્રને લગતી સંભવિત પ્રશ્નો અને ઉત્તરો તૈયાર કરવા. (૪) અંદાજપત્રના અનુસેધાનમાં દરરોજના જે તે ખર્ચના બિલો બંદેટ મુજબ ચેક કરવા અને તે અંગેની કાર્યવાહી કરવી. પુસ્તકાલયના તમામ પ્રકારના ખર્ચના ચેક, પ્રફાર્ટ ટેમજ રોકડથી બિલોનું પેમેન્ટ કરવું. (૫) ચેક થી થયેલા બિલોની નોંધ તૈયાર કરવી. (૬) દર માસે તેમજ અ. મ્યુ. કોપોરેશનના સરક્યુલરો પ્રમાણો પુસ્તકાલયના શિર્યુલ કર્મચારીઓ/રોજંદા કર્મચારીઓને પગાર તેમજ અન્ય રકમની ચૂકવણી કરવી. (૭) રોજંદા ખર્ચના રોકડ વાઉચર, તથા નોંધ વાઉચર ઉપરથી ખતવજી કરવી. (૮) માસિક કાચુ સરવૈયુ તૈયાર કરવું તેમજ આવક-જાવક તેમજ કેશલો તૈયાર કરવો. (૯) દરમાસે મેળવવાની થતી ગ્રાન્ટ અંગે જરૂરી કાર્યવાહી કરવી. (૧૦) બેંકના હિસાબો રાખવા, બેંકોના તમામ ખાતા પુસ્તકાલયની ખાતાવહી સાથે દરમાસે મેળવવા. (૧૧) ઇન્વેસ્ટમેન્ટ અંગેની તમામ જવાબદારી સંભાળવી જેમકે રોકાણ, વ્યાજ, પુન:રોકાણ અંગે જુદીજુદી બેંકોમાં રૂબરૂ જરૂરી કાર્યવાહી કરવી. (૧૨) એકાઉન્ટને લગતી તમામ પ્રકારના રજીસ્ટરો, પેટા રજીસ્ટરો જેવા કે અનપેચ્છિ પગાર, કોન્ટ્રાક્ટ ડિપોઝીટ, ઓડિટોરીયમ ડિપોઝીટ, ઇન્વેસ્ટમેન્ટ રજીસ્ટર, ચેકબુક રજીસ્ટર વિગેરે લગતી કામગીરી કરી, વાર્ષિક રીપોર્ટ તૈયાર કરવો. (૧૩) વર્ષના અંતે તમામ રજીસ્ટરોની મેળવણી કર્યાબાદ પાછુસરવૈયુ તૈયાર કરવું. (૧૪) રોજંદા ચેક પેમેન્ટ બિલોનું ચેકથી પેમેન્ટ કરવા, ચેકબુકમાં મેયરશી અથવા સે.ક્રમિટીના ચેરમેનશી અને ગ્રંથપાલ પાસે ચેકબુકમાં સહીઓ લેવા માટે જરૂરી રેકોર્ડ સાથે લઈ જરૂરી રૂબરૂમાં બતાવવા. (૧૫) પુસ્તકાલયના એકાઉન્ટને લગતી તમામ ઓડિટ વાંધાઓનો સમયસર જવાબ તૈયાર કરી વાંધાઓનો નિકાલ સમયમર્યાદામાં થાય તેવી કાર્યવાહી કરવી. (૧૬) પુસ્તકાલયના કર્મચારીઓ/અધિકારીઓના ઇન્કમટેક્ષને લગતી તમામ બાબતો. (૧૭) પ્રિ-ઓડિટ, પુસ્તકાલયના તમામ વિભાગો દ્વારા થતી જરીદી, રીપેરીંગ તથા વહીવટને લગતી બાબતોના આવતા બિલોની મંજૂરી મેળવવી, મંજૂરી અંગેના વ્યવસ્થાપક મંડળના દરાવો, પાર્ટી સાથેની શરતો અનુસાર બીલો, મંજૂર થયાના પ્રમાણપત્રો, બીલના નાણાંની ચૂકવણી, સક્ષમ સત્તાની મંજૂરી, દરાવો અનુસારી ચકાસણી કરી વાઉચરો બનાવવા તેમજ બિલ રજીસ્ટરે નોંધી, પ્રિ-ઓડિટ-અમદાવાદ સુનિશ્ચિપલ કોર્પોરેશન માં રૂબરૂમાં પાસ કરવા લઈ જવા. આ બિલોમાં કોઈપણ ઓડિટ વાંધા આવે તો જે તે વ્યક્તિ/વિભાગ પાસે સ્પષ્ટતા થવા મોકલી આપવા અને સ્પષ્ટતા આવેથી પાસ થયા બાદ જે તે રજિસ્ટરે જમા લઈ જે તે વ્યક્તિ/વિભાગ તરફ નાણાંની ચૂકવણીના કાર્ય માટે મોકલવા અંગેની કાર્યવાહી કરવી. (૧૮) પુસ્તકાલયના વડા ગ્રંથપાલશી તરફથી નાણાંકીય બાબતો અને એકાઉન્ટને લગતી તમામ અન્ય જે પણ કામગીરી સૌંપવામાં આવે તે કામગીરીની સમયમર્યાદામાં કરવાની રહેશે.</p>	<p>(૧) હિસાબવહી રજીસ્ટર (૨) રોજમેળ (૩) પેમેન્ટ થયેલ કેશ વાઉચરની ફાઈલો (૪) પરચુરણ રસીદ બુકો (૫) બેંક પેમેન્ટ માટેના બેંક વાઉચર (૬) કેશ વાઉચર ફાઈલ (૭) નોંધવહી (૮) ખાતાવહી (૯) કર્મચારીઓ તેમજ પેન્શનરોને દરમાસે પેમેન્ટ કરવા માટેના બેંક સ્ટેટમેન્ટની ફાઈલ (૧૦) ઇન્વેસ્ટમેન્ટ બાબતે ડિપોઝીટની ફાઈલ (૧૧) પુસ્તકાલયના ટ્રાન્ઝિઝ તેમજ રજીસ્ટ્રેશનની ફાઈલ (૧૨) પુસ્તકાલયના બિલડીંગ ઇન્સ્યોરન્સ બાબતે પોલીસીની ફાઈલ (૧૩) એકાઉન્ટ વિભાગમાં આવતા સરક્યુલરોની ફાઈલ (૧૪) એકાઉન્ટ વિભાગને લગતી વ્ય. મં. ના ઠરાવ તેમજ કાર્યવાહીની ફાઈલ (૧૫) ઇન્વેસ્ટમેન્ટ રજીસ્ટર ગ્રાન્ટ રજીસ્ટર (૧૬) ટેન્ડર ડિપોઝીટ રજીસ્ટર (૧૭) કોન્ટ્રેક્ટ ડિપોઝીટ રજીસ્ટર (૧૮) ઓડિટોરીયમ ડિપોઝીટ રજીસ્ટર (૧૯) કેશ ફ્લો રજીસ્ટર (૨૦) ચેકબુક સ્ટેટબુક રજીસ્ટર (૨૧) અનપેડ પગાર અનપેડ પેન્શન રજીસ્ટર (૨૨) ટેમ્પરાની તસલમત રજીસ્ટર (૨૩) જે તે ડિપોઝીટ લેખ્સ રજીસ્ટર (૨૪) માસિક હિસાબો તથા સરવૈયા રજીસ્ટર (૨૫) પુસ્તકાલયના વાર્ષિક હિસાબો તથા વાર્ષિક સરવૈયા રજીસ્ટર (૨૬) પુસ્તકાલયના કર્મચારીઓના પોફેશનલ ટેક્ષ તેમજ ઇન્કમટેક્ષની રકમ બેંકમાં જમા કરવામાં આવેલ છે તે અંગેની ફાઈલ (૨૭) કર્મચારીઓના ઇન્કમટેક્ષની વાર્ષિક રીટર્ન ફાઈલ (૨૮) પુસ્તકાલયની વાર્ષિક મંજૂર થયેલ ગ્રાન્ટ પેકી દર માસે કેશફ્લો મુજબ મેળવવાની ગ્રાન્ટની ફાઈલ</p>

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૦.	હેડકલાર્ક (મહિલા/બા.કિ.વ.) (જીવ્યા ખાલી)	(૧) મહિલા વિભાગ (૨) બાળકિશોર વિભાગ (૩) બાળ વાચન અને વિસ્તરણ સેવાઓ (૪) ગ્રંથ પ્રાપ્તિ અને આયોજન (૫) મહિલા વિદ્યાર્થી વાચન સેવાઓ (૬) ગ્રંથ ગોઠવણી (૭) સામયિક પ્રાપ્તિ અને આનુષાંગિક બાબતો (૮) રેફરન્સ વિભાગ (૯) ગ્રંથ મેળવણી (૧૦) વર્ગાકરણ (૧૧) સંદર્ભ સેવાઓ (૧૨) ગ્રંથ સંસ્કરણ (૧૩) ગ્રંથપાલશ્રી તરફથી સાંપવામાં આવે તેવી બાબતો	

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૧.	હેડકલાર્ક (વહીવટી શાખા)	<p>(૧) અસ્ટાબિલસમેન્ટ વિભાગમાં બનતા તમામ પ્રકારના પગારબિલો, પુરવણી બિલો, જી.પી.એફ.એડવાન્સ ચુકવણીના બિલો, તથા અન્ય પેશગીઓ અંગેના બિલોની ચકાસણી કરવી અને તે અંગેની નોંધો જે તે અધિકૃત રેકૉર્ડ રખાયાની ખાતી કરી પાસ થયા બાદ ચુકવણી થાય તે જોવું.</p> <p>(૨) પુસ્તકાલયના તમામ કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ અને તે માટે અપાયેલા અભિપ્રાય તપાસવા. રજા માટે ભલામણો કરવી અને સર્વિસબુકમાં શિડ્યુલ નોટેડ, રજુસ્ટરે રખાયેલા રજાના રેકૉર્ડ બારાબર છે કે કેમ તેની ખાતરી કરી ચેક કરવો. (૩) પુસ્તકાલયમાં હેડકલાર્ક કક્ષાએ વહીવટ અને વ્યવસ્થાને લગતી તમામ બાબતોનો પત્રવ્યવહાર કરવો. (૪) પુસ્તકાલયમાં વહીવટી રેકૉર્ડની જગ્યાની કરવી અને ખાતાના વડા અથવા સક્ષમ સત્તા મંજૂરી સિવાય બહાર ન જાય તે જોવું જ્યારે પણ કોઈપણ માહિતી અથવા ડેક્યુમેન્ટ માંગે ત્યારે તે પુરુ પાડવાની કામગીરી કરવી. (૫) પુસ્તકાલયના કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી / બઢતી અંગે ભારત સરકાર અને રાજ્ય સરકારના નિતી નિયમો અનુસાર રોસ્ટર અંગેની કાર્યવાહી અને તેને આનુભાગિક તમામ બાબતો. (૬) પુસ્તકાલયના કાયમી / રોજંદા કર્મચારીઓના મજૂર કમિ., લેબર કોર્ટ, ઈન્કવાયરી અંગે ચાલતા કેસો અને અન્ય કોર્ટના કેસોનો અભ્યાસ કરી જરૂરી માહિતી તેયાર કરવી, માર્ગદર્શન આપવુ, મેળવવું તેમજ કોર્ટેમાં હાજરી આપવી. (૭) પુસ્તકાલયની તમામ જગ્યાઓના ભરતીના નિયમો તથા સિનીયોરીટી લીસ્ટ તેયાર કરવું. (૮) પુસ્તકાલયના ગ્રંથપાલ વહીવટી અને વ્યવસ્થાકીય અન્ય કોઈપણ બાબતોની કામગીરી મૌખિક કે લેખિત સોંપે તે કામગીરી કરવાની રહેશે.</p> <p>(૯) પુરોક્ત તમામ બાબતો નોટીંગ (નોટીંગ) કરીને કાગળો સાથે ફાઈલો તેયાર કરી ઓફિસ સુપ્રિન્ટેન્ટ, સહાયક ગ્રંથપાલ (વહીવટ) મારફતે ગ્રંથપાલશ્રી સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવાની રહેશે.</p>	<p>(૧) રોસ્ટર રજુસ્ટરો</p> <p>(૨) રોસ્ટર અંગેના જે તે ખાતે લખેલ પત્રોની ફાઈલ</p> <p>(૩) અ.ભ્ય. કોર્પો.ના વહીવટી સરક્યુરોની ફાઈલ</p> <p>(૪) ઓડિટેબલ રેકૉર્ડની સિક્કા બુક</p> <p>(૫) રોજગાર નિયામકની કચેરી ખાતે લખેલ પત્રોની ફાઈલો</p>

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૨.	હેડ કલાર્ક (મેન્ટેનન્સ) (જગ્યા ખાલી)	<p>(૧) પુસ્તકાલયમાં તમામ પ્રકારના મેન્ટેનન્સ, રીપેરીંગ ખરીદી અંગેની જરૂરી કાર્યવાહી કરવી આ કામગીરી કરવા માટેના ભાવો મંગાવવા, ટેન્ડર ઈશ્યુ કરવા, તુલનાત્મકપત્રક તૈયાર કરવા, ખર્ચની મંજૂરી માટે જે તે કક્ષાએ રજૂ કરવા, મંજૂરી મેળવ્યા બાદ ખરીદી, રીપેરીંગ અને જાળવણી અંગેની કામગીરી કરવી, ખરીદેલી બાબત ડેડસ્ટોક રજીસ્ટરે જમા લેવા અને જે તે બકિટ/વિભાગને યોગ્ય સત્તાથી મંજૂરી મેળવી ફાળવણી કરવી. (૨) કન્ટીજન્સી આઈટમો, જમા-ઉધાર કર્યા અંગેની જરૂરી નોંધો જે તે રજીસ્ટરે રાખવી તથા તેના બેલેન્સ તૈયાર કરવા. (૩) જુની વપરાશમાં ન લઈ શકાય તેવી આઈટમોને રદ કરવા અંગેની કાર્યવાહી કરવી. જે તે સક્ષમ સત્તા સમક્ષ રીપોર્ટ તૈયાર કરી રજૂ કરવા, રદ થયા પછી કન્ડમ રજીસ્ટરે જમા લેવડાવી અને તેના નિકાલ અંગેની કાર્યવાહી કરવી મંજૂરી મેળવી ભાવો મંગાવી વેચાણ કર્યા બાદ આવકની રકમ જે તે વિભાગમાં જમા કરાવવી. (૪) પુસ્તકાલયમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ પ્રકારની સ્ટેશનરી, પ્રિન્ટિંગ મટીરીયલ્સ તથા પ્રિન્ટિંગ અંગેની તમામ કામગીરી. (૫) મેન્ટેનન્સને લગતો સમગ્ર પત્રવ્યવહાર કરવો, અને મેન્ટેનન્સ ને લગતી તમામ ફાઈલોની જાળવણી કરવી. મેન્ટેનન્સને લગતી તમામ બાબતોના બિલોની ચુકવણી કરવા અંગેની કાર્યવાહી કરવી. (૬) પુસ્તકાલયમાં જુદા-જુદા વિભાગોમાં ઈન્ટિરીયર ડેકોરેશનને લગતી તમામ બાબતો. (૭) પુસ્તકાલયમાં તમામ વિભાગોની સફાઈ, જરૂરિયાત અનુસાર વિભાગોને બદલવા, જરૂરી ફન્ચિયર, રેકૉર્ડ ખેડેડ્વો અને ગોઠવવા અંગેની બાબતો. (૮) પુસ્તકાલય ભવન વિસ્તરણ, અન્ય સુવિધાઓ અને વ્યવસ્થાકીય આનુષ્ઠાનિક તમામ બાબતો સંભાળવી. પુસ્તકાલયના તમામ સાધન સામગ્રીની ચીજવસ્તુઓની જાળવણી અને તે અંગેની તમામ કાર્યવાહી કરવી. (૯) શાખા પુસ્તકાલયોની મેન્ટેનન્સ અંગેની તમામ બાબતો સંભાળવી અને તેને આનુષ્ઠાનિક તમામ કામગીરી કરવી. (૧૦) પુસ્તકાલયના વડા ગ્રંથપાલશ્રી મેન્ટેનન્સ, સંબંધી અન્ય કોઈપણ વ્યવસ્થાકીય કામગીરી સોંપે તે કામગીરી આપને કરવાની રહેશે.</p> <p>ઉપરોક્ત તમામ બાબતો નોટીંગ (રીપોર્ટિંગ) કરીને મૂળ કાગળો સાથે ફાઈલ તૈયાર કરી ઓફિસ સુપ્રિટેન્નટ, સહાયક ગ્રંથપાલ (વહીવટ) મારફતે ગ્રંથપાલશ્રી સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવાની રહેશે.</p>	<p>(૧) ડેડ સ્ટોક રજીસ્ટર (૨) કન્ટીજન્સી રજીસ્ટર (૩) કન્ટીજન્સી ઈશ્યુ રજીસ્ટર (૪) કન્ડમ રજીસ્ટર (૫) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલય વિજયનગર સિક્યુરિટી સર્વિસ અંગે વાર્ષિક કોન્ટ્રાક્ટ ફાઈલ (૬) ટેલિફોન રજીસ્ટર (૭) વિજળી રીપેરીંગ કામગીરી અંગે રજીસ્ટર (૮) પુસ્તકાલયના એ.સી. મશીન, વોટર ફુલર, એરોક્ષ મશીન રીપેરીંગ તેમજ સર્વિસ અંગેની કોન્ટ્રાક્ટ ફાઈલ (૯) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયમાં પ્રિન્ટિંગની કામગીરી અંગે વાર્ષિક કોન્ટ્રાક્ટની ફાઈલ (૧૦) પુસ્તકાલયના મેન્ટેનન્સ અને રીપેરીંગ અંગેના કામોની ફાઈલો (૧૧) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયમાં વિજળી રીપેરીંગ કામગીરી અંગેની ફાઈલ (૧૨) પુસ્તકાલયના ઈન્ટરકોમ રીપેરીંગ તેમજ સર્વિસીંગ અંગેની ફાઈલ (૧૩) પુસ્તકાલયના ભવન વિસ્તરણની ફાઈલ (૧૪) શાખા પુસ્તકાલયના પ્લેશન તેમજ ગ્રાન્ટ અંગેના પત્રવ્યવહારની ફાઈલ (૧૫) સેન્ટ્રલ સ્ટોર્સની સ્ટેટમેન્ટ મુજબ મંજૂર થયેલ કન્ટીજન્સીની ફાઈલ (૧૬) મેન્ટેનન્સ વિભાગને લગતી વ્યવસ્થાપક મંડળના ઠરાવોની ફાઈલ (૧૭) અ.ભ્યુ. કોર્પો.ના મેન્ટેનન્સ વિભાગને લગતી સરક્યુલરની ફાઈલ (૧૮) ઈન્ડેન્ટ બુક</p>

# શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૩.	<p>પરિગ્રહણ વિભાગ  હેડ કલાર્ક (જગ્યા ખાલી)  જૂનિ. ટેક.આસી.  એટેન્ડન્ટ લાયબ્રેરી  ડાઈવર(કુલ ૩) (૨ ખાલી જગ્યા)</p>	<p>૧. પુસ્તક ખરીદી અને અંગેની તમામ બાબતો - ટેન્ડર, તુલનાત્મક પત્રક, પુસ્તક પસંદગી સમિતિ સમક્ષ રજૂ કરવા, પત્ર વ્યવહાર, એપ્રુવલ, ચકાસણી, પુસ્તક-ઓર્ડર, ભૌતિક ચકાસણી, પુસ્તક કિંમત, બીલોની ચકાસણી, બીલ અનુસાર પુસ્તકોની ગોઠવણી, એક્સેશન, પુસ્તકો ટેકનિકલ વિભાગમાં મોકલવા, બીલોની ચૂકવણી, પ્રી-ઓર્ડિટ વાંધાઓનો નિકાલ, ઓર્ડિટ વાંધાઓ, ભેટ પુસ્તકો, અગ્રથ સામગ્રીની નોંધણી, પરિગ્રહણ પત્રકમાં નોંધણી, પરિગ્રહણ પત્રકમાં વર્ગીકૃત નંબરો નોંધવા ૨. પુસ્તક ખરીદી અંગેની આંકડાકીય માહિતી ૩. વર્ગીકરણ માટે ટેકનીકલ વિભાગને મોકલવી ૪. આંકડાકીય માહિતી તૈયાર કરવી ૫. પુસ્તક ખરીદી અંગેના ઠરાવો લખવા ૬. સહાયક ગ્રંથપાલ સાથે સંપર્કમાં રહી આ વિભાગની સેવાઓ અસરકારક બનાવવી. ૭. ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તે તમામ બાબતો.</p> <p>પુસ્તકોનું પેસ્ટીંગ તેમજ બારકોડીંગ કરાવવું</p>	<p>(૧) પરિગ્રહણ રજીસ્ટર (૨) બિલબુક રજીસ્ટર (૩) એપ્રુવલ રજીસ્ટર (૪) ભેટ આવેલા પુસ્તકોનું રજીસ્ટર (૫) ટેકનિકલ કામગીરી માટે આપવામાં આવતા પુસ્તકોની નોંધણીનું રજીસ્ટર (૬) વેપારીઓના ભાવોનું તુલનાત્મક પત્રકની ફાઈલ (૭) પુસ્તક પસંદગી સમિતિના એજન્ડાની ફાઈલ (૮) પુસ્તક પસંદગી સમિતિના ઠરાવોની ફાઈલ (૯) મંજૂર થયેલા વેપારીઓના ભાવો અંગેના ઠરાવોની ફાઈલ</p>

# શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૪.	સિનીયર કલાર્ક એસ્ટાબિલશમેન્ટ વિભાગ	<p>(૧) જનરલ પ્રોવિડન્ડ ફંડને લગતી બાબતો (૨) પેશગીઓ (૩) કર્મચારીઓના પગાર અંગેની બાબતો (૪) પગારધોરણના એવોઈ અંગેની માહિતી (૫) વહીવટી કામગીરી (૬) પેન્શન અંગેની બાબતો (૭) પગાર બીલો - પૂરવણી બીલો, એવોઈ તફાવતના બીલો, મોંઘવારી તફાવતના બીલો (૮) એલ.ટી.સી. (૯) રજા-પગાર (૧૦) નિવૃત્ત કર્મચારીઓની હેણી રકમ - ગ્રેજ્યુઝટી, પેન્શન, કોમ્પ્યુટર પેન્શન, રજા રૂપાંતર (૧૧) અવસાન પામેલા કર્મચારીઓના હેણાની આશ્રિતોને ચૂકવણી. (૧૨) કોર્ટ-કચેરીઓમાં ચાલતા કેસોમાં માહિતી પૂરી પાડવી (૧૩) વ્યવસાયવેરો (૧૪) કર્મચારીઓની અનામત જગ્યાઓ-રોસ્ટરો (૧૫) ઈન્કમટેક્ષ (૧૬) કર્મચારીઓની દરેક પ્રકારની રજાઓ (૧૭) ઓડિટ (૧૮) મેડીકલ - ટી.બી., મેટરનીટી, પેટરનીટી, ફેમીલી પ્લાનીંગ (૧૯) બીલ કલાર્ક તરીકેની કામગીરીમાં જરૂરી રજિસ્ટરો-પત્રકો તૈયાર કરવા-નોંધો કરવી. (૨૦) હેડ કલાર્ક અને સહાયક ગ્રંથપાલ (વહીવટ) સાથે સંપર્કમાં રહી નાણાંકીય અને વહીવટી કામગીરી વધુ કાર્યક્ષમ બને તેવા પ્રયત્નો કરવા. (૨૧) જી.પી.એફ. કપાત તથા એડવાન્સ કપાતના રજસ્ટરે, જમા-ઉધારના ડિસાબની ચકાસણી કરવી. (૨૨) નિવૃત્ત થતાં અથવા મરણ પામેલા કર્મચારીઓના કેસમાં તેઓને મળવાપાત્ર જે તે રકમોની ચૂકવણી નિયમ અનુસાર સમય મર્યાદામાં થાય તે અંગેની કાર્યવાહી કરવી. (૨૩) પુસ્તકાલયના કર્મચારીઓ, અધિકારીઓની સેવાકીય બાબતોમાં જરૂર પડે લેબર ઓફિસર અને લીગલ અને નાણાં ખાતાનો અભિપ્રાય મેળવવો અને આનુષાંગિક તમામ પ્રકારની કામગીરી કરવી. (૨૪) પુસ્તકાલયમાં ચાલુ નોકરી દરમાન અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને મળવાપાત્ર લાભો ચૂકવવા, રહેમરાહે નોકરી અંગેની તમામ બાબતો. (૨૫) પુસ્તકાલયના કર્મચારીઓના એસ.એલ.આર. તૈયાર કરાવવા અને ચકાસણી કરવા બાબતો. (૨૬) પુસ્તકાલયમાં જગ્યાઓ ઉભી કરવી, ભરતી કરવી તેમજ પગાર ધોરણો અંગેની તમામ માહિતી તૈયાર કરવી અને મંજૂરી અર્થે રજૂ કરવી. (૨૭) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયોમાં સફાઈ કામગીરી અંગે વાર્ષિક કોન્ટ્રાક્ટ ફાઈલ (૨૮) ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તેવી તમામ બાબતો. ઉપરાંત સર્વેયરની જગ્યા બંધ થવાથી ઈવેન્ટ પ્રોગ્રામરનો ચાર્જ સોંપવામાં આવેલ છે.</p>	<p>(૧) જનરલ પ્રો.ફંડ માસિક/વાર્ષિક રજસ્ટર (૨) જનરલ પ્રો.ફંડ એડવાન્સ રજસ્ટર (૩) ડી.એ.પી.એફ. ટેમજ એવોઈ તફાવતનું રજસ્ટર (૪) જનરલ પ્રો.ફંડનું સરવૈયા રજસ્ટર (૫) સ્ટાફ વેલ્ડેર ફંડ લોન રજસ્ટર (૬) કર્મચારીઓએ ઉપાડેલ જનરલ પ્રો.ફંડના અભિપ્રાયના ફોર્મની ફાઈલ (૭) નિવૃત્ત/રાજીનામું/મરણના જનરલ પ્રો.ફંડના ચૂકવેલ બીલોની ફાઈલ (૮) સ્ટાફ વેલ્ડેર ફંડ લોન મંજૂર થયેલ ફોર્મની ફાઈલ (૯) જી.પી.એફ. અંગેના સરક્યુ.ની ફાઈલ (૧૦) વર્ગ-૩/૪ના કર્મચારીઓના જ્યૂટીલીવની ફાઈલ (૧૧) એલઆઈસી/ઈન્કમટેક્ષ/સર્વિસ બોન્ડ/કર્મચારીઓની વધુ અભ્યાસ મેળવવા અંગેના બોન્ડની ફાઈલ (૧૨) પગારબીલના કોમ્પ્યુટર ડેટા અંગેની ફાઈલ (૧૩) ફેસ્ટીવલ / ફૂટ ગ્રેઇન / જીપીએફ એડવાન્સ, સ્ટાફ વેલ્ડેર લોન, એલ.આઈ.સી./હાઉસીંગ લોન અંગેની ફાઈલ (૧૪) ઉચ્ચતર પગારધોરણના રજસ્ટરની ફાઈલ (૧૫) અંદાજિત એસ્ટાબિલશમેન્ટ બજેટ શિયુલ (૧૬) પુસ્તકાલય તથા શાખા પુસ્તકાલયના હાજરી પત્રકો, પગારબીલો, પેન્શનરોના બિલો તથા પૂરવણી બિલો અને બિલો નોંધવાનું રજસ્ટર (૧૭) કર્મચારીઓની સિલેક્ટ ફાઈલ (૧૮) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયોમાં સફાઈ કામગીરી અંગે વાર્ષિક કોન્ટ્રાક્ટ ફાઈલ</p>

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૫.	સિનીયર કલાર્ક (મેન્ટેનન્સ વિભાગ)	<p>૧. કન્ટીજન્સી-સ્ટેશનરી-ડેસ્ટોક આઈટમોની ખરીદી.</p> <p>૨. ઈન્ટેન્ટ ભરવા.</p> <p>૩. બજારભાવે ખરીદી.</p> <p>૪. વાર્ષિક સ્ટેશનરી - કન્ટીજન્સીની જરૂરીયાત માટે ભાવો મંગાવવા.</p> <p>૫. કન્ટીજન્સી રજીસ્ટર, ડેડ સ્ટોક રજીસ્ટર નોંધણી.</p> <p>૬. પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયો/વાચનાલયોના મેન્ટેનન્સ અંગેની કાર્યવાહી.</p> <p>૭. પુસ્તકાલયમાં જુદા જુદા વિભાગોની જરૂરીયાત અનુસાર કન્ટીજન્સી સ્ટેશનરીની ખરીદી, ફાળવણી.</p> <p>૮. ઉપયોગમાં ન લઈ શકાય તેવી ડેસ્ટોક કન્ટીજન્સી આઈટમો પુસ્તકાલયના રેકૉર્ડ પરથી રદ કરાવવી.</p> <p>૯. પુસ્તકાલયમાં ભંગાર જેવી હાલતમાં પડી રહેલી વસ્તુઓની હરાજ કરી નિકાલ કરવો.</p> <p>૧૦. પુસ્તકાલય ભવન અને આનુષ્ઠાનિક તમામ મેન્ટેનન્સ.</p> <p>૧૧. પુસ્તકાલયભવનમાં સફાઈ, સ્વચ્છતા અને સુશોભનનું કાર્ય કરાવવું.</p> <p>૧૨. પુસ્તકાલયના વિકાસમાં વિસ્તરણ અંગેના સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની કામગીરી.</p> <p>૧૩. ગ્રંથપાલશ્રીની સૂચનાથી અન્ય જે પણ કામગીરી સૌંપવામાં આવે તે કામગીરી સંભાળવાની રહેશે.</p>	<p>(૧) ડેડ સ્ટોક રજીસ્ટર (૨) કન્ટીજન્સી રજીસ્ટર</p> <p>(૩) કન્ટીજન્સી ઈશ્યુ રજીસ્ટર (૪) કન્ડમ રજીસ્ટર</p> <p>(૫) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલય વિજયનગર સિક્યુરિટી સર્વિસ અંગે વાર્ષિક કોન્ટ્રાક્ટ ફાઈલ (૬) ટેલિફોન રજીસ્ટર (૭) વિજળી રીપેરીંગ કામગીરી અંગે રજીસ્ટર</p> <p>(૮) પુસ્ત.ના એ.સી. મશીન, વોટર કુલર, એરોક્ષ મશીન રીપેરીંગ તેમજ સર્વિસ અંગેની કોન્ટ્રાક્ટ ફાઈલ</p> <p>(૯) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયમાં પ્રિન્ટિંગની કામગીરી અંગે વાર્ષિક કોન્ટ્રાક્ટની ફાઈલ (૧૦) પુસ્તકાલયના મેન્ટેનન્સ અને રિપેરીંગ અંગેના કામોની ફાઈલો (૧૧) પુસ્તકાલયમાં શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે ફોટોગ્રાફ, વિડિયોગ્રાફી કરાવવા અંગેની વાર્ષિક ફાઈલ (૧૨) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયમાં વિજળી રીપેરીંગ કામગીરી અંગેની ફાઈલ (૧૩) પુસ્તકાલયના ઈન્ટરકોમ રીપેરીંગ તેમજ સર્વિસીંગ અંગેની ફાઈલ (૧૪) પુસ્તકાલયના ભવન વિસ્તરણની ફાઈલ (૧૫) શાખા પુસ્તકાલયના પણેશન તેમજ ગ્રાન્ટ અંગેના પત્રવ્યવહારની ફાઈલ (૧૬) સેન્ટ્રલ સ્ટોર્સની સેટમેન્ટ મુજબ મંજૂર થયેલ કન્ટીજન્સીની ફાઈલ (૧૭) મેન્ટેનન્સ વિભાગને લગતા વ્યવસ્થાપક મંડળના ઠરાવોની ફાઈલ (૧૮) અ.ભ્ય. કોર્પો.ના મેન્ટેનન્સ વિભાગને લગતા સરક્યુલરની ફાઈલ (૧૯) ઈન્ટેન્ટ બુક</p>

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૧૬.	(સિનીયર કલાર્ક) (જગ્યા ખાલી) એકાઉન્ટ કેશિયર	<ol style="list-style-type: none"> <li>૧. પુસ્તકાલયમાં આવતી રોકડ આવક જાવકનો હિસાબ</li> <li>૨. રોજમેળ</li> <li>૩. કર્મચારીઓ-અધિકારીઓના પગાર, પૂરવણી બીલો, ઇ.પી.એફ., પેશાગીઓ, સ્ટાફ વેલફર, વાહન ખર્ચ જેવી ચૂકવણી</li> <li>૪. તાકિદની જરૂરિયાત અનુસાર રોકડ ખરીદીના બીલોની ચૂકવણી</li> <li>૫. એકાઉન્ટ વિભાગની જે પણ કામગીરી એકાઉન્ટન્ટ સોંપે તે કામગીરી કરવાની રહેશે</li> <li>૬. ગ્રંથપાલશ્રીના આદેશથી અન્ય જે પણ કામગીરી સોંપવામાં આવે તે કામગીરી કરવાની રહેશે.</li> </ol>	-

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૭.	સિનીયર કલાર્ક (જગ્યા ખાલી) સામયિક વિભાગ	<p>(૧) વાચનાલય વિભાગ</p> <p>(૨) સામયિક વિભાગ</p> <p>(૩) સામયિક નોંધણી</p> <ul style="list-style-type: none"> <li>- લવાજમ ભરવા-અંકો મેળવવા-પત્ર વ્યવહાર</li> <li>- સામયિક બાઈન્ડિંગ અંગે-વર્તમાનપત્રો-સામયિકોની ગોઠવણી-શાખા પુસ્તકાલયો, વિભાગોને અંકો મોકલવા</li> </ul> <p>(૪) વર્તમાનપત્રો-સામયિકના પસ્તીના વેચાણ અંગે</p> <p>(૫) વર્તમાનપત્રો-સામયિકો મંગાવવા માટે વેપારી પાસે ભાવપત્રક મંગાવવા તેમજ પુસ્તક પસંદગી સમક્ષ રજુ કરવા.</p>	<p>(૧) સામયિક લવાજમ રજીસ્ટર</p> <p>(૨) સામયિક બિલ નોંધણી રજીસ્ટર</p> <p>(૩) સામયિક ભેટ રજીસ્ટર</p> <p>(૪) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલય માટે મંગાવવામાં આવતા વર્તમાનપત્રો તેમજ સામયિકોના ટેન્ડરો તેમજ તુલનાત્મક પત્રકની ફાઈલ</p> <p>(૫) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયની પસ્તી વેચાણ અંગેની ફાઈલ</p> <p>(૬) પુ.પ.સ.ની મંજૂર થયેલ ગ્રાણ વર્ધની સામયિકોની યાદીની ફાઈલ</p> <p>(૭) પુસ્તકાલયમાં ન આવેલ સામયિકના રિમાઇન્ડર પત્રો અંગેની ફાઈલ</p> <p>(૮) સામયિક નોંધણી કાર્ડ</p> <p>(૯) મનીઓર્ડર કરેલા સામયિકોની વિગત અંગેની ફાઈલ</p> <p>(૧૦) વેપારીઓના આવેલ પત્રોની ફાઈલ</p>

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૮.	સિનીયર કલાર્ક રિન્યુઅલ/આપલે વિભાગ	(૧) સભ્યપદ નોંધણી કરવી (૨) સભ્યપદ અરજફોર્મ અંગેની બાબતો (૩) સભ્યપદ વર્ગીકરણ કરવું (૪) સભ્યપદ આઈકર્ડ બનાવવા (૫) સભ્યપદ લવાજમનો છિસાબ કરવો (૬) સભ્યપદ અંગેનો વાર્ષિક અહેવાલ બનાવવો (૭) સભ્યપદ મેળવવા વાચકોને માહિતી આપવી (૮) આપ-લે વિભાગની આંકડાકીય માહિતી (૯) અતિદેય અંગેની બાબતો (૧૦) રજીસ્ટરો-પત્રકોમાં નોંધણી (૧૧) પુસ્તક નુકસાની દંડ વસુલાત અંગેની બાબત (૧૨) વાચકો દ્વારા ખોવાયેલા પુસ્તકો બાબત (૧૩) પુસ્તક કિંમત રીકવરી બાબત (૧૪) આપ-લે વિભાગમાં ખોવાયેલ પુસ્તકની ટિકીટો અંગે તુલ્યિકેટ ટિકિટ આપવા બાબત. (૧૫) આંતર ગ્રંથાલય લેવડ દેવડ બાબત (૧૬) જમા ન થયેલા પુસ્તકો અંગે સભ્યો તેમજ જામીનદારોને પત્રવ્યવહાર (૧૭) કલેઇમકાર્ડ અંગેની બાબતો (૧૮) સહાયક ગ્રંથપાલના સંપર્કમાં રહી આ વિભાગની સેવાઓ અસરકારક બની રહે તે પ્રકારની કામગીરી (૧૯) પુસ્તકાલયના ગ્રંથપાલશ્રી અને સહાયક ગ્રંથપાલશ્રી (વહીવટ) અન્ય જે પણ કામગીરી સોંપે તે કામગીરી કરવાની રહેશે.	(૧) છિસાબની નોટબુક, સભ્યપદ નોંધણી, અરજીપત્રક સ્ટોક, સભ્યવર્ગીકૃત, સભ્યપદ રેકર્ડ, અનામત પુસ્તક રજીસ્ટર (૨) સભ્યપદ અરજફોર્મ (૩) અગત્યના પત્રોની ફાઈલ (૪) સભ્યપદ લવાજમ પહોંચબુકો (૫) બુક રિપેસ, સભ્યને/ જામીનદારોને બાકી પુસ્તક જમા કરાવવા અંગે પત્ર લખવા અંગેનું, કલેઇ-કાર્ડ તેમજ તે અંગેના રજીસ્ટરો (૬) છિસાબની નોટબુક (૭) ખોવાયેલ ટીકીટો તુલ્યિકેટ બનાવી આપવાની અરજ અંગેની ફાઈલ (૮) પોસ્ટેજ તેમજ અતિદેય એકાઉન્ટ વિભાગ ખાતે જમા કરાવેલ પહોંચની ફાઈલ

# શેઠ માણોકલાલ જેઠામાઈ પુસ્તકાલય

અદિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૮.	(૧) જુનિ.કોમ્પ્યુટર કમ કલાર્ક (૨ જગા ખાલી) કુલ-૩ જગા	<ol style="list-style-type: none"> <li>૧. પુસ્તકાલયનો ઉપયોગ કરતા ઉપભોક્તા અને વાચકોની માહિતીની તેટા એન્ટ્રી કરવી.</li> <li>૨. પુસ્તકાલયમાં સંગ્રહ પામેલી વાચન સામગ્રીની વર્ગીકૃત સૂચી-ગ્રંથનામ, લેખક, વિષય અનુસાર કોમ્પ્યુટરમાં તેટા એન્ટ્રી કરવી.</li> <li>૩. મા.જે. પુસ્તકાલય અને શાખા પુસ્તકાલયોની માહિતીની તેટા એન્ટ્રી કરવી.</li> <li>૪. પુસ્તકાલયની વહીવટી, ટેકનીકલ, નાણાંકીય, નીતિ વિષયક બાબતોની માહિતી કોમ્પ્યુટરમાં ફીડ કરવી, નકલો કાઢી આપવી.</li> <li>૫. કર્મચારીઓને કોમ્પ્યુટર અંગેની જાણકારી આપવી.</li> <li>૬. પુસ્તકાલયની આંકડાકીય માહિતીની તેટા એન્ટ્રી કરવી.</li> <li>૭. કોમ્પ્યુટર વિભાગમાં જરૂરી સોફ્ટવેર, પ્રોગ્રામ્સ અંગેની કાર્યવાહી કરવી.</li> <li>૮. ગ્રંથપાલશીના આદેશથી અન્ય જે પણ કામગીરી સૌંપવામાં આવે તે કામગીરી કરવાની રહેશે.</li> </ol>	

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૨ - આધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૨૦.	મશીન ઓપરેટર (જગ્યા ખાલી)	<ol style="list-style-type: none"> <li>૧. ઇલેક્ટ્રોનિક મશીનોની સંભાળ</li> <li>૨. મેન્ટેનન્સ વિભાગ મારફતે ભરામતકામ અને વાર્ષિક કોન્ફ્રેક્ટ</li> <li>૩. મશીનોની ટેકનિક અને મિકેનિઝ્મનો અભ્યાસ કરી ઓપરેટ કરવા</li> <li>૪. મશીનો ચાલુ હાલતમાં રાખવા</li> <li>૫. કર્મચારીઓ અને વાયકોને જેરોક્ષ સેવાઓ પૂરી પાડવી</li> <li>૬. સાહિત્યિક - સાંસ્કૃતિક પ્રોગ્રામમાં આ ઉપકરણનો ઉપયોગ કરવો અને તે સંબંધી બાબતો</li> <li>૭. ટોકિંગ લાયબ્રેરી અને પ્રતિલિપિ સેવા સંભાળવી</li> <li>૮. ચાલુ હાલતમાં ન હોય તેવા મશીનોનો નિકાલ કરવા જરૂરી કાર્યવાહી કરવી</li> <li>૯. મશીન ચાલુ રાખવા જરૂરી સાધન સામગ્રી, સ્ટેશનરી મેળવવા કાર્યવાહી કરવી</li> <li>૧૦. વાયક સેવાઓ પૂરી પાડવી</li> <li>૧૧. ડેક્ક્યુમેન્ટેશન અને રેફરન્સ સેવાઓની કામગીરી સંભાળવી</li> <li>૧૨. પુસ્તકાલય ભવનનું સુશોભન</li> <li>૧૩. ગ્રંથપાતશી તરફથી સોંપવામાં આવે તેવી બાબતો</li> </ol>	(૧) પુસ્તકાલયના ઉપયોગ અર્થે અને વાયકોને કાઢી આપેલ જેરોક્ષ અંગેનું રજીસ્ટર

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - આધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૨૧.	પ્રી-ઓડિટ વિભાગ એટેન્ડન્ટ લાયબ્રેરી	૧. ઈભ્રેશ કેશના બિલો બનાવવા ૨. પુસ્તકાલયમાં આવેલ પુસ્તકો ખરીદીના બિલો બનાવવા ૩. જે તે બિલો કપાત નીતિ વિષયક બાબતોના વાંધા, રજી. એડી યાદી જે તે વિભાગના જવાબ રજી. માં નોંધી પાસ કરાવવા મોકલવા ૪. ઈભ્રેશના સંદર્ભમાં આવેલ બિલો તેમજ પરચૂરણ ખર્ચના બિલો બનાવી ઓડિટ ખાતે મોકલવા ૫. પ્રો-પાસ કરેલ બિલોની માહિતી રાખી જે તે ઠરાવો થયા બાદ ઓડિટ ખાતે મોકલવા ૬. પોસ્ટેજ ટીકીટો ખરીદી રજી. નોંધી બિલો બનાવવા ૭. ઈ.પ્રેશ ખાતે કરેલા ખર્ચ ઈ. કેશ રજી. બનાવી બિલો બનાવવા ૮. મેડિકલ રીએમ્બર્સના બિલો બનાવવા ૯. બહાર ખાતે આવેલ પત્રોનું ઈન્વર્ક કરવું ૧૦. વિભાગને લગતા બ્ય. મંડળના ઠરાવોની ફાઈલ રાખવી ૧૧. ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તેવી તમામ બાબતો.	(૧) ગ્રંથાલય ઠરાવ બુક (૨) બજેટ બુક (૩) જાવક રજીસ્ટર (૪) પોસ્ટેજ રજીસ્ટર (૫) પ્રી-ઓડિટ રજીસ્ટર (૬) ઈભ્રેશ કેશ રજીસ્ટર (૭) ઈન્વર્ક રજીસ્ટર (૮) પ્રી-ઓડિટ વાંધાનું રજીસ્ટર (૯) મેડિકલ રીએમ્બર્સમેન્ટ રજીસ્ટર (૧૦) પ્રી-ઓડિટને લગતા બ્ય. મંડળના ઠરાવની ફાઈલ

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - આધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૨૨.	એટેન્ડન્ટ લાયબ્રેરી (બાઈન્ડિંગ વિભાગ)	<p>૧. ગ્રંથભંડારમાંથી આવેલ ફાટી ગયેલ કે ઉપયોગમાં ન આવી શકે તેવા જે તે પુસ્તકો બાઈન્ડિંગ માટે તેમજ રદ કરવા માટે અલગ કરવા</p> <p>૨. બાઈન્ડિંગ અંગેના પુસ્તકોની નોંધ ટ્રીપ્લિકેટ રજીસ્ટરમાં કરી તેના પાના પ્રમાણે બંડલો બનાવવા</p> <p>૩. વર્ષ દરમ્યાન જુદા જુદા પ્રકારના પુસ્તકો બાઈન્ડિંગ કામ અંગે જે તે વેપારીઓ પાસે કામ કરાવા માટે ભાવ મંગાવવા તેમજ જે તે આવેલ ભાવો મંજૂર કરવા માટે વ્યવસ્થાપક મંડળ સમક્ષ રજૂ કરવા</p> <p>૪. જે તે માન્ય બાઈન્ડરને પુસ્તકો બાઈન્ડિંગ કરાવવા માટે ઓર્ડર આપવો અને બાઈન્ડિંગ માટે પુસ્તકો આપવા.</p> <p>૫. બાઈન્ડિંગ થઈને પુસ્તકો પરત આવે ત્યારે આપેલ ઓર્ડર મુજબ પરત આવેલ પુસ્તકો ચકાસવા</p> <p>૬. બાઈન્ડિંગ થઈને આવેલ પુસ્તકોનું જે બીલ આવ્યું હોય તેની ચૂકવણી અંગેની કામગીરી કરવી</p> <p>૭. રદ કરવા યોગ્ય પુસ્તકોનું ટ્રીપ્લિકેટ રજીસ્ટરમાં નોંધ કરવી</p> <p>૮. રદ થયેલ પુસ્તકોને જે તે સંસ્થાઓએ પુસ્તકોની માંગણી કરી હોય તેમણે ગ્રંથપાલશ્રીના આદેશ મુજબ બાઈન્ડિંગ તેમજ રદની પ્રક્રિયા અનુસારિક પત્ર વ્યવહાર કરવો.</p> <p>૯. ગ્રંથપાલશ્રી તરફથી સૌંપવામાં આવે તેવી તમામ બાબતો.</p>	<p>(૧) પુસ્તકાલયના જુદા જુદા વિભાગોના પુસ્તકો તેમજ સામયિકો બાઈન્ડિંગ કરાવવા માટે</p> <p>(૨) સરક્યુલરથી ભાવો મંગાવવા માટેના પત્રોની ફાઈલ</p> <p>(૩) આવેલ ભાવોનું તુલનાત્મક પત્રક, મંજૂર થયેલ જે તે વેપારીના ભાવો, બ.મંડળના ઠરાવ અંગેની ફાઈલ</p> <p>(૪) પુસ્તકો બાઈન્ડિંગ કરાવવા માટે નોંધવામાં આવતું ટ્રીપ્લિકેટ બાઈન્ડિંગ રજીસ્ટર</p> <p>(૫) પુસ્તકો રદ કરવા માટે ટ્રીપ્લિકેટ રદ રજીસ્ટર</p> <p>(૬) રદ થયેલાં પુસ્તકોનું નોંધણી માટેનું રજીસ્ટર</p> <p>(૭) રદ થયેલાં પુસ્તકો ભેટ આપવા માટે અન્ય સંસ્થા દ્વારા આવેલ પત્રોની નોંધ માટેનું રજીસ્ટર</p> <p>(૮) ભેટ આપેલાં પુસ્તકો અંગેના પત્રોની ફાઈલ</p> <p>(૯) બાઈન્ડિંગ કરેલ પુસ્તકોના બિલો નોંધવાનું રજીસ્ટર</p> <p>(૧૦) વાંધા અંગેની ફાઈલ</p> <p>(૧૧) અગત્યના કાગળ અંગેની ફાઈલ</p>

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - આધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૨૩.	એટેન્ડન્ટ લાયબ્રેરી	<p>(૧) વર્ગાકરણ અનુસાર પુસ્તકો ગોઠવવા (૨) ગ્રંથભંડારમાંથી ૨૬-બાઈન્ડીંગ તેમજ ડોરમેટરી અંગેના પુસ્તકો અલગ કરવા (૩) વાચક સભ્યોને પુસ્તક શોધવામાં માર્ગદર્શન આપવું તેમજ પુસ્તકો શોધવામાં મદદ કરવી (૪) પુસ્તક આપ-લે વિભાગમાં પરત આવેલા પુસ્તકો ગ્રંથભંડારમાં લઈ જવા અને જે તે જગ્યાએ ગોઠવવા (૫) પુસ્તક આપ-લે વિભાગમાં પુસ્તકો ઈશ્યુ કરવા, પરત લેવા અને આવેલા જે તે અતિદેયનો હિસાબ કરવો (૬) સભ્યપદ નોંધણી અંગેની સમગ્ર કામગીરી સંભાળવી (૭) સામયિક-વર્તમાનપત્રોની નોંધણી, ગોઠવણી તેમજ પસ્તી વેચાણ અંગેની કામગીરી (૮) વાચનાલય વિભાગમાં આવતા વાચકોની માગણી મુજબ જૂના વર્તમાનપત્રો, સામયિકો જરૂરિયાત મુજબ શોધીને આપવા (૯) પુસ્તકાલયની સામાન્ય પ્રકારની તમામ સેવાઓ (૧૦) પુસ્તક ગોઠવણી માટેના ગાઈડ કાર્ડ, ગોઠવણીના ચાર્ટ અને વાચકોને માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા કરવી. (૧૧) સતત નિરીક્ષણ (૧૨) પુસ્તકો-સામયિકોની ભૌતિક ચકાસણી (ફીજીકલ વેરીફિકેશન) (૧૩) અનુલય સેવા/રેડી રેફરન્સ (૧૪) ગ્રંથભંડારના આંતરિક વિભાગની ગોઠવણી (૧૫) ટેઝસ્ટોક - સારસંભાળ (૧૬) સીનીયર કર્મચારીની અવેજીમાં વહીવટી અને નાણાંકીય સેવાઓ સંભાળવી (૧૭) ગ્રંથપ્રદર્શન માટે ગ્રંથભંડારમાંથી પુસ્તકો શોધવા અને ગોઠવવા (૧૮) પ્રચાર અને પ્રસારના કાર્યો (૧૯) ગ્રંથ સંસ્કરણના કાર્યો કરવા (પોઠ પછી, માથાપછી અને પુસ્તકના અંદરના ભાગે વર્ગાક-સ્થાનાંક વગેરે લખવા) (૨૦) ન્યુ એરાઇવલ્સ સેક્શનની ગોઠવણી (૨૧) પ્રિ-ઓડિટ વિભાગની કામગીરી (૨૨) પરિગ્રહણ વિભાગની કામગીરી (૨૩) ગ્રંથપાલશીના આદેશથી અન્ય જે પણ કામગીરી સોંપવામાં આવે તે અન્ય કામગીરી કરવાની રહેશે. (૨૪) પુસ્તક ટેટા એન્ટ્રી (૨૫) બારકોડ સ્પાઈન લેબલ લગાવવાની કામગીરી.</p>	-
	પટાવણા/ફરાસ	ગ્રંથ સંસ્કરણ (પેસ્ટીંગ, સિક્કા) કરવા.	

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૨૪.	<p>વાચનાલય વિભાગ</p> <p>એટેન્ડન્ટ લાયબ્રેરી</p> <p>પટાવાળા/ફરાસ</p>	<p>(૧) વાચનાલય વિભાગ  (૨) સામયિક વિભાગ  (૩) સામયિક નોંધણી <ul style="list-style-type: none"> <li>- લવાજમ ભરવા-અંકો મેળવવા-પત્ર વ્યવહાર</li> <li>- સામયિક બાઈન્ડિંગ અંગે-વર્તમાનપત્રો-સામયિકોની ગોઠવણી-</li> </ul> (૪) વર્તમાનપત્રો-સામયિકના પસ્તીના વેચાણ અંગે  (૫) વર્તમાનપત્રો-સામયિકો મંગાવવા માટે વેપારી પાસે ભાવપત્રક મંગાવવા તેમજ પુસ્તક પસંદગી સમિતી સમક્ષ રજુ કરવા.</p> <p>(૧) વાયકોને જૂના સામયિકો-વર્તમાનપત્રો (ફાઈલ) તેમની માંગણી મુજબ આપવા,  તેની વ્યવસ્થિત કમાનુસાર ગોઠવણી કરવી.  (૨) દૈનિક વર્તમાનપત્રો-સામયિકો વિભાગમાં ગોઠવવા.  (૩) દૈનિક વર્તમાનપત્રો-સામયિકોને વાયકો નુકશાન ન કરે તેની દેખરેખ રાખવી.</p> <p>(૧) દૈનિક વર્તમાનપત્રો તેમજ સામયિકો પર પુસ્તકાલયના સિક્કા લગાવવા.  (૨) વર્તમાનપત્રો-સામયિકોનું ફાઈલીંગ તેમજ પસ્તી વેચાણને આનુષાંગિક કામગીરી  (૩) વાચનાલય-સામયિક વિભાગમાં સફાઈકામ કરવું તેમજ ફર્નિચરની સફાઈ અને  ગોઠવણી કરવી.  (૪) ગ્રંથપાલશ્રી તેમજ સહા. ગ્રંથપાલશ્રી દ્વારા સોંપવામાં આવે તે કામગીરી.</p>	<p>(૧) સામયિક લવાજમ રજીસ્ટર  (૨) સામયિક બિલ રજીસ્ટર  (૩) સામયિક ભેટ રજીસ્ટર  (૪) સામયિકોના ટેન્ડરો તેમજ તુલનાત્મક પત્રકની ફાઈલ  (૫) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયની પસ્તી વેચાણ અંગેની ફાઈલ  (૬) મંજૂર થયેલ ત્રણ વર્ષની સામયિકોની યાદીની ફાઈલ  (૭) સામયિકના લવાજમની પહોંચ અંગેની ફાઈલ  (૮) પુસ્તકાલયમાં ન આવેલ સામયિકના રિમાઇન્ડર પત્રો અંગેની ફાઈલ  (૯) સામયિક નોંધણી રજીસ્ટર  (૧૦) મનીઓર્ડ કરેલા સામયિકોની વિગત અંગેનું રજીસ્ટર  (૧૧) વેપારીઓના આવેલ પત્રોની ફાઈલ</p>

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - આધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૨૫.	એટેન્ડન્ટ લાયબ્રેરી (રિન્યુઅલ વિભાગ)	૧. સત્યપદ નોંધણી કરવી ૨. વિશિષ્ટ તેમજ સ્માર્ટ કાર્ડ બનાવવા ૩. સત્યપદ વર્ગાકરણ કરવું ૪. સત્યપદ આઈકાર્ડ / કાર્ડ બનાવવા ૫. સત્યપદ લવાજમનો હિસાબ કરવો ૬. સત્યપદ અંગેનો વાર્ષિક અહેવાલ બનાવવો ૭. સત્યપદ મેળવવા વાયકોને માહિતી આપવી ૮. ગ્રંથપાલશ્રી તેમજ સહાયક ગ્રંથપાલશ્રી દ્વારા સોંપવામાં આવે તે કામગીરી કરવાની રહેશે.	(૧) હિસાબની નોટબુક (૨) સત્યપદ નોંધણી રજીસ્ટર (૩) સત્યપદ રેકર્ડ રજીસ્ટર (૪) અનામત પુસ્તક રજીસ્ટર (૫) અગત્યના પત્રોની ફાઇલ

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - આધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૨૬.	<p>આપ-લે વિભાગ</p> <p>એટેન્ડન્ટ લાયબ્રેરી</p>	<p>૧. આપ-લે વિભાગની આંકડાકીય માહિતી</p> <p>૨. અતિદેય અંગેની બાબતો</p> <p>૩. રજીસ્ટરો-પત્રકોમાં નોંધણી</p> <p>૪. પુસ્તક નુકસાની દંડ વસુલાત અંગેની બાબત</p> <p>૫. વાયકો દ્વારા ખોવાયેલા પુસ્તકો બાબત</p> <p>૬. પુસ્તક કિંમત રીકવરી બાબત</p> <p>૭. આંતર ગ્રંથાલય લેવડ હેવડ બાબત</p> <p>૮. જમા ન થયેલા પુસ્તકો અંગે સત્યોને પત્રવ્યવહાર</p> <p>૯. કલેઇમકાર્ડ અંગેની બાબતો</p> <p>૧૦. સહાયક ગ્રંથપાલના સંપર્કમાં રહી આ વિભાગની સેવાઓ અસરકારક બની રહે તે પ્રકારની કામગીરી</p> <p>૧૧. પુસ્તકાલયના ગ્રંથપાલશ્રી અને સહાયક ગ્રંથપાલશ્રી (વહીવટ) અન્ય જે પણ કામગીરી સોંપે તે કામગીરી કરવાની રહેશે.</p>	<p>(૧) છિસાબની નોટબુક</p> <p>(૨) બુક રિપ્લિક રજીસ્ટર</p> <p>(૩) સત્યને બાકી પુસ્તક જમા કરાવવા અંગે પત્ર લખવા અંગેનું રજીસ્ટર</p> <p>(૪) કલેઇ-કાર્ડ તેમજ તે અંગેનું રજીસ્ટર</p> <p>(૫) પોસ્ટેજ તેમજ અતિદેય એકાઉન્ટ વિભાગ ખાતે જમા કરાવેલ પહોંચની ફાઈલ</p>

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - આધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૨૭.	એટેન્ડન્ટ લાયબ્રેરી ગ્રંથભંડાર રેફરન્સ વિભાગ	(૧) વર્ગાકિરણ અનુસાર પુસ્તકો ગોઠવવા (૨) ગ્રંથભંડારમાંથી રદ-બાઈન્ડિંગ તેમજ ડોરમેટરી અંગેના પુસ્તકો અલગ કરવા (૩) વાચક સત્યોને પુસ્તક શોધવામાં માર્ગદર્શન આપવું તેમજ પુસ્તકો શોધવામાં મદદ કરવી (૪) પુસ્તક આપ-લે વિભાગમાં પરત આવેલા પુસ્તકો ગ્રંથભંડારમાં લઈ જવા અને જે તે જગ્યાએ ગોઠવવા (૫) પુસ્તક આપ-લે વિભાગમાંથી આપવામાં આવતા કલેઇંગ કાર્ડ અંગેના પુસ્તકો ગ્રંથભંડારમાંથી શોધવા (૬) પુસ્તકાલયની સામાન્ય પ્રકારની તમામ સેવાઓ (૭) પુસ્તક ગોઠવણી માટેના ગાઈડ કાર્ડ, ગોઠવણીના ચાર્ટ અને વાચકોને માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા કરવી. (૮) સતત નિરીક્ષણ (૯) અનુલય સેવા/રેડી રેફરન્સ (૧૦) ગ્રંથભંડારના આંતરિક વિભાગની ગોઠવણી (૧૧) ગ્રંથપ્રદર્શન માટે ગ્રંથભંડારમાંથી પુસ્તકો શોધવા અને ગોઠવવા (૧૨) પ્રચાર અને પ્રસારના કાર્યો (૧૩) ગ્રંથ સંસ્કરણના કાર્યો કરવા (પીઠ પછી, માથાપછી અને પુસ્તકના અંદરના ભાગે વર્ગાક-સ્થાનાંક વર્ગેરે લખવા) (૧૪) ન્યુ એરાઈવલ્સ સેક્શનની ગોઠવણી (૧૫) ગ્રંથપાલશ્રીના આદેશથી અન્ય જે પણ કામગીરી સોંપવામાં આવે તે અન્ય કામગીરી કરવાની રહેશે.	-

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૨૮.	શાખા પુસ્તકાલયો એટેન્ડન્ટ લાયબ્રેરી	(૧) વર્ગાકરણ અનુસાર પુસ્તકો ગોઠવવા (૨) ગ્રંથભંડારમાંથી રદ-બાઈન્ડિંગ તેમજ ડોરમેટરી અંગેના પુસ્તકો અલગ કરવા (૩) વાયક સભ્યોને પુસ્તક શોધવામાં માર્ગદર્શન આપવું તેમજ પુસ્તકો શોધવામાં મદદ કરવી (૪) પુસ્તક આપ-લે વિભાગમાં પરત આવેલા પુસ્તકો ગ્રંથભંડારમાં લઈ જવા અને જે તે જગ્યાએ ગોઠવવા (૫) પુસ્તક આપ-લે વિભાગમાંથી આપવામાં આવતા કલેઇમ કાર્ડ અંગેના પુસ્તકો ગ્રંથભંડારમાંથી શોધવા (૬) પુસ્તકાલયની સામાન્ય પ્રકારની તમામ સેવાઓ (૭) પુસ્તક ગોઠવણી માટેના ગાઈડ કાર્ડ, ગોઠવણીના ચાર્ટ અને વાયકોને માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા કરવી. (૮) સતત નિરીક્ષણ (૯) અનુલય સેવા/રેડી રેફરન્સ (૧૦) ગ્રંથભંડારના આંતરિક વિભાગની ગોઠવણી (૧૧) ગ્રંથપ્રદર્શન માટે ગ્રંથભંડારમાંથી પુસ્તકો શોધવા અને ગોઠવવા (૧૨) પ્રચાર અને પ્રસારના કાર્યો (૧૩) ગ્રંથ સંસ્કરણના કાર્યો કરવા (પીઠ પદ્ધી, માથાપદ્ધી અને પુસ્તકના અંદરના ભાગે વર્ગાક-સ્થાનાંક વર્ગેરે લખવા) (૧૪) ન્યુ એરાઈવલ્સ સેક્શનની ગોઠવણી (૧૫) ગ્રંથપાલશ્રીના આદેશથી અન્ય જે પણ કામગીરી સાંપ્રવામાં આવે તે અન્ય કામગીરી કરવાની રહેશે.	(૧) છિસાબની નોટબુક, સભ્યપદ નોંધણી, સભ્યવગ્નિકૃત, સભ્યપદ રેકર્ડ, અનામત પુસ્તક રજીસ્ટર (૨) દૈનિક ઈશ્યુ, અતિદેય, અતિદેય સ્ટોક, આજીવન પુસ્તક ઈશ્યુ, મ્યુ. કાઉ. તેમજ મ્યુ. અધિકારીશ્રીઓને પુસ્તક ઈશ્યુ કરવા માટેનું, સંસ્થાકીય/વ્યક્તિગત અધિકારીઓને પુસ્તક ઈશ્યુ કરવા માટેનું, બુક રિપ્લેસ, સભ્યને / બાકી પુસ્તક જમા કરાવવા અંગે પત્ર લખવા અંગેનું, (૩) ડયુ-ટેટ નોટબુક (૪) છિસાબની નોટબુક (૫) પોસ્ટેજ તેમજ અતિદેય એકાઉન્ટ વિભાગ ખાતે જમા કરાવેલ પહોંચની ફાઈલ

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - આધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૨૮.	ટાઈપીસ્ટ	<ol style="list-style-type: none"><li>પુસ્તકાલયમાં ટાઈપ અંગેની તમામ કામગીરી કોમ્પ્યુટર દ્વારા કરવી.</li><li>પુસ્તકોના આદેશો તેમજ તમામ પ્રકારનો પત્ર વ્યવહાર.</li><li>પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળના કામો, એજન્ડા, ઠરાવો ટાઈપ કરવા અંગેની કામગીરી.</li><li>પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં કોમ્પ્યુટર ઉપર ટાઈપ અંગેનું કામ કરવાનું રહેશે અને જરૂરી નકલો મેળવી આપવાની રહેશે.</li><li>ગ્રંથપાલશ્રીના આદેશથી અન્ય જે પણ કામગીરી સોંપવામાં આવે તે તમામ કામગીરી કરવી.</li></ol>	

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૩૦.	મ્યુઝિયમ એટેન્ડન્ટ	<ol style="list-style-type: none"><li>પુસ્તકાલયમાં આર્ટ અને પિકચર ગેલેરીની સેવાઓ.</li><li>પેપર કલીપિંગ અને ગોઠવણી.</li><li>ગ્રંથ પ્રદર્શન સેવાઓ.</li><li>રેડી રેફરન્સ સર્વિસીઝ.</li><li>અનુલયસેવા - માહિતી સેવા.</li><li>આર્ટ અને પિકચર્સના ઉપકરણોની સારસંભાળ.</li><li>પુસ્તકાલયભવન સુશોભન સેવાઓ.</li><li>ગ્રંથપાતલશીની સુચનાથી અન્ય જે પણ કામગીરી સોંપવામાં આવે તે તમામ કામગીરી.</li></ol>	<p>(૧) પેપર કલીપિંગ અંગેની ફાઈલ</p> <p>(૨) અમદાવાદ/સ્થાનિક ઇતિહાસ અંગેના પુસ્તકોની યાદી</p>

# શેર માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૩૧.	ઇવેન્ટ પ્રોગ્રામર (ખાલી જગ્યા)	૧. કાર્યક્રમો - સાહિત્યિક - સાંસ્કૃતિક - બાળ કિશોરના કાર્યક્રમો ૨. પત્રવ્યવહાર ૩. પ્રેસ ૪. પ્રોગ્રામ રજિસ્ટરો-પત્રકો ૫. કાર્યક્રમ માટે જરૂરી સાધન સામગ્રી ૬. નાણાંકીય બાબતો ૭. ઓડિટોરીયમ હોલ ૮. કાર્યક્રમાં ભાગ લેનાર વ્યક્તિઓ - વ્યક્તિ, સંસ્થાના નામ, સરનામા, ટેલીફોન નંબરો - શ્રોતાઓના રસના વિષયો સાથે નામ, સરનામા, ટેલીફોન નંબરો. ૯. પ્રાસંગિક પ્રદર્શનો - આર્ટ - પુસ્તકો ૧૦. સુશોભન ૧૧. ગ્રંથપાલશ્રી તરફથી સૌંપવામાં આવે તેવી તમામ બાબતો.	(૧) કાર્યક્રમો અંગેની માહિતીનું રજીસ્ટર (૨) ઓડિટોરીયમ ભાડે આપવાની માહિતીનું રજીસ્ટર (૩) ફોટો રજીસ્ટર (૪) સ્વાગત તેમજ પુરસ્કાર અંગે લાવેલ પુસ્તકોનું જમા રજીસ્ટર (૫) કાર્યક્રમો અંગેની ફાઈલ (૬) પ્રેસનોટ અંગેની ફાઈલ (૭) પત્રવ્યવહારની ફાઈલ (૮) ઓડિટોરીયમ ફોર્મની ફાઈલ (૯) અગત્યના કાગળોની ફાઈલ (૧૦) ગુજરાતમાં આવેલા પુસ્તકાલયોની યાદીની ફાઈલ (૧૧) ખ્રુ. કાઉન્સિલરશ્રીની યાદીની ફાઈલ (૧૨) સાહિત્યકારો/લેખકો/કવિમિત્રોના નામ સરનામાની તેમજ ફોર્મની ફાઈલ (૧૩) પુસ્તકાલયમાં શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે ફોટોગ્રાફ, વિડિયોગ્રાફી કરાવવા અંગેની વાર્ષિક ફાઈલ

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો  
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૩૨.	વર્ગ-૪ નાયક પટાવાળા ફરાસ પાણીવાળા બહેન સફાઈ કામદાર	<ol style="list-style-type: none"> <li>પુસ્તકાલયમાં ફર્નિચરની સફાઈ</li> <li>પુસ્તકાલયમાંથી ખ્ય. કોરોરેશન કે અન્ય સ્થળે ટપાલ લઈ જવાનું કામ, સામયિક મેગેઝીનનું લવાજમ ભરવાનું કે પોસ્ટ ઓફિસમાં મનીઓર્ડર કરવા અંગે.</li> <li>નવા આવતા પુસ્તકોના ગ્રંથસંસ્કાર - પેસ્ટિંગ, સિક્કા મારવા અંગેનું કામ</li> <li>પુસ્તકાલયના જે તે વિભાગમાંથી પુસ્તકો લાવવા તેમજ લઈ જવા, ફાઈલીંગ કરવું. જે તે રેકૉર્ડની વ્યવસ્થિત ગોઠવણી કરવી.</li> <li>પુસ્તકાલયના ગ્રંથપાલશ્રી તેમજ સહાયક ગ્રંથપાલશ્રીના આદેશ મુજબ જે તે કામગીરી કરવાની રહેશે.</li> </ol>	વર્ગ-૪ ના કર્મચારીઓનું ડયુટીલીવ રજીસ્ટર

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-ઓક્ટીવ ડિસ્કલોઝર નં. ૩  
દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત  
નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ

# શોઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નં. ૩

## નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ

૩:૧ અમદાવાદ ખ્ય. કોર્પોરેશન, સેન્ટ્રલ ઓફિસ, નાણાં ખાતુ અને અન્ય ખાતાઓએ નિયત કરેલ નિતીનિયમો અને કાર્યપદ્ધતિનો અમલ કરવામાં આવે છે.

૩:૨

૧. એ.એમ.સી. એક્ટ
૨. અ.ખ્ય.કોર્પો. મેન્યુઅલ
૩. મા.જે. પુસ્તકાલય ટ્રસ્ટ ડીડ
૪. મા.જે. પુસ્તકાલય નિયમાવલી

૩:૩ **NIL**

૩:૪ (૧) નિર્ણય લેવા માટે વહીવટી વિભાગમાં

- છેડકલાઈ
- ઓફિસ સુપ્રિ. / એકાઉન્ટન્ટ
- સહાયક ગ્રંથપાલ
- ગ્રંથપાલ
- અ.ખ્ય. કોર્પો.ના અધિકારીઓ / A.M.C. / Dy. M.C.
- વ્યવસ્થાપક મંડળ

(૨) પુસ્તક ખરીદી અંગે

- વિભાગ ઈન્ચાર્જ
- સહાયક ગ્રંથપાલ
- ગ્રંથપાલ
- પુસ્તક પસંદગી સમિતી

૩:૫ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

- અ.ખ્ય. કોર્પો. સ્ટેન્ડિંગ કમિટી
- અ.ખ્ય. કોર્પો. જનરલ બોર્ડ

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નં. ૪-૫

પુસ્તકાલયના કાર્યો બજાવવા નક્કી કરેલા ધોરણો તથા કાર્યો બજાવવા માટેના  
નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ, દફતરો

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

## પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નં. ૪-૫

પુસ્તકાલયના કાર્યો બજાવવા નક્કી કરેલા ધોરણો તથા કાર્યો બજાવવા માટેના  
નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ, દફ્તરો

- ૪ મા.જે. પુસ્તકાલય અંગે અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન મુજબની કાર્યપદ્ધતિ અનુસાર નિયત કરવામાં આવેલ ધોરણો તથા સેન્ટ્રલ ઓફિસ દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતી સ્થાયી સુચનાઓ મુજબના ધોરણો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે.
- ૫ : ૧ પુસ્તકાલયના કાર્યો બજાવવા માટે નીચે મુજબના નિયમો, વિનિમયો, સુચનાઓ, નિયમ સંગ્રહ અને દફ્તરોને અનુસરવામાં આવે છે.
- ૧-૧ : મા.જે. પુસ્તકાલય ટ્રસ્ટ ડીડ
- ૧-૨ : મા.જે. પુસ્તકાલય નિયમાવલી
- ૧-૩ : એ.એમ.સી. એક્ટ,
- અમદાવાદ મહાનગર પાલિકા, અમદાવાદ.
- ૧-૪ : અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન - મેન્યુઅલ
- અમદાવાદ મહાનગર પાલિકા, અમદાવાદ.
- ૧-૫ : નાણાં ખાતુ, સરક્યુલર નં. ૨૦ તા. ૨૧-૬-૮૮
- કર્મચારીની રજાઓ અંગેના નિયમો
- અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ.
- ૧-૬ : અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન
- સેન્ટ્રલ ઓફિસ, નાણાં ખાતુ અને અન્ય ખાતાઓએ
- નિયત કરેલ નીતિ-નિયમો અને કાર્ય પદ્ધતિનો અમલ કરવામાં આવે છે.

# શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલીસબ્રિજ, અમદાવાદ-૬.

સામાન્ય નિયમો

-: મા.જે. પુસ્તકાલય સંલગ્ન શાખા પુસ્તકાલયો તેમજ વાચનાલયોનો સમય :-

શેઠ માણોકલાલ જેઠામાઈ પુસ્તકાલય :

સવારના ૭.૩૦ થી સાંજના ૮.૦૦ (જાહેર રજા સિવાય)

- સામાન્ય વાચનાલય : સવારના ૭.૩૦ થી રાત્રે ૧૦.૦૦ કલાક

- શાનવિહાર વિદ્યાર્થી વાચનાલય : સવારના ૭.૩૦ થી રાત્રે ૮.૦૦ કલાક (જાહેર રજા સિવાય)

- વિદ્યાર્થીની વાચનાલય : સવારના ૭.૩૦ થી રાત્રે ૮.૦૦ કલાક (જાહેર રજા સિવાય)

- પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ શ્રાવ્ય વિભાગ : સોમવાર થી શનિવાર સવારના ૧૦.૩૦ થી સાંજના ૬.૧૦ કલાક  
(જાહેર રજા સિવાય)

ચંદ્રકાન્ત કેશવલાલ કસ્ટિયા ભ્યુ. પુસ્તકાલય - વિજયનગર :

સવારના ૭.૩૦ થી રાત્રે ૮.૦૦ (જાહેર રજા સિવાય)

કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહ ભ્યુ. પુસ્તકાલય - હિમતલાલપાઈ :

સવારના ૭.૩૦ થી રાત્રે ૮.૦૦ (જાહેર રજા સિવાય)

ગચ્છાધિપતિ આચાર્ય શ્રી સુબોધસાગર સુરિશ્વરજી મહારાજશ્રી શાખા પુસ્તકાલય - વાસણા :

સવારના ૭.૩૦ થી રાત્રીના ૮.૦૦ (જાહેર રજા સિવાય)

આત્મા સાયન્સ એન્ડ ટેકનોલોજી લાયબ્રેરી - મણીનગર :

સોમવાર થી શુક્રવાર સવારના ૭.૩૦ થી રાત્રીના ૮.૦૦ અને

શનિવારે સવારના ૭.૩૦ થી બપોરના ૨.૨૦ (જાહેર રજા સિવાય)

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી વાચનાલય - વેજલપુર :

સોમવાર થી શુક્રવાર સવારના ૧૦.૩૦ થી સાંજના ૬.૧૦ અને શનિવારે ૧૦.૩૦ થી ૨.૨૦ (જાહેર રજા સિવાય)

કવિશ્રી માણાભંડ પ્રેમાનંદ ભ્યુ. વાચનાલય - નરોડા :

સોમવાર થી શુક્રવાર સવારના ૧૦.૩૦ થી સાંજના ૬.૧૦ અને શનિવારે ૧૦.૩૦ થી ૨.૨૦ (જાહેર રજા સિવાય)

શામળ ભંડ ભ્યુ. વાચનાલય - અમરાઈવાડી :

સોમવાર થી શુક્રવાર સવારના ૧૦.૩૦ થી સાંજના ૬.૧૦ અને શનિવારે ૧૦.૩૦ થી ૨.૨૦ (જાહેર રજા સિવાય)

નોંધ : શેઠ મા.જે. પુસ્તકાલયનો સામાન્ય વાચનાલય વિભાગ મકરસંકાંતિ, ધૂળેટી, રક્ષાબંધન, દિવાળી, બેસતું વર્ષ તેમજ ભાઈબીજના તહેવારોમાં બંધ રહે છે.

## -: પુસ્તકાલયના નિયમો :-

૧. દરેક કોમ તથા ધર્મના માણસો પુસ્તકાલયનો લાભ લઈ શકશે, પરંતુ અવ્યવસ્થિત, અસ્થિર મગજના, નશામાં હોય તેવી કોઈ પણ વ્યક્તિને દાખલ થવા દેવામાં આવશે નહિ.
- નોંધ : આ સંબંધમાં ગ્રંથપાલની ગેરહાજરી દરમ્યાન તેમના મદદનીશનો નિર્ણય છેવટનો ગણાશે.
૨. પુસ્તકાલયમાં ધુમ્રપાન, ગુટકા ચાવવાની, થૂંકવાની કે મોટેથી વાત કરવાની સખત મનાઈ રહેશે. બીજા વાચક કે સભ્ય વાંધો ઉઠાવે તો તેવા સંજોગોમાં મૌન પાળવું આવશ્યક ગણાશે.
૩. પુસ્તકાલયનો લાભ લેવા આવનાર દરેકે દરવાજે પગી કાઉન્ટર પર રાખેલા પત્રકમાં પોતાનું નામ સ્પષ્ટ અક્ષરે લખવું પડશે. પુસ્તકાલયના નિયમો પાળવા પોતે કબૂલ થાય છે એવી ખાતરી આપેલી ગણાશે. પત્રકમાં પોતાનું નામ નહિ લખનારને દાખલ થવા દેવામાં આવશે નહિ તેમજ તે અંગેનો ગ્રંથાલયી અથવા તેમની ગેરહાજરી દરમ્યાન તેમના મદદનીશનો નિર્ણય છેવટનો ગણાશે.
૪. લાકડી, ઓવરકોટ, છત્રી, બેગ, થેલો, કોઈ પણ પ્રકારની થેલી, પુસ્તકો તથા બીજી એવી જે ચીજો પુસ્તક આપ-લે કરનાર કારકુન બહાર રાખવા જણાવે તે બહાર રાખ્યા પછી જ અંદર દાખલ થઈ શકશે. ગ્રંથાલયમાં ફરી દાખલ થવા ઈચ્છતા દરેક સભ્યે ઘેર વાંચવા માટે લીધેલાં પુસ્તકો બહાર મૂકીને જ અંદર આવવાનું રહેશે.
૫. કોઈપણ વાચક સભ્યને પ્રાણીઓ સાથે લઈ અંદર દાખલ થવા દેવામાં આવશે નહિ.
૬. પુસ્તકાલયમાં સંપૂર્ણ શાંતિ જાળવવી.
૭. નવાં પુસ્તકો મંગાવવા માટેની ડિમાન્ડ વાચકે પુસ્તક ખરીદી વિભાગમાં આપવી.
૮. પુસ્તકાલયના નિયમોનું પાલન નહિ કરનાર સભ્યના સભ્યપદનો ઉપયોગ ગ્રંથપાલ ગમે ત્યારે બંધ કરી શકશે, તેમજ તેમને પુસ્તકો આપવાની, વાચનાલય તથા અધ્યયન વિભાગનો ઉપયોગ કરવાની મનાઈ પણ કરી શકશે, પણ આવા સભ્યો અથવા વાચકો વ્યવસ્થાપક મંડળ સમક્ષ પોતાની હકીકતો રજૂ કરી ગ્રંથપાલના નિર્ણય સામે અપીલ કરી શકશે.
૯. પુસ્તકાલયમાં પુસ્તકો તથા બીજી માલમિલકતને નુકસાન કરવા બદલ તથા વાચનસામગ્રી ખોવા બદલ નુકસાન કરનાર જે તે વાચક સભ્ય જવાબદાર ગણાશે, અને તેમણે તે પુસ્તકાલયમાં નવાં વસાવી આપવાં પડશે. ખોવાયેલું પુસ્તક બજારમાં અલભ્ય હોય તો તે નવું ખરીદવા માટેની હાલની પૂરેપૂરી ઢોઢી કિંમત તથા તે મેળવવાનો ખર્ચ ભરપાઈ કરી આપવો પડશે અને જો આવું પુસ્તક મેળવવાનું અશક્ય થઈ પડશે તો ગ્રંથાલયી એવા પુસ્તકની જે કિંમત નક્કી કરે તે વાચક સભ્યે તાત્કાલિક ભરી દેવાની રહેશે. પુસ્તકાલયના એક આખા સેટમાંથી કોઈ પણ એક પુસ્તકને પણ નુકસાન કર્યું હશે અગર ખોવાયું હશે તો આખો સેટ નવો વસાવી આપવો પડશે. અથવા આખા સેટની હાલની ઢોઢી કિંમત ભરવાની રહેશે.

## -: અધ્યયન વિભાગ :-

૧૦. ગ્રંથપાલની પરવાનગી સિવાય ચિત્રો કે સ્કેચની પ્રતિકૃતિ કરી શકશે નહિ.
૧૧. પુસ્તકાલયના કોઈપણ પુસ્તક, સામયિક કે નકશા પર કોઈ જાતનું લખાણ લીટા કે નોંધ કરી નુકસાન કરી શકશે નહિ.
૧૨. ગ્રંથભંડારમાંથી કોઈપણ પુસ્તક અધ્યયન વિભાગમાં લઈ જવાશે નહીં.

૧૩. અધ્યયન વિભાગમાં કોઈ પણ વ્યક્તિને નોટબુક, ડાયરી તथા અન્ય કાગળો લઈ જવા દેવામાં આવશે. આ બાબતમાં ગ્રંથાલયી અથવા તેમની ગેરહાજરીમાં તેમના મદદનીશનો નિર્ણય છેવટનો તથા બંધનકર્તા ગણાશે.
૧૪. અધ્યયન વિભાગમાંથી બહાર જતાં પહેલાં વાચકોએ પુસ્તક, એટલાસ, સામયિક વગેરે જે કાઈ ઉપયોગ કરવા લીધું હોય તે અધ્યયન વિભાગમાં હાજર રહેલા પુસ્તકાલયના કર્મચારીને પાછુ સોંપવું અને તે અંગેની તે કર્મચારીને પરત આપ્યા અંગેની રજીસ્ટરમાં સહી લેવી. જો તે પ્રમાણે સહી લેવારો નહિ તો તેની જવાબદારી સત્યને શિરે રહેશે.
૧૫. ભારતીય સંસ્કૃતિ અને સત્યતાને અનુરૂપ વખ્ત પરિધાન માટે પ્રત્યેક મુલાકાતીને વિનંતી છે.

### -: પુસ્તક આપ-લે વિભાગ :-

૧૬. પુસ્તકાલયના સત્યોને જ પુસ્તકાલયની બહાર વાંચવા માટે પુસ્તકો આપી શકાશે. સત્ય થવા ઈચ્છનારે નક્કી કરેલા ફોર્મ ઉપર ઓનલાઈન અરજી કરવી પડશે. અરજી સાથે પોતાના રહેઠાણના પૂરાવો અને પાસપોર્ટ સાઈઝના ફોટો અપલોડ કરવા પડશે.
૧૭. પુસ્તકાલયમાં વાચક તરીકે સત્યપદ મેળવવા જે તે વાચકે નવીન દર મુજબ વાર્ષિક સત્યપદ ફી રૂ. ૫૦૦/- અને ડિપોઝિટ રૂ. ૧,૦૦૦/-, જ્યારે આજીવન સત્યપદ ફી રૂ. ૩,૦૦૦/- ઓનલાઈન ભરીને મેળવવાનું રહેશે.
૧૮. એક વર્ષ માટે સત્યપદ મેળવનાર વાચક સત્યને બે પુસ્તકો આપવામાં આવશે અને વાચકને એક સાથે બે પુસ્તકો વાંચવા મળી શકશે. વાચક સત્ય પુસ્તકો બહાર લઈ જવા માટેની અરજી કોઈ પણ કારણો જણાવ્યા સિવાય ગ્રંથપાલ નામંજૂર કરી શકશે. આજીવન વાચક સત્યને એક સાથે ચાર પુસ્તકો મેળવી શકશે.
૧૯. સત્યોને તેમના સ્માર્ટકાર્ડ ઉપર પુસ્તકો આપવામાં આવશે પણ જો ઠરાવેલી મુદ્દતની અંદર પુસ્તક પાછું નહિ આપવામાં આવ્યું હોય તો પુસ્તકનો અતિદેય તથા એને લગતી માહિતી આપવા માટે મોકલાવેલી સૂચનાનો ટપાલખર્ચ સત્ય પાસેથી વસૂલવામાં આવશે.
૨૦. કોઈ પણ સત્ય પોતાનું સ્માર્ટકાર્ડ બીજાને વાપરવા આપી શકશે નહિ.
૨૧. સામયિકો, શબ્દકોશ, વિશ્વકોશ, રેફરન્સ વિભાગ, રેડી રેફરન્સના પુસ્તકો તથા બીજા અધ્યયન વિભાગનાં પુસ્તકો પુસ્તકાલયની બહાર આપવામાં આવશે નહિ.
૨૨. માત્ર પુસ્તકાલયના સત્યોને જ પુસ્તક ભંડારમાં દાખલ થવા દેવામાં આવશે. પુસ્તકાલયમાં ઓનલાઈન કેટલોગ ઉપરથી પોતાને જોઈતા પુસ્તકો, વાચક જાતે ગ્રંથભંડારમાંથી શોધીને મેળવી શકશે.
૨૩. પુસ્તક લેતી વખતે એ સારી હાલતમાં છે કે નહિ તે સત્યે તપાસી લેવું અને જો સારી હાલતમાં ન હોય તો તે તરફ ગ્રંથપાલ અથવા તેમની ગેરહાજરીમાં તેમના મદદનીશનું ધ્યાન દોરવું. જો તે પ્રમાણે કરવામાં નહિ આવે તો પુસ્તક પાછું આપતી વખતે જે સ્થિતિમાં હશે તે સ્થિતિની જવાબદારી સત્યને શિરે રહેશે, અને તે અંગે ગ્રંથપાલ નક્કી કરે તે મુજબની નુકસાની ભરપાઈ કરી આપવી પડશે.
૨૪. સત્યોએ બદલાયેલા સરનામાની જાણ એક અઠવાડિયામાં પુસ્તકાલયમાં કરવાની રહેશે.
૨૫. વાંચવા લીધેલાં પુસ્તકોના તિથિપત્રકમાં છેલ્લે દશવેલી તારીખે મોડામાં મોડાં પુસ્તકાલયમાં આપી દેવાં જોઈશે. પુસ્તક વધારે દિવસ માટે રાખવું હોય તો તેની અગાઉની મુદ્દત પૂરી થયા પહેલાં તારીખ ફરી નોંધાવી જવાથી રિન્યુ કરી શકશે. જો કોઈ અન્ય સત્ય તરફથી બહાર ગયેલા પુસ્તક માટે માગણી થઈ હશે તો એ બીજી વાર મળશે નહી કે રિન્યુ થશે નહી. વળી કોઈ પણ પુસ્તક બીજી વાર નહી આપવાની સત્તા ગ્રંથપાલની રહેશે.

- ક. બહારગામ ગયેલા સભ્યો પોતાને નામે લીધેલાં પુસ્તકો પુસ્તકાલયમાં આવી બતાવ્યા સિવાય પુસ્તક જમા કરાવવાની મુદ્દત પૂરી થયા પહેલાં બહારગામથી પોસ્ટ દ્વારા ખબર આપી ફરીથી એક જ વાર ઠરાવેલી વધારાની મુદ્દત પૂરતાં પોતાની પાસે રાખી શકશે. મુદ્દત વધારી ન આપવાની સત્તા ગ્રંથપાલની રહેશે.
- ખ. તિથિપત્રકમાં છેલ્લી દર્શાવેલી તારીખની અંદર પુસ્તક પાછું આપવામાં નહિ આવે તો પ્રતિદિનનાં રૂ.૩.૦૦ પ્રમાણે દરેક પુસ્તક દીઠ અતિદેય લેવામાં આવશે. પરંતુ ગુણદોષ અને વિવેકબુદ્ધિને આધારે અંશતઃ અથવા સંપૂર્ણ અતિદેય માફ કરવાની તમામ સત્તા ગ્રંથપાલશ્રીને રહેશે.
- ગ. જે પુસ્તક માટે બીજા સભ્યોની લેખિત માગણી આવી હશે તે પુસ્તક જે સત્ય લઈ ગયા હશે તેમને તે પુસ્તક માટે નક્કી કરેલી મુદ્દતમાં પુસ્તકાલયમાં પાછું આપી જવાની સૂચના આપવામાં આવશે. પાછું ન આપી જનાર સત્ય પાસેથી તે મુદ્દત બાદ દરેક પુસ્તક દીઠ રોજના રૂ.૩.૦૦ પ્રમાણે અતિદેય લેવામાં આવશે.
- ઘ. પુસ્તક-અતિદેય વધારેમાં વધારે પુસ્તકની કિંમતની બમળી રકમથી વધારે લેવામાં આવશે નહિ.
૨૬. દરેક પુસ્તક, પુસ્તક આપ-લે કરનાર કર્મચારીને પાછું આપવું જોઈશે, અને પુસ્તકને નુક્સાન થયેલું માલૂમ પડશે તો પુસ્તક લઈ જનાર સત્યે તે નુક્સાન ભરપાઈ કરી આપવું પડશે, અથવા તો નવી નકલ અથવા નવો સેટ પૂરો પાડવો પડશે. નવું પુસ્તક અથવા નવો સેટ પૂરો પાડયેથી નુક્સાન પામેલું પુસ્તક અથવા સેટ લઈ જવાનો તે સત્યને હક્ક રહેશે. આવી બાબતોમાં પુસ્તકોની અને સેટની આવૃત્તિ અને પ્રકાશન-વર્ષનો આગ્રહ રાખવામાં આવશે.
- જે સત્યથી પુસ્તક ખોવાયું હોય તેઓ જો તે પુસ્તકની કિંમત, ગ્રંથપાલશ્રી નક્કી કરે તે ભરપાઈ કરી જશે તો તે તારીખથી તે પુસ્તક ઉપર અતિદેય ચડશે નહિ, પણ જો પુસ્તકાલયનું ખોવાઈ ગયેલું પુસ્તક ફરી મળી આવે અને પરત આપે તો તેના ઉપર આખા સમયને માટે અતિદેય લેવામાં આવશે. જો આ પુસ્તક સત્યે ભરેલી રકમમાંથી પુસ્તકાલયમાં મંગાવી લેવામાં આવ્યું હશે તો સત્યને પાછળથી મળેલું પુસ્તક સ્વીકારવામાં આવશે નહિ.
- સત્યથી ખોવાયેલા પુસ્તકની દોઢી કિંમત સત્ય દ્વારા ભરપાઈ થયા બાદ પુસ્તકની નવી નકલ જો પુસ્તકાલય દ્વારા મંગાવી લીધી હશે તો અથવા સેટના ખોવાઈ ગયેલા કોઈ પણ એક પુસ્તક બદલ આખો નવો સેટ પુસ્તકાલયે મંગાવી લીધો હશે તો આ સંજોગોમાં પુસ્તકાલયમાંથી એ પુસ્તક કે સેટ ઉપર પુસ્તકાલયની માલિકી રદ કર્યાનો સિક્કો મરાવી લેવો, જેથી ભવિષ્યમાં એ પુસ્તક કે સેટની માલિકીની બાબતમાં ગેરસમજ ઊભી ન થાય અને આ પુસ્તક અથવા સેટ વાચક સત્ય લઈ જઈ શકશે.
૨૭. પુસ્તકાલયમાંથી બહાર ગયેલાં પુસ્તકો પર પોતાનો હક્ક નોંધાવવા માટે સત્યોએ એક કાર્ડમાં પોતાને જોઈતા પુસ્તકની વિગતો નોંધી તેના પર પોસ્ટની ટિકિટ લગાવી પુસ્તક આપ-લે કરનાર કારકુનને તે કાર્ડ આપવું. પુસ્તક પુસ્તકાલયમાં પાછું આવ્યેથી તે બાબતની જાણ તે સત્યને ગ્રંથપાલ તરફથી આપવામાં આવશે, અને આ ખબરમાં જણાવેલી મુદ્દી એ પુસ્તક તે સત્યને માટે ગ્રાણ દિવસ રાખી મૂકવામાં આવશે.
૨૮. પુસ્તકાલયનું સત્યપદ ગમે ત્યારે ઓનલાઈન મેળવી શકશે અને તેની મુદ્દત જે દિવસે સત્ય બનશે તે દિવસથી લાગુ પડશે. આ નિયમ આજીવન વાચક સત્યોને લાગુ પડશે નહિ.
૨૯. પોતાના સ્માર્ટકાર્ડ ઉપર બહાર ગયેલાં પુસ્તકો તથા પુસ્તકાલયની લેણી પડતી રકમો અને સત્ય તરીકેનું સ્માર્ટકાર્ડ પાછું આપી જવામાં આવે નહિ ત્યાં સુધી સત્યોને પુનઃ સત્યપદ આપવામાં આવશે નહિ. જો કોઈ સત્ય પોતાનાં પુસ્તકો અથવા તો તેની દોઢી કિંમત પુસ્તકાલયમાં આપી નહિ જય તો પુસ્તકોની દોઢી કિંમત, તે અંગેનો અતિદેય, ટપાલખર્ચ વગેરેની જવાબદારી પોતાની રહેશે.

૩૦. જે સભ્યો સભ્ય તરીકે રહેવા નહિ માગતા હોય અથવા કાયમને માટે શહેર છોડી જવાના હોય તેમણે પોતાનું સ્માર્ટકાર્ડ પુસ્તકાલયમાં પાછુ આપી તે રદ કરવાનું; આમ ન કરવામાં આવે અને તેમના સ્માર્ટકાર્ડ ઉપર બીજા કોઈ પુસ્તકો લઈ જશે તો તેની જવાબદારી જે તે સભ્યની રહેશે.
૩૧. આજીવન સભ્યપદ ધરાવતો સભ્ય પોતાનું સ્માર્ટકાર્ડ ખોઈ નાખે અથવા ગુમાવે તો તેમણે ગ્રંથાલયને તે બાબતની લેખિત જાણ કરવી જોઈશે. આ પછી ત્રણ મહિના બાદ ખોવાઈ ગયેલ સ્માર્ટકાર્ડ ઉપર ગયેલાં, કે જનારાં પુસ્તકોની પોતાની જવાબદારી સ્વીકાર્યનો બાંહેધરી પત્ર લખી આપ્યા પછી તેમને સભ્ય તરીકે ચાલુ રહેવા જે તે નિયત કરેલો ચાર્જ લઈ નવું દુલ્ખીકેટ સ્માર્ટકાર્ડ આપવામાં આવશે.
૩૨. કોઈ પણ વ્યક્તિ એક જ નામ ઉપર, એકથી વધુ વખત સભ્યપદ નોંધાવી શકશે નહિ; આમ છતાં પણ જો કોઈ પણ વ્યક્તિએ એકથી વધુ વખત એક જ નામ ઉપર વાચક સભ્યપદ નોંધાવ્યું હશે તો તે તમામ સભ્યપદ રદ કરવાનો ગ્રંથાલયીને અધિકાર રહેશે.

### સર્વસાધારણા

ઉપરના નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળનો રહેશે.

## શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

### -ઃ વાચનાલય માટેના નિયમો :-

૧. પાગલ, નશો કરેલી કે ચેપી રોગથી પિડાતી કોઈ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં.
૨. વાચનાલયમાં પ્રવેશથાની કોઈપણ વાચકને પોતાની સાથે પાળેલા પશુ-પક્ષી, બેગ, થેલી, છત્રી, લાકડી, વિસ્ફોટક પદાર્થ કે પ્રવાહી, ઘાતક પદાર્થ કે પ્રવાહી જેવી કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવશે નહીં.
૩. વાચનાલયમાં ધુમપાન, તમાકુ, ગુટકા જેવા માદક તત્વોનો નિષેધ છે.
૪. વાચનાલયમાં ગમે ત્યાં થુકવું નહીં. પાન ખાઈને પિચકારી મારવી નહીં. ગંદકી કરવી નહીં.
૫. વાચનાલયમાં દરેક વાચકે બીજા વાચકને તકલીફ ન થાય તે રીતે વિચારી સંપૂર્ણ શાંતિ જાળવવાની રહેશે.
૬. વાચનાલયમાં વાચન કરતા અન્ય વાચકોને વાચન ધ્યાનભંગ ન થાય તે માટે મોબાઇલ ફોન સ્વીચ ઓફ રાખવો.
૭. વાચનાલયમાં દરેક વાચકે શિસ્ત, સંયમ અને સભ્યતાથી બેસી વાંચન કરવાનું રહેશે.
૮. બિનજરૂરી ચર્ચા, મોટેથી વાતો કરવી, મોટા અવાજે બોલવું, ઘાંટા પાડવા, ખોટી ફરિયાદો કરવી, વાચકો અને કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરનારને વાચનાલયમાં બેસવા દેવામાં આવશે નહીં.
૯. વાચનાલયમાં માત્ર વાચન માટે જ પ્રવેશ આપવામાં આવતો હોવાથી બીન જરૂરી સમય પસાર કરવા બેસી રહેવું, આંખો બંધ કરીને ઊંઘવા જેવી કોઈપણ પ્રવૃત્તિ કરવી નહીં.
૧૦. સામયિક રજીસ્ટ્રેશનરૂમમાં અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ વાચકે પ્રવેશ કરવો નહીં. કોઈપણ વાચન સામગ્રીની માગણી હોય ત્યારે પુસ્તકાલયના કર્મચારીને જણાવવાનું રહેશે.
૧૧. વર્તમાનપત્ર - સામયિક જ્યાંથી મેળવ્યું હોય ત્યાંજ મૂકવાનું રહેશે.
૧૨. વર્તમાનપત્ર - સામયિકમાં કોઈપણ પ્રકારનું લખાણ, લીટા, બોક્સ કે અન્ય રીતે બગાડ કરી શકાશે નહીં.
૧૩. કોઈપણ વાચન સામગ્રીમાંથી પાના ફાડવા, ફોટા ફાડવા, પાના ખરાબ કરવા, બાઈન્ડીંગને નુકશાન પહોંચાડવા જેવી કોઈપણ પ્રવૃત્તિ કરી શકાશે નહીં.

૧૪. વર્તમાનપત્રો - સામયિકો રેક્સ પર પ્રદર્શિત કરવામાં આવ્યા છે તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો અગત્યના તેમજ વધુ કિંમતના સામયિકો માટે આઈકાર્ડ જમા કરાવે આપવામાં આવશે અને જૂના કોઈપણ અંકોની જરૂરિયાત હોય તો ડિમાન્ડ સ્લીપ ભરીને કમચારીને આપવાથી જરૂરી અંકો વધુમાં વધુ બે અંકોની મર્યાદામાં પૂરા પાડવામાં આવશે.
૧૫. કોઈપણ વાચક વર્તમાનપત્ર - સામયિકના અંકોને નુકશાન કરશે તો ગ્રંથપાલશ્રીની સૂચના અનુસાર જે તે અંક નવો લાવીને આપવાનો રહેશે અથવા ગ્રંથપાલશ્રી નક્કી કરે તે નુકશાનીની રકમ ભરપાઈ કરવાની રહેશે.
૧૬. જૂના વર્તમાનપત્રોના અંકો અથવા સામયિકના અંકોની માંગણી કરનાર વાચકે પુસ્તકાલયનું વાચક સભ્યપદ ધરાવવું જરૂરી છે.
૧૭. જે તે દિવસના વર્તમાનપત્રોનો ઉપયોગ કરતા વાચકોને અન્ય વાચકોને વાચન લાભ મળી શકે તે હેતુથી દસ મિનિટથી વધુ સમય વાંચન માટે બેસવા દેવામાં આવશે નહીં.
૧૮. દરરોજના નવા મળેલા સામયિક-અંકોની નોંધ વાચનાલયના નોટીસ બોર્ડ પર મૂકવામાં આવતી હોય છે. આથી આ બાબતે અન્ય કોઈ પૂર્ખા કરવી નહીં.
૧૯. પુસ્તકાલય અને વાંચન સામગ્રી આપની પોતાની સહિયારી છે આપણે વાંચીએ અને બીજાઓને વાંચવા દઈએ.
૨૦. વાચનાલય સંબંધી અન્ય કોઈ મુશ્કેલીઓ હોય તો સામયિક વિભાગના ઈન્ચાર્જનો સંપર્ક કરવો.

### -: વાતાનુકૂલિત ઓડિટોરિયમના ઉપયોગ માટેના નિયમો :-

#### સામાન્ય :

૧. ઓડિટોરિયમનો હેતુ ગ્રંથાલય વિસ્તરણ પ્રવૃત્તિ માટેનો છે. પુસ્તકાલય દ્વારા યોજવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો અત્રે યોજવામાં આવે છે.
૨. ગ્રંથાલય વિસ્તરણ પ્રવૃત્તિનું આયોજન ગ્રંથાલય પોતે કરશે અથવા ઉપરોક્ત હેતુ સાથે સુસંગત હેતુઓ માટે અન્ય સંસ્થાઓ સાથે સંયુક્ત આયોજન કરી શકશે.
૩. ‘સંસ્થા’ આયોજનમાં જોડાનાર સંસ્થાને વિશિષ્ટ નિયમો લાગુ પડશે નહીં.
૪. સંયુક્ત આયોજનમાં જોડાવવું કે કેમ તે અંગેની સ્વીકૃતિ કે અસ્વીકૃતિનો નિર્ણય ગ્રંથપાલ કરશે.

#### વિશિષ્ટ :

ગ્રંથાલય અભિગમ કેળવવામાં સહાયભૂત બની રહે તેવી તમામ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રચનાત્મક પ્રવૃત્તિ માટે કોઈપણ સંસ્થા ઓડિટોરિયમના ઉપયોગ માટે અરજ કરી શકશે તેમજ નીચે જણાવેલ નિયમો બંધનકર્તા રહેશે.

૧. વપરાશ કરવાની ઈચ્છા ધરાવનાર સંસ્થાએ નિયત અરજીપત્રકમાં પૂરી માહિતી સાથે પ્રોગ્રામના એક અઠવાડિયા અગાઉ અરજ કરવી પડશે.
૨. વપરાશનો સમય સવારના ૮-૦૦ થી ૧૧-૦૦ અથવા સાંજે ૪.૦૦ થી ૭.૦૦ સુધીનો રહેશે.
૩. પુસ્તકાલયસેવાઓને કોઈપણ મુશ્કેલીઓ કે અવરોધ ઉભો ન થાય તે રીતે ઓડિટોરિયમનો ઉપયોગ કરવાનો રહેશે.
૪. ઓડિટોરિયમ વાપરવા રાખનારે બેઠક માટેની વ્યવસ્થા : ખુરશીઓ, પાથરણા, સ્ટેજ આયોજન તેમજ સાઉન્ડ સીસ્ટમની વ્યવસ્થા પોતે કરવાની રહેશે.
૫. ઓડિટોરિયમમાં પીણા, હળવો નાસ્તો, ભોજન કરી શકાશે નહીં.
૬. વપરાશ દરમ્યાન પુસ્તકાલયની કોઈપણ મિલકત કે સાધનોને નુકશાન થશે તો તેની સઘણી જવાબદારી ઓડિટોરિયમ વાપરનારની છે, અને નુકશાનીની રકમ ગ્રંથપાલશ્રી નક્કી કરશે તે ડિપોર્જિટની રકમમાંથી કાપી લેવામાં આવશે.

૭. કોઈપણ જાતની ગંદકી થાય તે રીતે ઓડિટોરિયમનો ઉપયોગ કરવો નહીં. વાપરવા રાખનારે કાર્યક્રમ પૂર્ણ થયા પછી ઓડિટોરિયમમાં દરેક જગ્યાએ સફાઈ કરાવવાની રહેશે.
૮. ઓડિટોરિયમમાં લાઉડ સ્પીકરના ઉપયોગથી લાયબ્રેરીના વાચકોને ખલેલ પહોંચે નહીં તે જોવાનું રહેશે.
૯. ઓડિટોરિયમના વપરાશ માટે વાપરનાર વ્યક્તિ : સંસ્થા કોઈપણ વ્યક્તિ પાસેથી ટીકીટો કે અન્ય કોઈ સ્વરૂપે રકમ ઉધરાવી શકશે નહીં, કે આનુષાંગિક એવી કોઈપણ પ્રવૃત્તિ કરી શકશે નહીં.
૧૦. કાર્યક્રમ ચાલુ હોય ત્યારે પુસ્તકાલયના ગ્રંથપાલશ્રી કે કોઈપણ અધિકારીશ્રી ઓડિટોરિયમમાં દાખલ થાય તો ઓડિટોરિયમ વાપરનારે યોગ્ય સહકાર આપવાનો રહેશે.
૧૧. ઓડિટોરિયમ વાપરવા ઈચ્છનાર વ્યક્તિ/સંસ્થાએ અરજીપત્રક સાથે રૂ. ૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા) ડિપોઝિટ તથા રૂ. ૨૫૦૦/- (અંકે રૂપિયા પચ્ચીસો પુરા) ભાડું તથા વિજળી ખર્ચ અલગથી ભરવાનું રહેશે.
૧૨. ઓડિટોરિયમના ઉપયોગના નિયમોમાં ફેરફાર કરવાનો પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળનો દક્ક અભાવિત છે.

### ❖ જ્ઞાન વિહાર વિદ્યાર્થી વાચનાલયના નિયમો ❖

૧. આ વિભાગ વિદ્યાર્થીઓ માટે સવારના ૭.૩૦ થી રાત્રીના ૧૦.૦૦ કલાક સુધી, જ્યારે વિદ્યાર્થીનો માટે સવારના ૭.૩૦ થી રાત્રીના ૭.૩૦ કલાક સુધી ખુલ્લો રહેશે. (વિદ્યાર્થીઓએ રાત્રીના ૭.૩૦ થી ૧૦.૦૦ કલાક દરમ્યાન સામાન્ય વાચનાલય વિભાગનો ઉપયોગ કરવાનો રહેશે.)
૨. માત્ર આ વિભાગનો ઉપયોગ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ મા.જે. પુસ્તકાલયનું સભ્યપદ લેવું જરૂરી નથી.
૩. મા.જે. પુસ્તકાલય તરફથી નિયત કરેલા ઓનલાઈન અરજિફોર્મમાં સંપૂર્ણ વિગતો ભર્યા બાદ આ વિભાગનો ઉપયોગ કરી શકશે.
૪. વાચનાલયનો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થીએ અલગથી નીચે મુજબનો ચાર્જ ચૂકવવાનો રહેશે.  
(૧) ત્રણ માસ માટે - રૂ. ૩૦૦/- (૨) છ માસ માટે - રૂ. ૬૦૦/- (૩) એક વર્ષ માટે - રૂ. ૧,૦૦૦/-
૫. આ વિભાગનો ઉપયોગ કરવા ઈચ્છતા વિદ્યાર્થીએ નિયત ઓનલાઈન ફી ભરી ઓળખપત્ર મેળવી સાથે રાખવાનું રહેશે.
૬. વાચનાલય વિભાગની બેઠક ક્ષમતા કરતા ૨૦% વધુ વિદ્યાર્થીઓને ઓળખપત્ર આપવામાં આવશે, તેમ છતાં જગ્યા ખાલી રહેશે તો વધુ ૨૦% વિદ્યાર્થીઓને ઓળખપત્ર આપવામાં આવશે.
૭. નિયત કરેલ સંખ્યામાં ઓળખપત્ર આપ્યા બાદ આ વિભાગનો ઉપયોગ કરવા ઈચ્છનાર વધુ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પ્રતિક્ષાયાદી બનાવી જરૂરિયાત મુજબ ઓપરેટ કરવામાં આવશે.
૮. આ વિભાગનું ઓળખપત્ર મેળવનારને જ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
૯. કોઈ વિદ્યાર્થી એકથી વધુ બેઠક વ્યવસ્થા રોકી શકશે કે આરક્ષિત રાખી શકશે નહીં.
૧૦. કોઈપણ વિદ્યાર્થીની મુદ્દત પૂર્ણ થયેથી તુરંત ઓળખપત્ર રિન્ફૂ કરવામાં આવશે નહીં.
૧૧. સામાન્ય વાચનાલય વિભાગ (વર્તમાનપત્ર - સામયિક વિભાગ)માં નક્કી કરેલ જગ્યામાં જ વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવશે.
૧૨. જાહેર જનતા કે સીનીયર સિટિઝન માટે નક્કી કરેલ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓને અત્યાસના હેતુથી પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.
૧૩. પુસ્તકાલયમાં પાન-મસાલા, ગુટકા, તમાકુ કે નશાકારક પદાર્થ સાથે પ્રવેશ કરવો નિષેધ છે.
૧૪. આ વિભાગમાં બેગ, બગલથેલો, દફ્તર, વોટરબેગ, નાસ્તાનો ડબો વિગેરે સાથે લાવવો નહીં.

૧૫. આ વિભાગમાં વિદ્યાર્થીએ મોબાઇલ સાઈલેન્ટ મોડ પર રાખવાનો રહેશે.
૧૬. આ વિભાગનો ઉપયોગ કરતા વિદ્યાર્થી દ્વારા પુસ્તકાલયની માલ-મિલકત, ફર્નિચર, લાઈટ અને વાંચન સામગ્રીનું કંઈ પણ નુકશાન થશે તો જે તે વિદ્યાર્થી પાસેથી વસ્તુલવામાં આવશે.
૧૭. આ વિભાગમાં શાંતિ, સ્વચ્છતા અને પવિત્રતા જળવાય તે જોવાની સૌ કોઈ વિદ્યાર્થીની ફરજ રહેશે.
૧૮. તા. ૦૧-૦૭-૨૦૧૮થી મા.જે. પુસ્તકાલયમાં વાચનાલયનું સભ્યપદ મેળવનારને ઉક્ત નિયમો લાગુ પડશે.
૧૯. વાચનાલયમાં ઉપલબ્ધ સુવિધાનો જ ઉપયોગ કરવાનો રહેશે.
૨૦. સમયાંતરે નિયમોમાં થતા ફેરફારો દરેક સભાસદે માન્ય રાખવાના રહેશે.
૨૧. આ વિભાગનો શિસ્તપૂર્વક ઉપયોગ ન કરનાર સભ્યનું સભ્યપદ કામચલાઉ / કાયમી ધોરણે રદ કરવાની કે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તા ગ્રંથપાલશ્રીને રહેશે.

## -શેડ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય - સાહિત્યચોરાના નિયમો:-

૧. દર શનિવારે 'સાહિત્યચોરા'ના ઉપક્રમે સાહિત્યકારો-સાહિત્ય રસિકોની સભા પુસ્તકાલયમાં સાંજના સમયે મળશે.
૨. આ સાહિત્ય સભાનું સંચાલન ગ્રંથપાલ અથવા તેઓના પ્રતિનિધિ અથવા સાહિત્યકારોમાંથી કોઈ એક સભા સંચાલન કરશે. સંચાલન અંગેની સંપૂર્ણ સત્તાઓ ગ્રંથપાલની રહેશે.
૩. સાહિત્ય સર્જન, વિસ્તરણ અને વિતરણ અંગેના હેતુ સાથે આ ચોરો સંકળાયેલો હોવાથી સાહિત્યિક-સાંસ્કૃતિક વિષયો સિવાયના કોઈ પણ વિષયની ચર્ચા કરી શકાશે નહિં.
૪. આ સભામાં હાજર રહેનાર સૌ કોઈએ શિસ્ત જાળવવાની રહેશે. શિષ્ટ અને સૌજન્યશીલ ભાષા પ્રયોગ કરવાનો રહેશે.
૫. કોઈ પણ વ્યક્તિ, જૂથ, સંપ્રદાય, ધર્મ, રાજકીય પક્ષ, જ્ઞાતિ, જાતિ, મંડળ કે રાખ્રનું અહિત થાય, દુઃખ પહોંચે તેવો કોઈ પણ ભાષા પ્રયોગ કરી શકાશે નહિં.
૬. સાહિત્ય ચર્ચા અંગેનો ચોરો હોવાથી સભામાં હાજર રહેનાર દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાની સત્તા છે. પોતાના વિચારો બીજા પર થોપી બેસાડી શકાશે નહિં.
૭. સાહિત્ય સભામાં હાજર રહેનાર સૌ કોઈએ એકબીજા સાથે સહકાર અને સૌજન્ય પૂર્ણ વ્યવહાર કરવાનો રહેશે.
૮. આ સભામાં હાજર રહેનાર દરેકે સૌ પ્રથમ હાજરી પત્રકમાં પોતાનું નામ લખી ટૂંકી સહી કરવાની રહેશે.
૯. હાજરી પત્રકમાં સહી કરનારને પોતાના વિચારો રજૂ કરવા કમાનુસાર તક આપવામાં આવશે. કમ ભંગ કરીને કોઈ પણ વ્યક્તિને અગ્રતા આપવામાં આવશે નહિં.
૧૦. દરેક સાહિત્યકારને વધુમાં વધુ ત્રણ મિનિટ ફાળવવામાં આવશે. સમય મર્યાદાને ધ્યાનમાં લઈ પોતાને જે પણ કંઈ રજૂઆત કરવી છે તે ટૂંકાણમાં સ્પષ્ટ શબ્દોમાં કરવાની રહેશે.
૧૧. આ સાહિત્ય સભામાં દરેક પોતાની મૌલિક કૃતિ ગુજરાતી, હિન્દી, ઉર્ડૂ, અંગ્રેજી, સંસ્કૃત કોઈ પણ એક ભાષામાં રજૂ કરી શકાશે. બીજા કોઈ સાહિત્યકારની રચના રજૂ કરી શકાશે નહિં.
૧૨. દર શનિવારે અલગ અલગ વિષયની રચનાઓ માટે જાહેરાત કરવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી વિષય ઉપર જ રચનાઓ રજૂ કરવાની રહેશે.
૧૩. સાહિત્યચોરાની સભામાં દરેક સાહિત્યકારોને માત્ર ત્રણ મિનીટ સમયની ફાળવણી કરી હોવાથી કોઈ પણ પ્રકારની ભૂમિકા, પ્રાથમિક પરિચય કે અન્ય મુક્તકો રજૂ ન કરતાં સીધે સીધી પોતાની મૌલિક રચના જ રજૂ કરવાની રહેશે.
૧૪. પુસ્તકાલયની સાહિત્યિક સભા હોવાથી તેની એક આગવી ગરિમા જળવાય તે રીતે ગુણવત્તાસભર, ઉચ્ચ કોટિની રચનાઓ રજૂ થાય તે રીતે દરેકે રચના રજૂ કરવાની રહેશે.
૧૫. સાહિત્યચોરામાં કોઈ પણ પ્રકારની ગદ્ય, પદ રચનાઓ રજૂ કરી શકાશે. પરંતુ અન્ય વધારે સાહિત્યકારોને તક આપી શકાય તે હેતુથી હવેથી ગાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
૧૬. કોઈ પણ સાહિત્યકાર પોતાની રચના રજૂ કરતા હોય ત્યારે અન્ય સાહિત્યકારોએ માત્ર સાંભળવાનું રહેશે. કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાની રહેશે નહિં.
૧૭. દરેક સાહિત્યકારનું માન-મર્યાદા જળવાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. કોઈ પણ પ્રકારની ટીકા-ટિપ્પણી કર્યા સિવાય દરેકને પોતાની મૌલિક રચનાઓ રજૂ કરવાનો સમાન અધિકાર રહેશે.

૧૮. સાહિત્ય સભામાં શક્ય હોય ત્યાં સુધી દરેક સાહિત્યકાર-રચનાકારને રજૂઆત કરવાની તક આપવામાં આવશે. પરંતુ સમય મર્યાદા અથવા અન્ય સાહિત્યિક કાર્યક્રમોમાં માત્ર શ્રોતા તરીકે અથવા સાહિત્ય રસિક તરીકે બેસવાનું રહેશે.
૧૯. આ સાહિત્યસભામાં બહારથી આવેલા સાક્ષર સારસ્વતોનું સન્માન જળવાય તે રીતે માન-મોભો આપી તેઓના વિચારો રજૂ કરવા અગ્રતા આપવા અથવા પ્રાધાન્ય આપવા ગ્રંથપાલને સંપૂર્ણ સત્તા રહેશે.
૨૦. આ સાહિત્યસભા - સાહિત્યચોરાના નેજા નીચે મળતી હોવા છતાં કોઈ પણ વ્યક્તિ-સંસ્થાના પ્રચારાત્મક પ્રવૃત્તિ અથવા નકારાત્મક પ્રવૃત્તિથી દૂર રહેશે.
૨૧. સાહિત્યચોરામાં હાજરી આપતી કોઈ પણ વ્યક્તિ પ્રેસ સમક્ષ રજૂઆતો કરી શકશે નહિં.
૨૨. આ સાહિત્ય સભા - સાહિત્ય સર્જન, વિસ્તરણ, વિતરણ અને વેચાણ અંગેનું કાર્ય કરી શકશે.
૨૩. તમામ ભાષાના સાહિત્યકારો તેમજ નવોદિતોને ઉત્તેજન આપી તેઓને સાહિત્ય સર્જન તરફ વાળવા આ સાહિત્યચોરો પ્રયત્નશીલ રહેશે.
૨૪. જરૂરિયાતમંદ સાહિત્યકારોને સહાયરૂપ થવા જરૂરી પ્રયત્નો કરવામાં આવશે.
૨૫. સાહિત્યસભાના નિયમોનું પાલન નહિં કરનારને સાહિત્યિક સભામાં આવતા રોકવા અંગેની સંપૂર્ણ સત્તાઓ ગ્રંથપાલની રહેશે.

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-ઓક્ટીવ ડિસ્કલોઝર નં. ૭

પુસ્તકાલયની નીતિ અથવા પુસ્ત.ના અમલીકરણના ઘડતરના સંબંધમાં  
જનતાના સત્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના દ્વારા  
રજૂઆત માટેની કરવામાં આવેલ વિગતો

# શોઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

## પ્રો-એક્ટીવ ડિસ્કલોજર નં. ૭

નીતિ ઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સત્યો સાથે  
સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત

- સજેશન બોક્સ - પુસ્તકાલય અંગેના કે પુસ્તકો અંગેના સજેશનનો વાચકો (જનતા) દ્વારા મળતા રહે છે.
- પુસ્તક પસંદગીની પ્રક્રિયામાં ઉપયોગી થાય છે.
- વાચક સેવાઓની સુવિધાઓમાં વધારો કરી શકાય છે.
- પુસ્તકાલય વિસ્તરણ સેવાઓમાં સાહિત્યિક, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા નાગરિકોના અમૂલ્ય સૂચનોનો લાભ પુસ્તકાલયને મળે છે.
- સાહિત્યકારો અને સાહિત્ય રસિકોની હાજરીમાં યોજવામાં આવતા સાહિત્યિક કાર્યક્રમો દ્વારા સાહિત્યિક સર્જન અને નવોદિત સાહિત્યકારોને ઉત્તેજન મળે છે.

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૮

પુસ્તકાલયના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે  
અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ  
અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા  
તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ

**-શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ :-**

સભ્ય	ટેલિફોન નંબર	
શ્રી કિરીટકુમાર જીવણલાલ પરમાર મેયર અને અધ્યક્ષ વિરાભગતની ચાલી, ભીડલંજન હનુમાન પાછળ, બાપુનગર, અમદાવાદ-૩૮૦૦૨૪	ઓફિસ ૨૫૩૨૮૦૦૮ ૨૫૩૮૧૮૧૧/૬૦૧ ફોન : ૦૭૯-૨૫૩૪૨૮૮૮	રહેઠાણ / મોબાઇલ ૯૭૭૪૨૩૦૮૫૭ -
શ્રી હિતેશ કંતીલાલ બારોટ ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય, મા.જે. પુસ્તકાલય વ્ય. મંડળ ૨, ચિત્રકુટ બંગલોઝ, સિંધુ ભવન પાછળ, થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૮.	૨૫૩૪૨૪૨૪ ૨૫૩૮૧૮૧૧/૬૦૬/૬૦૮ ફોન : ૦૭૯-૨૫૩૪૮૬૮૮	૯૮૨૪૦૧૦૦૨૨ -
ડૉ. સુજય જ્યોતિન્દ્રભાઈ મહેતા ચેરમેન, મ્યુ. સ્કૂલબોર્ડ સભ્ય, મા.જે. પુસ્તકાલય વ્ય. મંડળ ૮-એ, સમસ્ત બ્રહ્મક્ષત્રિય સોસાયટી, નારાયણનગર રોડ, શાંતિવન, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭.	૨૬૪૨૩૪૮૩	૭૮૧૮૮૭૦૫૭૨ ૯૮૮૮૩૮૬૮૬૬
શ્રી કિશોરભાઈ કરસનભાઈ મકવાણા વિદ્યાન સભ્ય, શેઠ મા.જે.પુ. વ્ય. મંડળ આઈ-૭, મધુરમૂ. ફલેટ, પેટ્રોલ પંપની બાજુમાં, જીવરાજ પાર્ક, અમદાવાદ-૫૧.		૯૮૨૫૦૪૪૭૩૪
ડૉ. હેમન્ત સિધ્ધાર્થભાઈ ભવૃ વિદ્યાન સભ્ય, શેઠ મા.જે.પુ. વ્ય. મંડળ ૧૮૦૦, દેસાઈની પોળ, ખાડીયા, અમદાવાદ-૧.	૨૨૧૧૫૩૨	૯૮૨૫૦૧૦૮૪૦

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

## -: પુસ્તક પસંદગી સમિતિ :-

પુસ્તકો, સામયિકો, અગ્રંથ સામગ્રીની અને ઓડિયો કેસેટ્સની પસંદગી અને પ્રાપ્તિ માટે વ્યવસ્થાપક મંડળની પેટાસમિતિ - પુસ્તક પસંદગી સમિતિમાં નીચે મુજબના સભ્યશ્રીઓ છે.

૧. ડૉ. સુજય મહેતા - સભ્ય
૨. શ્રી કિશોરભાઈ મકવાણા - વિદ્વાન સભ્ય
૩. ડૉ. હેમન્ત ભંડુ - વિદ્વાન સભ્ય

C : ૧ પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળ તેમજ પુસ્તક પસંદગી સમિતિમાં

- મા.જે. પુસ્તકાલય વ્ય.મંડળની મીટિંગમાં મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળના સભ્યશ્રીઓ ભાગ લઈ શકે છે.
- વાચક સભ્યો કે જાહેર જનતા વ્યવસ્થાપક મંડળ કે પુસ્તક પસંદગી સમિતિમાં ભાગ લઈ શકતી નથી.
- પુસ્તક પસંદગી સમિતિમાં વાચકો કે જનતાના સજેશનોને ધ્યાનમાં લેવામાં આવે છે.
- વ્યવસ્થાપક મંડળ અને પુસ્તક પસંદગી સમિતિના ઠરાવો તૈયાર કરવામાં આવે છે.
- વ્યવસ્થાપક મંડળ કે પુસ્તક પસંદગી સમિતિના ઠરાવોની નકલ વાચકો (જનતા) નિયત રકમ પાના દીઠ રૂ. ૨/- ભરપાઈ કરવાથી મેળવી શકે છે.

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડિસ્ક્લોઝર નં. ૮/૧૦  
પુસ્તકાલયના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તકા

-: શેઠ મા.જે. પુસ્તકાલયમાં ફરજ બજાવનાર કર્મચારીઓની વિગત :-

ક્રમ	એમલોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	પે-મેટ્રીક્સ	બેઝિક	રીમાર્ક્સ
૧	૧૧૮	ડૉ. બિપીનચંદ્ર જે. મોદી	ગ્રંથપાલ	૧	૬૭,૭૦૦-૨,૦૮,૭૦૦	૮૬,૬૦૦	
૨	૨૪	શ્રી મયુરબેન એચ. નિનામા	દેડ કલાર્ક	૩	૩૪,૪૦૦-૧,૧૨,૪૦૦	૬૦,૪૦૦	
૩	૧૪૨	શ્રી રષ્મિન્કુમાર એમ. પટેલ	એકાઉન્ટન્ટ	૩	૨૮,૨૦૦-૮૨,૩૦૦	૩૩,૬૦૦	
૪	૩૫	શ્રી પ્રકાશચંદ્ર કે. જોખી	ટાઇપીસ્ટ	૩	૩૪,૪૦૦-૧,૧૨,૪૦૦	૫૮,૬૦૦	
૫	૩૬	શ્રી રંજનબેન એ. બોરીયા	ટાઇપીસ્ટ	૩	૩૪,૪૦૦-૧,૧૨,૪૦૦	૫૩,૬૦૦	
૬	૩૭	શ્રી રષ્મિકાબેન એ. કાપડીયા	ટાઇપીસ્ટ	૩	૩૪,૪૦૦-૧,૧૨,૪૦૦	૫૩,૬૦૦	
૭	૪૦	શ્રી યોગેશકુમાર જે. પટેલ	જુનિયર આસિસ્ટન્ટ લાયબ્રેરી	૩	૪૪,૬૦૦-૧,૪૨,૪૦૦	૫૫,૨૦૦	
૮	૪૧	શ્રી પારસભાઈ જી. ભાવસાર	જુનિયર કોમ્પ્યુટર કમ કલાર્ક	૩	૩૪,૪૦૦-૧,૧૨,૪૦૦	૪૧,૧૦૦	
૯	૪૭	શ્રી કામિનીબેન આર. રાજપૂત	જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ	૩	૩૪,૪૦૦-૧,૧૨,૪૦૦	૬૨,૦૦૦	
૧૦	૪૮	શ્રી ખોડીદાસ ડી. પરમાર	સીનીયર કલાર્ક	૩	૨૫,૫૦૦-૮૧,૧૦૦	૫૧,૬૦૦	
૧૧	૫૨	શ્રી નિતીનભાઈ બી. પટેલ	સીનીયર કલાર્ક	૩	૨૮,૨૦૦-૮૨,૩૦૦	૫૫,૮૦૦	
૧૨	૫૪	શ્રી ગાયત્રીબેન જે. જાદવ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૮,૨૦૦-૮૨,૩૦૦	૪૫,૪૦૦	હેન્ડીક્રેપ
૧૩	૫૫	શ્રી સુશિલાબેન આર. સોલંકી	સીનીયર કલાર્ક	૩	૨૫,૫૦૦-૮૧,૧૦૦	૪૩,૪૦૦	
૧૪	૬૧	શ્રી ભાવિનભાઈ એ. બ્રહ્મભટ્ટ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૮,૨૦૦-૮૨,૩૦૦	૪૫,૪૦૦	
૧૫	૬૨	શ્રી આનંદભાઈ સી. પરદેશી	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૮,૨૦૦-૮૨,૩૦૦	૪૫,૪૦૦	
૧૬	૬૬	શ્રી અનિતાબેન એમ. રાજગુરુ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૮,૨૦૦-૮૨,૩૦૦	૪૧,૬૦૦	
૧૭	૬૮	શ્રી સંજીવકુમાર એન. શાહ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૫૦૦-૮૧,૧૦૦	૩૬,૪૦૦	
૧૮	૧૨૧	શ્રી ગુંજનભાઈ આર. પટણી	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૫૦૦-૮૧,૧૦૦	૨૫,૫૦૦	
૧૯	૧૨૩	શ્રી કામિનાબેન એસ. સોલંકી	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૫૦૦-૮૧,૧૦૦	૨૫,૫૦૦	
૨૦	૧૨૪	શ્રી રેશમાબેન જે. પંચાલ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૫૦૦-૮૧,૧૦૦	૨૫,૫૦૦	

ક્રમ	એમલોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	પે-મેટ્રીક્સ	બેઝિક	રીમાર્ક્સ
૨૧	૧૨૫	શ્રી પ્રેમિલાભેન કે. હઠીલા	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૨૨	૧૨૭	શ્રી પ્રજ્ઞાભેન એમ. અસારી	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૨૩	૧૨૮	શ્રી મહેન્દ્રકુમાર ડી. હઠીલા	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૨૪	૧૨૯	શ્રી વીણાભેન એમ. જાલા	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૨૫	૧૩૦	શ્રી ઉખાભેન ડી. પટેલ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૨૬	૧૩૧	શ્રી જ્યોત્સનાભેન કે. પંચાલ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૨૭	૧૩૨	શ્રી નિલેશકુમાર સી. ઘોધરી	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૨૮	૧૩૩	શ્રી ભાગ્યેશભાઈ સી. પટેલ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૨૯	૧૩૪	શ્રી ચેતનકુમાર એસ. પટેલ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૩૦	૧૩૫	શ્રી નયનભાઈ આર. ભાવસાર	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૩૧	૧૩૬	શ્રી હિરલભેન જે. મંડીવાલા	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૩૨	૧૩૭	શ્રી દિપીભેન બી. દુલેરા	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૩૩	૧૩૮	શ્રી મનીષપુરી બી. ગોસ્વામી	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૩૪	૧૩૯	શ્રી ધવલકુમાર ડી. પટેલ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૩૫	૧૪૩	શ્રી ભાવેશકુમાર આર. પટેલ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૨૫,૪૦૦-૮૧,૧૦૦	૨૫,૪૦૦	
૩૬	૭૭	શ્રી ભરતભાઈ સી. પટેલ	મ્યુઝિયમ એટેન્ડન્ટ	૩	૨૮,૨૦૦-૮૨,૩૦૦	૪૫,૪૦૦	
૩૭	૭૮	શ્રી મુદ્ગિતાભેન એન. મકવાણા	મ્યુઝિયમ એટેન્ડન્ટ	૩	૨૮,૨૦૦-૮૨,૩૦૦	૪૧,૬૦૦	
૩૮	૮૨	શ્રી ચંદુભાઈ સી. પરમાર	ડ્રાયવર	૩	૨૮,૨૦૦-૮૨,૩૦૦	૪૧,૬૦૦	
૩૯	૮૩	શ્રી જગદીશભાઈ એચ. પરમાર	પટાવાળા	૪	૧૮,૦૦૦-૫૬,૬૦૦	૩૭,૬૦૦	
૪૦	૮૪	શ્રી રમેશભાઈ એમ. ઘોણાણ	પટાવાળા	૪	૧૮,૦૦૦-૫૬,૬૦૦	૩૭,૬૦૦	
૪૧	૮૮	શ્રી નગીનભાઈ સી. પરમાર	નાયક	૪	૧૪,૭૦૦-૫૦,૦૦૦	૩૭,૨૦૦	
૪૨	૯૦	શ્રી અશ્વિનભાઈ એસ. સોની	પટાવાળા	૪	૧૮,૦૦૦-૫૬,૬૦૦	૩૭,૬૦૦	

ક્રમ	એમ્પલોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	પે-મેટ્રીક્સ	બેઝિક	રીમાર્ક્સ
૪૩	૮૧	શ્રી શ્યામલાલ આર. મીણા	પટાવાળા	૪	૪૪૪૦-૭૪૪૦	૬,૫૧૦	
૪૪	૧૦૨	શ્રી પ્રભુલાલ જી. પટેલ	ફરાસ	૪	૧૮,૦૦૦-૫૬,૬૦૦	૩૭,૬૦૦	
૪૫	૧૦૩	શ્રી કેલાસભાઈ એસ. રાણા	ફરાસ	૪	૧૮,૦૦૦-૫૬,૬૦૦	૩૭,૬૦૦	
૪૬	૧૦૪	શ્રી પત્રાલાલ એચ. મીણા	ફરાસ	૪	૪૪૪૦-૭૪૪૦	૬,૫૧૦	
૪૭	૧૦૭	શ્રી સવિતાબેન એમ. કુચારા	ફરાસ	૪	૧૫,૭૦૦-૫૦,૦૦૦	૩૪,૦૦૦	
૪૮	૧૦૮	શ્રી કમલેશકુમાર જી. પરમાર	ફરાસ	૪	૧૫,૭૦૦-૫૦,૦૦૦	૩૪,૦૦૦	
૪૯	૧૦૯	શ્રી જીતેન્દ્રભાઈ એસ. રાણા	ફરાસ	૪	૧૫,૭૦૦-૫૦,૦૦૦	૩૨,૦૦૦	
૫૦	૧૧૨	શ્રી મંગલાવતીબેન એન. રાજ્પુત	પાણીવાળા બહેન	૪	૧૫,૭૦૦-૫૦,૦૦૦	૩૨,૦૦૦	
૫૧	૧૧૫	શ્રી રામચંદ્ર એમ. ચૌહાણ	સફાઈ કામદાર	૪	૧૮,૦૦૦-૫૬,૬૦૦	૩૮,૮૦૦	

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડિસ્કલોગર નં. ૧૧

પુસ્તકાલયની તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરના  
અહેવાલોની વિગતો દર્શાવતી તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬.

મે. ચેરમેન સાહેબ,

સવિનય જણાવવાનું કે, શેઠ મા.જે. પુસ્તકાલયનું સને ૨૦૨૩-'૨૪ના વર્ષ માટેનું કુલ ખર્ચ રૂ. ૧૫,૦૩,૩૫,૦૦૦/- (અંકે રૂપિયા પંદર કરોડ ત્રણ લાખ પાંત્રીસ હજાર પૂરા) અને કુલ આવક રૂ. ૬૨,૪૫,૦૦૦/- (અંકે રૂપિયા બાસઠ લાખ પિસ્તાળીસ હજાર પૂરા) અંદાજવામાં આવેલ છે. પુસ્તકાલયના ખર્ચની ચોખ્ખી રકમ રૂ. ૧૪,૪૦,૬૦,૦૦૦/- (અંકે રૂપિયા ચૌદ કરોડ ચાળીસ લાખ નેવું હજાર પૂરા) થાય છે, જે શેઠ મા.જે. પુસ્તકાલયના ટ્રસ્ટડીની કલમ-૮ અનુસાર અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશન પાસેથી ગ્રાન્ટ પેટે મેળવવાના થાય છે.

ઉપરોક્ત સઘણી હકીકતથી વિદિત થઈ, શેઠ મા.જે. પુસ્તકાલયનું સને ૨૦૨૩-'૨૪ ના વર્ષનું ડ્રાફ્ટ અંદાજપત્ર વ્યવસ્થાપક મંડળ સમક્ષ રજૂ કરવા આપશ્રીની મંજૂરી આપવા વિનંતી.

સહી : ડૉ. બિપીન જે. મોદી  
ગ્રંથપાલ

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય  
અમદાવાદ-૩૮૦૦૦૬.

વ્યવસ્થાપક મંડળ ઠરાવ નં. ૪૦ : ૨૦૨૨-૨૦૨૩

તા. ૨૫-૦૧-૨૦૨૩

ઠરાવ કર્યો કે, શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયના ગ્રંથપાલશ્રીએ સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટે રજૂ કરેલ બજેટમાં રૂ. ૧૫,૦૩,૩૫,૦૦૦/- (અંકે રૂપિયા પંદર કરોડ ત્રણ લાખ પાંત્રીસ હજાર પૂરા) નો અંદાજેલ ખર્ચ અને રૂ. ૬૨,૪૫,૦૦૦/- (અંકે રૂપિયા બાસઠ લાખ પિસ્તાળીસ હજાર પૂરા) ની અંદાજેલ આવક અંગે બોર્ડમાં થયેલ નિષ્ણય મુજબ અંદાજીત ખર્ચની રકમમાં નીચે જણાવેલ નવીન આયોજનો માટે રૂ. ૮૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા ઓશી લાખ પૂરા) નો વધારો કરી કુલ અંદાજીત ખર્ચ રૂ. ૧૫,૮૩,૩૫,૦૦૦/- (અંકે રૂપિયા પંદર કરોડ ત્યાશી લાખ પાંત્રીસ હજાર પૂરા) માંથી કુલ અંદાજીત આવક રૂ. ૬૨,૪૫,૦૦૦/- (અંકે રૂપિયા બાસઠ લાખ પિસ્તાળીસ હજાર પૂરા) બાદ કરતા ચોખ્ખી રકમ રૂ. ૧૫,૨૦,૬૦,૦૦૦/- (અંકે રૂપિયા પંદર કરોડ વીસ લાખ નેવું હજાર પૂરા) ટ્રસ્ટડીની કલમ-૮ મુજબ અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશન પાસેથી ગ્રાન્ટ તરીકે મેળવવા સ્ટેન્ડિંગ કમિટી મારફતે ભૂનિસિપલ કોર્પોરેશનની મંજૂરી મેળવવાની અપેક્ષાએ મંજૂરી આપવામાં આવે છે.

૧. શેઠ મા.જે. પુસ્તકાલય / શાખા પુસ્તકાલયોમાં ઉપલબ્ધ તમામ પુસ્તકો અને સભાસદોના ડેટા રૂ. ૩૦.૦૦ લાખ

#### **RFID System થી સરળ કરવાનું આયોજન :**

અમદાવાદ શહેરને સ્માર્ટ સીટીનો દરજો મળેલ છે તે અંતર્ગત એમ.જે. લાયબ્રેરી સ્માર્ટ લાયબ્રેરી તરીકે કાર્યરત છે. શેઠ મા.જે. પુસ્તકાલય અને શાખા પુસ્તકાલયોમાં અંદાજીત ૭.૦૦ લાખ કરતા વધુ પુસ્તકો અને ૨૨,૦૦૦ કરતા વધુ સભાસદો ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં ૧.૫૦ લાખ પુસ્તકોનો ડેટા RFID System થી સરળ કરવામાં આવેલ છે તે જ પ્રકારે બાકીના તમામ પુસ્તકો અને સભાસદોનો ડેટા RFID System થી સરળ કરવામાં આવે તો ઉપભોક્તાઓ સાચા અર્થમાં સ્માર્ટ લાયબ્રેરીનો અહેસાસ કરી તેનો લાભ લઈ શકે તે માટે શેઠ મા.જે. પુસ્તકાલય / શાખા પુસ્તકાલયોમાં ઉપલબ્ધ તમામ પુસ્તકો અને સભાસદોના ડેટા RFID Systemથી સરળ કરવાનું આયોજન.

૨. શેઠ મા.જે. પુસ્તકાલયમાં E-Resources Subscribe કરવાનું આયોજન : રૂ. ૫.૦૦ લાખ

શેઠ મા.જે. પુસ્તકાલયમાં દિન-પ્રતિદિન વાચકોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. પુસ્તકાલયમાં આવતા વિદ્યાર્થી વાચકોની માંગમાં સમયને અનુરૂપ બદલાવ આવેલ છે. પુસ્તકોનું સ્થાન હવે નવીન ટેકનોલોજી આધારિત સેવાઓએ લીધેલ છે. મા.જે. પુસ્તકાલયમાં સ્માર્ટ લાયબ્રેરી અંતર્ગત વિવિધ પ્રકારની સેવાઓ વેબસાઈટ, મોબાઇલ એપ્લિકેશન, કિઓસ્ક ટેમ્પ નેટવર્કિંગનો માધ્યમથી આપવામાં આવે છે. પુસ્તકાલયમાં આવતા વાચકો પોતાના વિષયકોની અધ્યતન માહિતીથી અવગત થાય તેમજ સમય અને સ્થળના બંધનોથી મુક્ત થઈ તેનો ઉપયોગ કરી શકે તે હેતુથી શેઠ મા.જે. પુસ્તકાલયમાં E-Resources Subscribe કરવાનું આયોજન.

૩. શેઠ મા.જે. પુસ્તકાલયમાં જરૂરિયાત મુજબનું ફર્નિચર વસાવવાનું આયોજન : રૂ. ૫.૦૦ લાખ

શેઠ મા.જે. પુસ્તકાલય વર્ષના ઉપદ દિવસ સવારના ૭.૩૦ થી રાત્રીના ૧૦.૦૦ કલાક સુધી અવિરત સેવાઓ આપતી સંસ્થા છે. શહેરના પરા વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવે છે. વાચકો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા મુજબનું ફર્નિચર વસાવવામાં આવે તો તે વધુ સારી રીતે લાંબો સમય વાંચન કરી શકે અને શારીરિક શ્રમ ઓછો લાગે તે હેતુથી શેઠ મા.જે. પુસ્તકાલયમાં જરૂરિયાત મુજબનું ફર્નિચર વસાવવાનું આયોજન.

૪. શેઠ મા.જે. પુસ્તકાલયમાં સાહિત્યગોષ્ઠિનું આયોજન : રૂ. ૫.૦૦ લાખ

શેઠ મા.જે. પુસ્તકાલયના ઓડિટોરિયમમાં દર શાનિવારે ‘સાહિત્યચોરો’ અંતર્ગત નવોદિત સાહિત્યકારોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે, જ્યારે મહિનાની આખર તારીખમાં ‘સીનીયર આર્ટિસ્ટ ફોરમ’ અંતર્ગત જૂની રંગભૂમિના કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરી શકે તે માટે તેઓને નિઃશુલ્ક ઓડિટોરિયમ પૂરું પાડવામાં આવે છે. શેઠ મા.જે. પુસ્તકાલયમાં આવતા સાહિત્યરસિકો સાથે સર્જકોની સાહિત્યગોષ્ઠિ થાય અને પરસ્પર તાદાત્મ્ય સધાય તે હેતુથી આ બજે સંસ્થાઓના સંયુક્ત ઉપકરે શેઠ મા.જે. પુસ્તકાલયમાં સાહિત્યગોષ્ઠિનું આયોજન.

૫. શેઠ મા.જે. પુસ્તકાલય દ્વારા શિયાળુ સત્રમાં ત્રિદિવસીય સાહિત્ય રસોત્સવનું આયોજન : રૂ. ૫.૦૦ લાખ

શેઠ મા.જે. પુસ્તકાલય સાહિત્યસર્જકો અને સાહિત્યરસિકો માટે સાહિત્ય સાધનાનું કેન્દ્ર, બાળકો માટે બાળ સંસ્કાર કેન્દ્ર, વિદ્યાર્થીઓ અને યુવા વાચકો માટે જ્ઞાન મંદિર તેમજ મહિલા વાચકો તથા સિનીયર સિટીઝન માટે જ્ઞાનતીર્થ બન્યું છે. મા.જે. પુસ્તકાલયમાં અનેક લેખકોના પુસ્તકો ઉપલબ્ધ છે જેનો વિશાળ વાચકવર્ગ લાભ લઈ રહેલ છે. વાચકો સાહિત્યસર્જકો સાથે સીધા પરિચયમાં આવે, તેઓની વચ્ચે સાહિત્યિક જ્ઞાન આદાન-પ્રદાન થાય અને વૈચારિક સેતુ બંધાય તેવા ભાવ સાથે વિવિધ આયામો અંતર્ગત કાર્યક્રમો યોજાય તે હેતુથી શેઠ મા.જે. પુસ્તકાલય દ્વારા શિયાળુ સત્રમાં ત્રિદિવસીય સાહિત્ય રસોત્સવનું આયોજન.

૬. હેરીટેજ સ્થળે કાર્યક્રમો કરવાનું આયોજન : રૂ. ૫.૦૦ લાખ

ઔતિહાસિક શહેર અમદાવાદને જુલાઈ-૨૦૧૭માં યુનેસ્કો દ્વારા ભારતની ગ્રામ ‘વર્લ્ડ હેરીટેજ સીટી’ નો દરજો પ્રાપ્ત થયેલ છે. અમદાવાદ શહેરના કોટ વિસ્તાર અને પોળોમાં હેરીટેજ મૂલ્ય ધરાવતા ઔતિહાસિક સ્મારકો સન્મુખ તેને અનુરૂપ કાર્યક્રમોનું આયોજન કરવાથી નગરજનો તેનાથી પરિચિત થાય અને તેનો પ્રચાર-પ્રસાર થાય તે માટે હેરીટેજ સ્થળે કાર્યક્રમો કરવાનું આયોજન.

## ૭. કષાંવતી સાંસ્કૃતિક માહિતી કેન્દ્ર અને સ્વાગત પ્રતિષ્ઠાન બનાવવાનું આયોજન:

રૂ. ૫.૦૦ લાખ

હેરીટેજ સીટીનો દરજાએ ધરાવતા અમદાવાદ મહાનગરની ઐતિહાસિક ઝાંખી, કલા, શિલ્પ-સ્થાપત્ય, સાંસ્કૃતિક સાહિત્યવારસો અને હેરીટેજ સ્થાપત્યની માહિતી શહેરમાં આવતા દેશ-વિદેશના પર્યટકો અને સંશોધકોને ઉપયોગી થાય તેમજ મા.જે. પુસ્તકાલયમાં પ્રથમવાર આવતા નવઆગંતુકો પુસ્તકાલયની કાર્યપદ્ધતિ અને સેવાઓથી અવગત થાય તે માટે શેઠ મા.જે. પુસ્તકાલયમાં કષાંવતી સાંસ્કૃતિક માહિતી કેન્દ્ર અને સ્વાગત પ્રતિષ્ઠાન બનાવવાનું આયોજન.

## ૮. પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ પર પરિસંવાદનું આયોજન:

રૂ. ૨.૦૦ લાખ

વર્તમાન યુગમાં ગામડાઓ ઘટતા જાય છે અને શહેરમાં લોકો રોજગારી મેળવવા માટે આવે છે. દિવસે-દિવસે વસ્તીવિસ્કોટ, ઔદ્યોગીકરણ, વૃક્ષોનું નિકંદન તેમજ પ્રદૂષણ જેવી સમસ્યાઓ વધી રહી છે જેના કારણે આભોહવામાં પરિવર્તન આવી રહ્યું છે અને ભવિષ્યમાં પર્યાવરણનું સંતુલન જોખમાવાની સંભાવના રહેલી છે. શહેરના નાગરિકોમાં કુદરતી ખોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અંગે જાગરૂકતા આવે તે હેતુથી શેઠ મા.જે. પુસ્તકાલયમાં પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ પર પરિસંવાદનું આયોજન.

## ૯. ગુજરાતના ગૌરવવંતા મહાનુભાવોના જીવન-કવનની ઝાંખી દર્શાવતા કાયમી પ્રદર્શનનું આયોજન :

રૂ. ૨.૦૦ લાખ

શેઠ મા.જે. પુસ્તકાલય સાર્વજનિક સંસ્થા છે અને તેનો અમદાવાદના નગરજનો બદ્ધોળા પ્રમાણમાં લાખ લઈ રહ્યા છે. આ શહેરના વિદ્યાર્થીઓ, શિક્ષણવિદ્યા, સાહિત્યપ્રેમી નાગરિકો તેમજ મા.જે. પુસ્તકાલયના ઉપભોક્તાઓ ગુજરાતના ગૌરવવંતા મહાનુભાવોની જીવનયાત્રાથી પરિચિત થાય તેમજ તેમના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તેવા શુભ હેતુથી શેઠ મા.જે. પુસ્તકાલયના સામાન્ય વાચનાલય વિભાગમાં ગુજરાતના ગૌરવવંતા મહાનુભાવોના જીવન-કવનની ઝાંખી દર્શાવતા કાયમી પ્રદર્શનનું આયોજન.

## ૧૦. મ્યુ. સ્કૂલ બોર્ડના સ્માર્ટ સ્કૂલના બાળકોને સ્માર્ટ લાયબ્રેરીથી પરિચિત કરવવાનું આયોજન :

રૂ. ૨.૦૦ લાખ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા અધ્યતન સુવિધા ધરાવતી સ્માર્ટ સ્કૂલ (અનુપમ શાળા)નો નવીન કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવેલ છે તે અંતર્ગત શહેરમાં હર સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવેલ છે. આ સ્કૂલના બાળકો મા.જે. પુસ્તકાલયમાં જિજ્ઞાસા સાથે પ્રવેશો, સ્માર્ટ લાયબ્રેરીની સેવાઓથી માહિતગાર થાય અને સંતોષ સાથે પરત જાય તે હેતુથી સ્માર્ટ સ્કૂલના બાળકોને સ્માર્ટ લાયબ્રેરીથી પરિચિત કરવવાનું આયોજન.

## ૧૧. કવિ ‘શૂન્ય’ પાલનપુરીની જન્મશતાબ્દી નિમિત્તે કવિ સંમેલન કાર્યક્રમ કરવાનું આયોજન:

રૂ. ૨.૦૦ લાખ

કવિ ‘શૂન્ય’ પાલનપુરીના જન્મશતાબ્દી વર્ષની હાલમાં ઉજવણી થઈ રહેલ છે. તેઓશ્રીએ કવિતા, ગઝલ અને શેર-શાયરી જેવા વિવિધ સાહિત્ય ક્ષેત્રોમાં ખેડાણ કરેલ છે. સાહિત્યમાં રૂચિ ધરાવતા નગરજનો તેમના જીવન-કવન અને સાહિત્યસર્જન યાત્રાથી પરિચિત થાય તેવા હેતુથી કવિ ‘શૂન્ય’ પાલનપુરીની જન્મશતાબ્દી નિમિત્તે કવિ સંમેલન કાર્યક્રમ કરવાનું આયોજન.

## ૧૨. મહિલા આરોગ્ય જાગૃતિ વિષયક કાર્યક્રમનું આયોજન :

રૂ. ૨.૦૦ લાખ

તરુણાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશતી વિદ્યાર્થીની શારીરિક અંતસ્થાવોમાં ફેરફાર થવાના કારણે માસિકને લગતી સમસ્યાઓ અંગે મૂંજવણ અનુભવતી હોય છે, જ્યારે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભશાય કેન્સરની સમસ્યાઓ પડકારરૂપ બની છે. આ બાબતે વિદ્યાર્થીની અને મહિલાઓ સજાગ થઈ સાવચેતીના પગલાં લઈ શકે તે માટે શેઠ મા.જે. પુસ્તકાલયમાં મહિલા આરોગ્ય જાગૃતિ વિષયક કાર્યક્રમનું આયોજન.

## ૧૩. ‘ગુજરાતી ડાયસ્પોરા’ સાહિત્ય વિમર્શનું આયોજન :

રૂ. ૨.૦૦ લાખ

વર્તમાન યુગમાં વિદેશગમનનો મહિમા વધી રહ્યો છે તેમાં સાહિત્યસર્જકો પણ બાકાત નથી. પરદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારો સાહિત્યસર્જન કરે છે તેમાં ગુજરાતની સંસ્કૃતિનો ઓછે વર્તે અંશે પ્રભાવ જોવા મળે છે, તે જ રીતે વિદેશમાંથી અહીં આવી લાંબા સમયથી વસતા સાહિત્યકારોની સાહિત્યકૂતૃતમાં પણ વિદેશી સંસ્કૃતિની છાંટ જોવા મળે છે. આ પ્રકારના સાહિત્યકારોના સ્વભુબે તેમના જીવન-કવન અને સર્જનયાત્રાથી શ્રોતાગણ પરિચિત થાય તે હેતુથી ‘ગુજરાતી ડાયસ્પોરા’ સાહિત્ય વિમર્શનું આયોજન.

#### ૧૪. શેઠ મા.જે. પુસ્તકાલયના પરિસરમાં ગ્રીનરી અને સ્ટ્રીટ લાઈટનું આયોજન:

રૂ. ૫.૦૦ લાખ

શેઠ મા.જે. પુસ્તકાલય અમદાવાદ શહેરની ઐતિહાસિક મૂલ્ય ધરાવતી હેરીટેજ વિરાસત છે અને તેમાં જ્ઞાનનો ભંડાર રહેલો છે. આ પુસ્તકાલય આંતરિક રીતે સમૃધ્ય છે તેટલું બાધ્ય રીતે પણ નયનરથ્ય હોવું જરૂરી છે. અહીં આવતા વાચકોને ગ્રીનરીનો અહેસાસ થાય તે માટે પરિસરમાં કોટની અંદરની બાજુ 'પોસ્ટલ પામ ટ્રી પ્લાન્ટ' લગાવવાનું વિચારેલ છે. વધુમાં આ પુસ્તકાલય રાત્રીના ૧૦.૦૦ કલાક સુધી કાર્યરત રહેતું હોવાથી પરિસરમાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળી રહે તે માટે શેઠ મા.જે. પુસ્તકાલયના પરિસરમાં ગ્રીનરી અને સ્ટ્રીટ લાઈટનું આયોજન.

#### ૧૫. શેઠ મા.જે. પુસ્તકાલયમાં 'Cyber Security Awareness' પર સેમિનારનું આયોજન:

રૂ. ૧.૦૦ લાખ

માન. વડાપ્રધાનશ્રી દ્વારા ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવેલ છે. વર્તમાનયુગમાં ટેકનોલોજીનો આવિજ્ઞાર થવાથી નાણાંકીય વ્યવહારો મોબાઇલ, ઈન્ટરનેટર, યુપીઆઈ તેમજ ઈ-બેંકિંગના માધ્યમથી કરવાનું ચલાશ વધી રહ્યું છે જેના કારણે સમય અને સ્થળની મર્યાદા સિવાય સરળતાથી કામગીરી પૂર્ણ કરી શકાય છે, પરંતુ તેની સામે જુદા-જુદા પ્રકારના છેતરપીઠીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. લોકોના નાણાંની સલામતી સધાય અને આ પ્રકારના બનાવોનો ભોગ ન બને તે માટે સાઈબર સિક્યુરિટી નિષ્ણાત દ્વારા માર્ગદર્શન મળી રહે અને સમાજમાં જગરૂકતા કેળવાય તે હેતુથી મા.જે. પુસ્તકાલયમાં 'Cyber Security Awareness' પર સેમિનારનું આયોજન.

#### ૧૬. દિવ્યાંગ વિદ્યાર્થીઓના સંદર્ભે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન:

રૂ. ૨.૦૦ લાખ

શેઠ મા.જે. પુસ્તકાલયમાં તા.૨૩-૦૩-૨૦૧૩થી શહેરના પ્રજ્ઞાયક્ષુ નાગરિકો માટે શ્રાવ્ય વિભાગનો શુભારંભ કરવામાં આવેલ છે. સમાજની અંદર શારીરિક તેમજ માનસિક ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓની અંદર અપાર કુદરતી શક્તિઓનો સંચાર રહેલો હોય છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ પોતાની અંદર પડેલી સુખુમ શક્તિઓને બહાર લાવી શકે તે માટે તેઓને પ્લેટફોર્મ પૂરુષ પાડવાના ઉમદા આશયથી શેઠ મા.જે. પુસ્તકાલયમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના સંદર્ભે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન.

-: નવીન આયોજનોના ખર્ચની અંદાજીત કુલ રકમ રૂ. ૮૦,૦૦,૦૦૦/- થાય છે :-

સહી : અરૂપાભાઈ પંડ્યા

ખ્રુ. સેકેટરી

અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન,

અમદાવાદ.

સહી : કિરીટકુમાર પરમાર

ચેરમેન

વ્યવસ્થાપક મંડળ

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

મદાવાદ-૩૮૦૦૦૬.

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬.

ગ્રંથપાલશ્રીએ રજૂ કરેલ સને ૨૦૨૩-૨૦૨૪ના બજેટના ખરડાના તારણા.

સને ૨૦૨૩-૨૦૨૪માં ખર્ચની અંદાજીત રકમ	રૂ. ૧૫,૦૩,૩૫,૦૦૦/-
સને ૨૦૨૩-૨૦૨૪માં આવકની અંદાજીત રકમ	રૂ. ૬૨,૪૫,૦૦૦/-
સને ૨૦૨૩-૨૦૨૪માં ખર્ચની ચોખ્ખી રકમ	રૂ. ૧૪,૪૦,૬૦,૦૦૦/-
ટ્રસ્ટીડની કલમ-૮ અનુસાર માંગવાની થતી ગ્રાન્ટની કુલ રકમ	રૂ. ૧૪,૪૦,૬૦,૦૦૦/-

અંકે રૂપિયા ચૌદ કરોડ ચાણીસ લાખ નેવું હજાર પૂરા

પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળે તેમના ઠરાવ નં. ૪૦ : ૨૦૨૨-'૨૩  
તા. ૨૫-૦૧-૨૦૨૩ અનુસાર નવીન આયોજનો સાથે સુધારેલ બજેટના ખરડાના તારણા.

સને ૨૦૨૩-૨૦૨૪માં ખર્ચની અંદાજીત રકમ	રૂ. ૧૫,૮૩,૩૫,૦૦૦/-
સને ૨૦૨૩-૨૦૨૪માં આવકની અંદાજીત રકમ	રૂ. ૬૨,૪૫,૦૦૦/-
સને ૨૦૨૩-૨૦૨૪માં ખર્ચની ચોખ્ખી રકમ	રૂ. ૧૫,૨૦,૬૦,૦૦૦/-
ટ્રસ્ટીડની કલમ-૮ અનુસાર માંગવાની થતી ગ્રાન્ટની કુલ રકમ	રૂ. ૧૫,૨૦,૬૦,૦૦૦/-

અંકે રૂપિયા પંદર કરોડ વીસ લાખ નેવું હજાર પૂરા.

ડ. ભૂનિસિપલ કમિશનરશ્રીનો પત્ર, શેઠ મા.જે. પુસ્તકાલય ખાતુ

નં. ૪૩૧ તા. ૨૫-૦૧-૨૦૨૩

સ્ટેન્ડિંગ કમિટીની શુક્રવાર તા. ૨૭-૦૧-૨૦૨૩ની મુલત્વી રહેલ મીટિંગ શુક્રવાર તા. ૧૦-૦૨-૨૦૨૩ના રોજ સવારના ૧૧-૩૦ કલાકે સ્ટેન્ડિંગ કમિટી રૂમ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ ખાતે મળી હતી તેમાં થયેલ ઠરાવની નકલ

તા. કામ નં. ૦૧

ઠરાવ નં. ૧૪૩૬

સને ૨૦૨૨-૨૦૨૩

ઠરાવ કર્યો કે, ડ. ભૂ. કમિશનર(લાયબ્રેરી)શ્રીના પત્ર નં. ૪૩૧ તા. ૨૫-૦૧-૨૦૨૩નો શેઠ મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ ઠ. નં. ૪૦ તા. ૨૫-૦૧-૨૦૨૩ તથા ગ્રંથપાલશ્રીના પત્ર નં. : એલઆઈબી / ૪૮ / ૨૦૨૨-૨૩ તા. ૦૬-૦૧-૨૦૨૩ની સઘળી હકીકતથી વિદિત થઈ શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયના સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટેના અંદાજીત ખર્ચ રૂ. ૧૫૮૩.૩૫ લાખમાંથી અંદાજીત આવક રૂ. ૬૨.૪૫ લાખ બાદ કરતાં નેટ રકમ રૂ. ૧૫૨૦.૬૦ લાખની ગ્રાન્ટ આપવાની ઉપરોક્ત શેઠ મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળના ઠરાવ નં. ૪૦ તા. ૨૫-૦૧-૨૦૨૩ની ભલામણ અનુસાર મંજૂરી આપવા ભૂ. કોર્પો. ને ભલામણ કરવામાં આવે છે.

સહી: એ. આર. પંડ્યા  
ભૂનિસિપલ સેકેટરી

સને ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે ગ્રંથપાલશ્રીએ રજૂ કરેલ અંદાજીત આવક અને ખર્ચની સંક્ષિમ માહિતી નીચે પ્રમાણે છે.

### -: અંદાજીત આવક અને ખર્ચની માહિતી :-

#### આવક -

ક્રમ	વિગત	અંદાજીત રકમ	ટકાવારી
૧.	અમદાવાદ મ્યુ. કોર્પો.ની ગ્રાન્ટ	૧૫,૨૦,૬૦,૦૦૦	૮૬.૦૪%
૨.	પુસ્તકાલયની આવક	૬૨,૪૫,૦૦૦	૩.૮૫%
	<b>કુલ આવક</b>	<b>૧૫,૮૩,૩૫,૦૦૦</b>	<b>૧૦૦%</b>

#### ખર્ચ -

ક્રમ	વિગત	૨૦૨૩-૨૪ના રજૂ કરેલા અંદાજો	૨૦૨૩-૨૪ની કુલ અંદાજીત ખર્ચની ટકાવારી
૧.	વાચન સામગ્રી		
	A. પુસ્તક	૩૦,૦૦,૦૦૦	૧.૮૮%
	B. સામયિકો - વર્તમાનપત્રો	૬,૦૦,૦૦૦	૦.૪૭%
	C. અગ્રંથ	-	-
	D. વિજ્ઞાણ માધ્યમ	-	-
		<b>૩૬,૦૦,૦૦૦</b>	<b>૨.૪૬%</b>
૨.	પુસ્તકાલય સેવા ખર્ચ	૧,૦૩,૨૦,૦૦૦	૬.૫૨%
૩.	વહીવટી ખર્ચ	૧૩,૬૦,૦૦૦	૦.૮૮%
૪.	મેન્ટેનન્સ ખર્ચ	૮૮,૪૦,૦૦૦	૫.૬૫%
૫.	કોમ્પ્યુટર, આઈટી લાયબ્રેરી ઓટોમેશન	૩૧,૦૦,૦૦૦	૧.૬૬%
૬.	એસ્ટાબિલિશમેન્ટ ખર્ચ (મહેકમ)	૧૦,૮૨,૦૦,૦૦૦	૬૮.૩૪%
૭.	પરચુરણ ખર્ચ	૩,૭૫,૦૦૦	૦.૨૪%
૮.	કેપીટલ ખર્ચ	૧,૪૧,૦૦,૦૦૦	૮.૫૦%
૯.	વ્યવસ્થાપક મંડળે રજૂ કરેલ નવીન આયોજનો	૮૦,૦૦,૦૦૦	૫.૦૪%
		<b>૧૫,૮૩,૩૫,૦૦૦</b>	<b>૧૦૦%</b>

# શેઠ માણેકલાલ જેટાભાઈ પુસ્તકાલય

સને ૨૦૨૨-૨ ઉના એસ્ટાબિશમેન્ટ શિડ્યુલમાં આવતા જુદા જુદા હોદા, ગ્રેડ, એલાઉન્સ તથા તેની કાયમી જગ્યાની સંખ્યા  
(તા. ૦૧-૦૭-૨૦૨૨ ઉના રોજની પરિસ્થિતિ મુજબ)

ક્રમ	હોદ્દો	પે-બેન્ડ	વર્ગ	સ્પે. પે. રૂ.	ભરાયેલી ખાલી કુલ		
					જગાની જગા	જગા સંખ્યા	જગા
<b>ટેકનિકલ કેડરની જગાઓ :</b>							
૧.	ગ્રંથપાલ	૬૭૭૦૦/૨૦૮૭૦૦	(વર્ગ ૧)	સ્પે. પે રૂ. ૧૦૦૦/-	૧	-	૧
૨.	સહાયક ગ્રંથપાલ	૫૩૧૦૦/૧૬૭૮૦૦	(વર્ગ ૨)	-	-	૩	૩
૩.	જુનિયર સહાયક ગ્રંથપાલ	૪૪૬૦૦/૧૪૨૪૦૦	(વર્ગ ૩)	મોટર સાયકલ ભથ્થુ	૧	-	૧
૪.	ટેકનિકલ આસીસ્ટન્ટ	૩૪૪૦૦/૧૧૨૪૦૦	(વર્ગ ૩)	-	-	૨	૨
૫.	જુનિયર ટેકનિકલ આસીસ્ટન્ટ	૨૫૫૦૦/૮૧૧૦૦	(વર્ગ ૩)		૨	-	૨
૬.	એટેન્ડન્ટ લાયબ્રેરી	૧૮૬૦૦/૬૩૨૦૦	(વર્ગ ૩)		૨૩	૨૫	૪૮
	એટેન્ડન્ટ લાયબ્રેરી (૧)	અ.મ્યુ. કોર્પો.માં ટેચ્યુ. પર ગયેલ	(વર્ગ ૩)	-			
<b>વહીવટી કેડરની જગાઓ :</b>							
૭.	ઓફિસ સુપ્રિટેન્ડન્ટ	૪૪૬૦૦/૧૪૨૪૦૦	(વર્ગ ૩)	-	-	૧	૧
૮.	એકાઉન્ટન્ટ	૨૮૨૦૦/૬૨૩૦૦	(વર્ગ ૩)	-	૧	-	૧
૯.	હેડ કલાર્ક	૩૪૪૦૦/૧૧૨૪૦૦	(વર્ગ ૩)	-	૧	૩	૪
૧૦.	સિનિયર કલાર્ક	૨૫૫૦૦/૮૧૧૦૦	(વર્ગ ૩)	-	૩	૨	૫
૧૧.	જુનિયર કોમ્પ્યુટર કમ કલાર્ક	૧૮૬૦૦/૬૩૨૦૦	(વર્ગ ૩)	-	૧	૨	૩
	અ.મ્યુ. કોર્પો.માં ટેચ્યુ. પર ગયેલ						
<b>આઈસોલેટ જગાઓ :</b>							
૧૨.	જુનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર	૩૪૪૦૦/૧૧૨૪૦૦	(વર્ગ ૩)	-	-	૧	૧
૧૩.	ટાઇપીસ્ટ	૨૫૫૦૦/૮૧૧૦૦	(વર્ગ ૩)	-	૩	-	૩
૧૪.	ઇવેન્ટ પ્રોગ્રામર	૨૫૫૦૦/૮૧૧૦૦	(વર્ગ ૩)	-	-	૧	૧
૧૫.	મશીન ઓપરેટર	૧૮૬૦૦/૬૩૨૦૦	(વર્ગ ૩)	-	-	૧	૧
૧૬.	મ્યુઝિયમ એટેન્ડન્ટ	૧૮૬૦૦/૬૩૨૦૦	(વર્ગ ૩)	-	૨	-	૨
૧૭.	ડ્રાયવર ડ્રાયવર (૨)	૧૮૬૦૦/૬૩૨૦૦ રોઝંડા વેતનથી	(વર્ગ ૩)	-	૧	૨	૩
<b>વર્ગ-૪ની જગાઓ :</b>							
૧૮.	નાયક	૧૫૭૦૦/૫૦૦૦૦	(વર્ગ ૪)	-	૧	-	૧
૧૯.	પટાવાળા	૧૪૮૦૦/૪૭૧૦૦	(વર્ગ ૪)	-	૪	૬	૧૦
૨૦.	ફિરાસ	૧૪૮૦૦/૪૭૧૦૦	(વર્ગ ૪)	-	૬	૧૨	૧૮
૨૧.	પાણીવાળા બહેન	૧૪૮૦૦/૪૭૧૦૦	(વર્ગ ૪)	-	૧	-	૧
૨૨.	સફાઈ કામદાર	૧૪૮૦૦/૪૭૧૦૦	(વર્ગ ૪)	-	૧	૫	૬

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડિસ્કલોગર નં. ૧૨  
ફાળવેલ રકમો અને તેવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો  
સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત

# શોઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નં. ૧૨

ફાળવેલ રકમો અને તેવા કાર્યકર્મોના લાભાર્થીઓની વિગતો સહિત  
આર્થિક સહાય કાર્યકર્મોની અમલ બજવણીની રીત

૧૨:૧ NIL

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડિસ્કલોગર નં. ૧૩  
પુસ્તકાલયે આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા  
અધિકૃતિઓ મેળવનારાની વિગતો

# શોઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નં. ૧૩

પુસ્તકાલયે આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા  
અધિકૃતિઓ મેળવનારાની વિગતો

- ૧૩ : ૧ પુસ્તકાલયના વાચનાલય-સામયિક વિભાગમાં તમામ પ્રકારના વાચકોને મુક્ત પ્રવેશ આપવામાં આવે છે.
- ૧૩ : ૨ પુસ્તકાલયની વિસ્તરણ સેવાના અનુસંધાનમાં સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મુક્ત પ્રવેશ આપવામાં આવે છે.
- ૧૩ : ૩ દર શનિવારે સાંજે ૫ : ૦૦ થી ૭ : ૦૦ કલાક દરમ્યાન નવોદિત કલાકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી સાહિત્યકારોને 'સાહિત્યયોરા' અન્વયે ઓડિટોરીયમ નિઃશુલ્ક ધોરણે પૂરુ પાડવામાં આવે છે.
- ૧૩ : ૪ જૂની રંગભૂમિના કલાકારોને દરમાસની છેલ્લી તારીખે 'સીનીયર આર્ટિસ્ટ ફોરમ' અંતર્ગત ઓડિટોરીયમ નિઃશુલ્ક ધોરણે પૂરુ પાડવામાં આવે છે.

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડિસ્કલોગર નં. ૧૪  
ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પુસ્તકાલયમાં ઉપલબ્ધ અથવા  
પુસ્તકાલયે ધરાવેલ માહિતીને લગતી વિગતો

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

## પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નં. ૧૪ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પુસ્તકાલયમાં ઉપલબ્ધ અથવા પુસ્તકાલયે ધરાવેલ માહિતીને લગતી વિગતો

૧૪:૧ પુસ્તકાલયમાં ઉપલબ્ધ રેકર્ડ ઇલેક્ટ્રોનિક સ્વરૂપ (સી.ડી./પેનડ્રાઈવ)માં આપવામાં આવે છે.

૧૪:૨ પ્રજાચક્ષુનિકાની કુલ ૩,૫૮૮ સી.ડી. છે.

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડિસ્કલોગર નં. ૧૫

જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તેવા ગ્રંથાલય તેમજ  
વાચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે  
નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો

**-શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય સંલગ્ન શાખા પુસ્તકાલયો / વાચનાલયો :-**

**૧. શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય**

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

ફોન : ૦૭૯-૨૬૫૭૪૪૮૨, ૨૬૫૭૮૫૧૩

ટેલીફોન : ૨૬૫૮૬૬૦૮

**૨. ચંદ્રકાન્ત કેશવલાલ કુસ્ટીયા મ્યુ. પુસ્તકાલય**

બ્લોક નં. ૮૩ ની સામે, ગુજરાત હાઉસિંગ બોર્ડ,

નૂતન નાગરિક બેંકની ઊપર, હરિશ્ચંદ્ર પાર્ક ચારરસ્તા,

પ્રગતિનગર રોડ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.

ફોન : ૦૭૯-૨૭૪૭૪૮૬૮

**૩. કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહ મ્યુ. પુસ્તકાલય**

ગાંધીગ્રામ સબજોનલ ઓફિસની બાજુમાં,

હિમતલાલ પાર્ક ચારરસ્તા,

આજાદ સોસાયટી, આંબાવાડી, અમદાવાદ.

ફોન : ૦૭૯-૨૬૭૬૧૧૫૮

**૪. આત્મા સાયન્સ એન્ડ ટેકનોલોજી શાખા પુસ્તકાલય**

માણીનગર ટેનીસ કોટની બાજુમાં,

કમલા નહેરુ ઉધાનની પાછળ,

ઉત્તમનગર, માણીનગર, અમદાવાદ.

ફોન : ૦૭૯ -૨૫૪૪૦૦૩૪

**૫. ગચ્છાધિપતિ આચાર્યશ્રી**

સુબોધસાગર સૂરિશ્વરજી મહારાજશ્રી શાખા પુસ્તકાલય

ચંદ્રનગર રોડ, અંજલી ચાર રસ્તા પાસે,

વાસણા, અમદાવાદ.

ફોન : ૦૭૯-૨૬૬૦૭૮૦૩

**૬. માણભવ પ્રેમાનંદ મ્યુ. વાચનાલય**

મરાઠી શાળા નં. ૧-૨, વિજય મીલની સામે, અસારવા, નરોડા રોડ, અમદાવાદ.

**૭. શામળ ભવ મ્યુ. વાચનાલય**

લલિતેશ્વર મહાદેવની સામે, ન્યુ કોટન સર્કલ પાસે,

અમરાઈવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૨૬.

**૮. ડૉ. શ્યામાપ્રસાદ મુખજી મ્યુ. વાચનાલય**

ડૉ. શ્યામાપ્રસાદ મુખજી ઓવરબ્રીજ નીચે, વેજલપુર, અમદાવાદ.

## અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાચનાલયોની યાદી

હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (જનરલ/દક્ષિણ ઓન) :- શ્રી દિપક વી. ત્રિવેદી

ફોન નં.(ઓ.) ૨૫૪૫૨૨૫૨ (મો.) ૯૩૭૭૪૮૨૩૬૬

ગ્રંથપાલ(મા.જે. પુસ્તકાલય) :- ડૉ.બીપીન જે.મોદી

ફોન નં.(ઓ.) ૨૬૫૭૮૫૧૩ (મો.) ૯૩૨૮૩૦૩૩૬૬

ઓફિસર ઈન્યાર્જ લાયબ્રેરી :- શ્રી મગનલાલ સી. ગામેતી

ફોન નં.(ઓ.) ૨૬૫૮૧૨૨૯ (મો.) ૯૪૨૭૪૫૫૦૫૧

ક્રમ	લાયબ્રેરીનું નામ	વિસ્તાર	સરનામું
૧	ભાઈશંકર નાનાભાઈ મ્યુનિ. પુસ્તકાલય	રાયપુર	પંડિતજીની પોળના નાકે, રાયપુર, અમદાવાદ-૩૮૦૦૦૧
૨	ગોવર્ધનરામ ત્રિપાઠી મ્યુનિ. પુસ્તકાલય	મણીનગર	ફાયરબ્રિગેડ સામે, રામબાગ, મણીનગર, અમદાવાદ-૩૮૦૦૦૮
૩	પટેલ કે. કે. મ્યુનિ. પુસ્તકાલય	નરોડા	નરોડા ગામના નાકે, અમદાવાદ-૩૮૨૩૩૦
૪	નારણભાઈ રણછોડભાઈ ચૌહાણ મ્યુનિ. વાચનાલય	કાંટોડીયા	પારસી અગ્રિયારી નજીક કાંટોડીયા અમદાવાદ-૩૮૦૦૦૮
૫	મણીશંકર રતનજી(કવિકાન્ત) મ્યુનિ. વાચનાલય	ખોખરા	બાજુદેવાળ સોસાયટી પાસે, ખોખરા, મણીનગર, અમદાવાદ-૦૮
૬	પઞ્ચાલાલ પટેલ મ્યુનિ. વાચનાલય	ગોમતીપુર	ગોમતીપુર દરવાજા પાસે, ગોમતીપુર, અમદાવાદ-૩૮૦૦૨૧
૭	ભીખુભાઈ ચાવડા મ્યુનિ. વાચનાલય	બહેરામપુરા	સ્વ.શ્રી લીલાધરભટ હોલ પાસે, બહેરામપુરા, અમદાવાદ-૩૮૦૦૨૨
૮	જ્યોતિન્દ્ર દવે મ્યુનિ. વાચનાલય	શાહપુર	સ્વ.લાલાકાકા હોલ પાસે, શાહપુર અમદાવાદ-૩૮૦૦૦૪

૬	કૌટિલ્ય મ્યુનિ. વાચનાલય	અસારવા	અસારવા ચકલા નજીક, અમદાવાદ- ૩૮૦૦૧૬
૧૦	સુરેન્દ્રભાઈપટેલ(દાસકાકા) મ્યુનિ. વાચનાલય	ઢાળનીપોળ	ઢાળનીપોળ, આસ્ટોડીયા ચકલા નજીક, અમદાવાદ.૩૮૦૦૦૧
૧૧	રા.બ.ગી.ઉ. મ્યુનિ. વાચનાલય	ખોડીઆંબલી	મ્યુ.ગુજરાતી શાળા નં.-૨૨, ખોડીઆંબલી, કાલુપુર, અમદાવાદ.૦૧
૧૨	શુન્ય પાલનપુરી મ્યુનિ. વાચનાલય	રાયખડ	સોદાગરનીપોળ, રાયખડ, જમાલપુર, અમદાવાદ.૩૮૦૦૦૧
૧૩	રાધા કિશન શર્મા મ્યુનિ. વાચનાલય	સરદારનગર	પોલીસચોકી પાસે, આંબાવાડી, સરદારનગર, અમદાવાદ.૩૮૨૪૭૫
૧૪	કવિ નહાનાલાલ સીની.સીટી.પાર્ક મ્યુનિ. વાચનાલય	સાબરમતી	ધર્મનગર રેલ્વે સ્ટેશન રોડ, ફાયર સ્ટેશન સામે, ગાર્ડનની અંદર સાબરમતી. અમદાવાદ-૩૮૦૦૦૫
૧૫	સ્વ.લાલભાઈ કુંદીવાલા મ્યુનિ. વાચનાલય	મોટાબંબા	અંજુમન હાઇસ્ક્વુલ પાસે, છીપાવાડ, જમાલપુર, અમદાવાદ-૦૧
૧૬	ઘાટલોડીયા મ્યુનિ. વાચનાલય	ઘાટલોડીયા	ચાણક્યપુરી બ્રીજના છેડ, ઘાટલોડીયા, અમદાવાદ-૩૮૦૦૬૧
૧૭	ડૉ.બાબા સાહેબ આંબેડકર મ્યુનિ. વાચનાલય	ગોમતીપુર	કુડાવાળી ચાલી, ગોમતીપુર, અમદાવાદ ૩૮૦૦૨૧
૧૮	કવિ નર્મદ મ્યુનિ.વાચનાલય	હાજુપુરાગાર્ડન	હાજુપુરા ગાર્ડન, માધુપુરા, અમદાવાદ- ૩૮૦૦૦૪
૧૯	તીર્થીકર ગાર્ડન મ્યુનિ. વાચનાલય	શાહીબાગ	રાજસ્થાન હોસ્પિટલ સામે, શાહીબાગ, અમદાવાદ.૩૮૦૦૦૪
૨૦	જેઠાભાઈ ગાર્ડન મ્યુનિ. વાચનાલય	ન્યુ.સિવિલ	ન્યુ સિવિલ હોસ્પિટલ પાસે, જહાંગીરપુરા, અસારવા, અમદાવાદ.૩૮૦૦૧૬
૨૧	જોધપુર મ્યુનિ. વાચનાલય	જોધપુર	ગોપાલ શોપિંગ સેન્ટર, દેરાસર રોડ, જોધપુર, અમદાવાદ.૧૫
૨૨	શકરીબેન સી.સીની.સીટી.પાર્ક મ્યુનિ. વાચનાલય	ડફનાળા	ડફનાળા, શાહીબાગ, અમદાવાદ.૩૮૦૦૦૪

૨૩	કવિ રમણલાલ વી. દેસાઈ મ્યુનિ. વાચનાલય	નિકોલ	કિશ્ચા પાણીની ટાંકી બાજુમાં, અર્બન હેલ્થ સેન્ટરની પાસે, પૂર્વઝોન વોર્ડ ઓફિસની અંદર, નિકોલ-વિરાટનગર, અમદાવાદ. ૩૮૨૩૫૦
૨૪	ચંદ્રકાંત બક્ષી મ્યુનિ. વાચનાલય	નવાવાડજ	અર્બન હેલ્થ સેન્ટરના ઉપરના માળે, નવા વાડજ, અમદાવાદ. ૧૩
૨૫	કવિ દલપતરામ મ્યુનિ. વાચનાલય	રીલીફરોડ	કેલિકોડોમ સામે, રીલીફરોડ અમદાવાદ-૩૮૦૦૦૧
૨૬	કનૈયાલાલ નથુરામ મ્યુનિ. વાચનાલય	કુબેરનગર	ચંદ્રનગર, કુબેરનગર, અમદાવાદ. ૩૮૨૩૪૦
૨૭	મકરનદભાઈ દેસાઈ મ્યુનિ. વાચનાલય	બોડકદેવ	અમરીશપાક ગાડિન પાસે, બોડકદેવ, અમદાવાદ. ૩૮૦૦૫૪
૨૮	ઉમાશંકર જોશી મ્યુનિ. વાચનાલય	સર્કિટહાઉસ	સર્કિટ હાઉસ સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪
૨૯	નરસિંહરાવ દિવેટિયા મ્યુનિ. વાચનાલય	અમરાઈવાડી	મથુરમાસ્તર ચાર રસ્તા, અમરાઈવાડી, અમદાવાદ-૩૮૦૦૨૬
૩૦	કવિ સુરેશ હરિપ્રસાદ જોશી મ્યુનિ. વાચનાલય	ખોખરાસર્કલ	જૂની મેલેરિયા ઓફિસ, ખોખરા સર્કલ, અમદાવાદ-૩૮૭૮૧૦
૩૧	કે. કા. શાસ્કી મ્યુનિ. વાચનાલય	પાલડી	ધરણીધર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
૩૨	કાકાકાલેલકર મ્યુનિ. વાચનાલય	સી.ટી.એમ.	સી.ટી.એમ. ચાર રસ્તા, અમદાવાદ-૩૮૦૦૨૬
૩૩	દાદાભાઈ નવરોજી મ્યુનિ. વાચનાલય	પાનકોરનાકા	પાનકોરનાકા ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧
૩૪	ઇશ્વરલાલ કચરાભાઈ મ્યુનિ. વાચનાલય	બાપુનગર	શ્રીજી વિદ્યાલય સામે, પોટલિયા, બાપુનગર, અમદાવાદ-૩૮૦૦૨૪
૩૫	સૈજપુર બોધા મ્યુનિ. વાચનાલય	સૈજપુરબોધા	સૈજપુર ટાવરની સામે, વોર્ડ ઓફિસ પાસે, અમદાવાદ-૩૮૨૩૪૫
૩૬	સોલા હાઉસીંગ મ્યુનિ. વાચનાલય	સોલારોડ	સોલા હાઉસીંગ બસ સ્ટેન્ડ પાસે, સોલારોડ, અમદાવાદ-૩૮૦૦૧૩

૩૭	ઠક્કરબાપાનગર મ્યુ. વાચનાલય	ઠક્કરનગર	કલ્યાણચોક, ઠક્કરબાપાનગર, અમદાવાદ-૩૮૨૩૫૦
૩૮	ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ મ્યુનિ. વાચનાલય	વસ્ત્રાલ	માધવબાગ ગાર્ડન સામે, વસ્ત્રાલ, અમદાવાદ-૩૮૨૪૧૮
૩૯	મલ્ટી એક્ટિવીટી સેન્ટર મ્યુનિ. વાચનાલય	ગોરના કુવા, જશોદાનગર	ત્રિપદા સોસાયટી પાસે, ગોરનાકુવા, મણીનગર, અમદાવાદ-૩૮૨૪૪૫
૪૦	મકતમપુરા મ્યુનિ. વાચનાલય	મકતમપુરા	જુની પંચાયત ઓફિસ, મકતમપુરા, અમદાવાદ-૩૮૦૦૫૫
૪૧	નારણપુરા મ્યુનિ. વાચનાલય	નારણપુરા	ડી.કે.પટેલ હોલ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૨૧૭૦
૪૨	હાથીજણ મ્યુનિ. વાચનાલય	રામોલ-હાથીજણ	લાલ ગેબી ચાર રસ્તા સર્કલ પાસે, રામોલ-હાથીજણ, અમદાવાદ-૩૮૨૪૩૫
૪૩	ડૉ. બાબા સાહેબ આંબેડકર મ્યુનિ. વાચનાલય	દાણીલીમડા	દાણીલીમડા વૉર્ડ ઓફિસ ઉપરના માળે, અર્બન હેલ્થ સેન્ટર પાસે, દાણીલીમડા ગામ, અમદાવાદ-૩૮૦૦૨૪
૪૪	વાસણા મ્યુનિ. વાચનાલય	વાસણા	પ્રથમ માળ, વાસણા સબ ઓનલ ઓફિસ, વાસણા બેરેજ રોડ, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭
૪૫	સૈજપુર મેઝો મ્યુનિ. વાચનાલય	મેઝો-સૈજપુર	પ્રથમ માળ, અર્બન હેલ્થ સેન્ટર, મેઝો ચાર રસ્તા પાસે, મેઝો-સૈજપુર, અમદાવાદ-૩૮૦૦૨૫
૪૬	સરખેજ મ્યુનિ. વાચનાલય	સરખેજ	પ્રથમ માળ, સરખેજ સબ ઓનલ ઓફિસ, સરખેજ, અમદાવાદ-૩૮૨૨૧૦
૪૭	ઓઢવ મ્યુનિ. વાચનાલય	ઓઢવ	અંબિકા નગર, ગણેશ ચોક, ઓઢવ, અમદાવાદ-૩૮૨૪૧૫
૪૮	જમાલપુર (સી.સી) મ્યુનિ. વાચનાલય	જમાલપુર	જમાલપુર પગથીયા પાસે, શીતલ આઇસ્કીમ સામે, જમાલપુર, અમદાવાદ-૩૮૦૦૦૧.

૪૬	વેજલપુર મ્યુનિ. વાચનાલય	વેજલપુર	વેજલપુર સબ ઓનલ ઓફિસ, બુટ ભવાની મંદિર પાસે, વેજલપુર, અમદાવાદ-૩૮૦૦૫૧
૫૦	શહીદ વીર મંગલપાંડે મ્યુ. વાચનાલય	નારોલ - લાંબા રોડ	કર્ણાવતી-૨ ની બાજુમાં, નારોલ લાંબા, નારોલ લાંબા રોડ, અમદાવાદ-૩૮૨૪૦૫
૫૧	વટવા મ્યુ. વાચનાલય	વટવા - ઘોડાસર	હિના પ્રાચ્યમરી સ્કુલ પાછળ, નિગમ-વટવા રોડ, વટવા-ઘોડાસર, અમદાવાદ-૩૮૨૪૪૦
૫૨	પિંક મ્યુ.લાયબ્રેરી (ફક્ત મહિલાઓ માટે)	બાપુનગર	ચંદ્ર પ્રસાદ દેસાઈ હોલના પ્રથમ માળ ઉપર, શ્રીજી વિદ્યાલય પાસે, બાપુનગર, અમદાવાદ-૩૮૦૦૨૪
૫૩	જોધપુર મ્યુનિ. વાચનાલય	જોધપુર	રીધ્ધી બંગલોઝ પાસે, આનંદ નગર રોડ, મીની સ્ટાર બજારની સામે, પહેલાદ નગર, અમદાવાદ-૩૮૦૦૧૫
૫૪	બોપલ મ્યુનિ. વાચનાલય	બોપલ	ઓડા ગાર્ડન પાસે, જુની ઓડા ઓફિસ, સિટી સિવિક સેન્ટરની ઉપરના માળે, બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮
૫૫	શાસ્ક્રીનગર મ્યુનિ. વાચનાલય	શાસ્ક્રીનગર	શુભમ લાયબ્રેરીની ગલીમાં, વરદાન ટાવર પાસે, શાસ્ક્રીનગર, નારણપુરા, અમદાવાદ.

### મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બાલભવનોની યાદી

ક્રમ	બાલભવનનું નામ	વિસ્તાર	સરનામું
૧	મણીનગર મ્યુ. બાલભવન	મણીનગર	ફાયરબિગેડ સામે, રામબાગ, મણીનગર, અમદાવાદ-૩૮૦૦૦૮
૨	ફટેહપુરા મ્યુ. બાલભવન	ફટેહપુરા	ફટેહપુરગામ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
૩	ગોમતીપુર મ્યુ. બાલભવન	ગોમતીપુર	દરવજા પાસે, ગોમતીપુર, અમદાવાદ- ૩૮૦૦૨૧
૪	ઢાળનીપોળ મ્યુ. બાલભવન	આસ્ટોડીયા ચકલા	ઢાળનીપોળ, આસ્ટોડીયા ચકલા નજુક, અમદાવાદ-૩૮૦૦૦૧

**-: મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ :-**

ક્રમ	નામ	હોદ્દો
૧.	શ્રી કિરીટકુમાર જે. પરમાર મેયર, અ.મ્યુ. કોર્પોરેશન	અધ્યક્ષ
૨.	શ્રી હિતેશભાઈ કે. બારોટ ચોરમેન, સ્ટે. કમિટી, અ.મ્યુ. કોર્પોરેશન	સત્ય
૩.	ડૉ. સુજય જે. મહેતા ચોરમેન, મ્યુ. સ્કૂલ બોર્ડ, અમદાવાદ.	સત્ય
૪.	શ્રી કિશોરભાઈ કે. મકવાણા	વિદ્ધાન સત્ય
૫.	ડૉ. હેમન્તભાઈ એસ. ભણી	વિદ્ધાન સત્ય

૧૫ : ૧ વાચકો (જનતા)ને માહિતી ભળે તે માટે પુસ્તકાલયે અપનાવેલ સાધનો, પથૃતિઓ અથવા સવલતો

- મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંચાલિત શાખા પુસ્તકાલયો / વાચનાલયો
- વર્તમાનપત્રો
- નોટિસબોર્ડ
- કચેરીમાં રેકર્ડનું નિરીક્ષણ
- દસ્તાવેજની નકલ મેળવવા નિયત કરેલ રકમ પાના દીઠ રૂ. ૨/- લેવામાં આવે છે.
- પુસ્તકાલયની વેબસાઈટ [www.mjlibrary.in](http://www.mjlibrary.in)
- પુસ્તકાલયનું પ્રો-એક્ટિવ ડિસ્કલોગર પાના દીઠ રૂ. ૨/- + બાઈન્ડિંગ ચાર્જ
- સી.ડી. રૂ. ૫૦/- ની કિંમતે આપવામાં આવશે.

# શેઠ માણોકલાલ જેઠામાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

ટેલીફોન નં. : ૨૬૫૭૪૪૮૨, ૨૬૫૭૮૫૧૩ ટેલીફોન : ૨૬૫૮૬૬૦૮

વેબસાઈટ : [www.mjlibrary.in](http://www.mjlibrary.in) ● E-mail : [mjlibrary@ahmedabadcity.gov.in](mailto:mjlibrary@ahmedabadcity.gov.in)

## જ્ઞાન મંદિર

સ્થાપના વર્ષ : ૧૫ એપ્રિલ, ૧૯૩૮



પ્રજ્વાલિતો જ્ઞાનમય: પ્રદીપ: ।

'together we shine in the light of knowledge'

‘અમદાવાદ શહેર રળિયામણું’ એટલે બાબુ સ્વરૂપ સુંદર હોવું જોઈએ, એમ નહીં પણ તેનું આંતરિક જીવન પણ સુંદર હોવું જોઈએ, એવાં સરદાર સ્વમો સેવે છે અને હું તેમનો સાથીદાર પણ છું. અમદાવાદ બુદ્ધિ, ધન અને દક્ષતાવાળું શહેર છે... અમદાવાદમાં દરેક ચીજ સુંદર હોવી જોઈએ... આ તકે અમદાવાદ મુનિસિપાલીટીને એક સૂચના કરી દઉં કે પુસ્તકાલયનું મકાન એવું બાંધશો કે તેમાં વધારો કરવો હોય ત્યારે થઈ શકે... આ પુસ્તકાલયમાં ભાષણ થાય, શોધખોળ થાય એવી ગોઠવણ કરજો. અમદાવાદ શહેર કારીગીરી માટે મશહૂર છે. લાયબ્રેરી માટે કોઈ પગારદાર વિદ્યાન લાયબ્રેરીયન રાખજો કે જે ચોપડીની સંભાળ લે અને પોતે તે સાચવી પણ શકે... પુસ્તકાલયની કમિટીમાં વિદ્યાનની જરૂર નથી. તો તમારા ઠરાવની કોઈ સારી બારીમાંથી વિદ્યાનનો કમિટીમાં સમાવેશ થાય એવો રસ્તો ખોળજો.

ગાંધીજી

(તા. ૨૧-૮-૧૯૩૩)

સંસ્કાર અને સંયોગો.....

આ પુસ્તકાલયને તો એવાં પુસ્તકો એક તપસ્વી તરફથી મળ્યાં છે કે જેનો તેણે જાતે જ ઉપયોગ કર્યો છે અને જેણે જાતે મેળવીને પસંદ કર્યા હતાં. પુસ્તકો મળવાના સંસ્કાર અને સંયોગો જે આ પુસ્તકાલયને મળ્યા છે તેવાં બીજી કોઈ પણ લાયબ્રેરીને મળી શક્યા નથી... આ પુસ્તકાલય સંપૂર્ણ બને અને એવી આપણે આશા રાખીએ કે તે એક માનસિક ખીલવણીનો બગીચો બને.

સરદાર વલ્લભભાઈ પટેલ

(તા. ૧૫-૪-૧૯૩૮)

## પુસ્તકાલયની નોંધપાત્ર સિદ્ધિઓના સોપાન

૧. સતત ૧૫ કલાક ઉપદ દિવસ વાચનાલય વિભાગની સેવાઓ.
૨. ગ્રંથાલય શાસ્ત્રની શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વિકાસ પામેલું અધતન અને નમૂનારૂપ સાર્વજનિક પુસ્તકાલય.
૩. મુખ્ય પુસ્તકાલય ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આઈ શાખા પુસ્તકાલયો / વાચનાલયોના માધ્યમથી પૂરી પાડવામાં આવતી અવિરત સેવાઓ.
૪. જ્ઞાન અને માહિતીનો અવિરત વહેતો ધોધ, અધતન અને સમૃદ્ધ વૈવિધ્ય સભર વાંચન સામગ્રીનો વૈભવ.
૫. પુસ્તકાલયના વિવિધ વિભાગોમાં વિવિધ વિષયોના નવ ભાષામાં વર્ગીકૃત ઓર્ડરમાં ગોઠવાયેલ અધતન અને સમૃદ્ધ વાચન સામગ્રી.
૬. વાચકો અને પુસ્તક પ્રેમીઓનો અભૂતપૂર્વ ધસારો.
૭. સાહિત્ય રસિકો, પત્રકારો, લેખકો, વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, વિષય તજજો, સંશોધનકારો, બાળકો, મહિલાઓ, સીનીયર સીટીજનો અને જિજ્ઞાસુઓની માનસિક ખીલવણી કરતી સૌ કોઈની પ્રિય જ્ઞાનભૂમિ.
૮. વિવિધ સઘન પુસ્તકાલય પ્રવૃત્તિઓથી ધબકતું પુસ્તકાલય
૯. બાળ વાચકો માટે સંસ્કાર અને ચારિત્ય ઘડતરનું કેન્દ્ર.
૧૦. બાળકિશોર વિભાગ, મહિલા વિભાગ, રેફરન્સ અને રેડી રેફરન્સ જેવા વિભાગો.
૧૧. વર્તમાનપત્ર અને સામયિક વિભાગનો સતત ઉપયોગ કરતા વાચકો.
૧૨. ઇન્ટરનેટ આધારિત માહિતી મેળવતા વાચકો.
૧૩. પુસ્તકાલયની વેબ સાઈટ મારફતે માહિતી મેળવી ઓન લાઈન લાયબ્રેરી સર્વિસીઝનો લાભ મેળવતા ઉપભોક્તાઓ.
૧૪. ડિજિટલ લાયબ્રેરીનો લાભ મેળવતા જિજ્ઞાસુઓ અને સંશોધનકારો.
૧૫. ઈ-બુક્સ, ડિજિટાઇઝેશન અને ઈ-લાયબ્રેરી (વર્ચ્યુઅલ લાયબ્રેરી) સર્વિસીઝ.
૧૬. કોમ્પ્યુટર અને ઈન્ફર્મેશન ટેકનોલોજી સેક્શન.
૧૭. આર્ટ એન્ડ પિકચર ગેલેરી સાથે પ્રદર્શન વિભાગની સેવાઓ.
૧૮. પ્રજ્ઞાચ્યુલ વાચકો માટે ઓડિયો વિભાગ
૧૯. જ્ઞાનવિહાર વાચનાલયનો લાભ મેળવતા વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓ.
૨૦. વાંચન અને સાહિત્યિક - સાંસ્કૃતિક રસને પોષતું શાંત અને સુંદર વાતાવરણ.
૨૧. સાહિત્યિક પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ.
૨૨. સાહિત્ય સર્જન, સર્જક, ભાવક અને પ્રકાશકના મિલનનો સેતુબંધ રચતું આ પુસ્તકાલય - મા.જે. પુસ્તકાલય.

## માહિતી : સંક્ષેપમાં

### સ્થાપના, ઈતિહાસ અને વિકાસ :

ઐતિહાસિક દાંડીકૂચના પ્રારંભે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમના ૬૬૫૦ પુસ્તકો થકી સાર્વજનિક પુસ્તકાલયની રચનાનો વિચાર પ્રદર્શિત કર્યો, અમદાવાદ મ્યુનિસિપાલિટીએ પૂજ્ય ભાપુજીના રેલ્લી વિચારને સહૃદ વધાવીને સાર્વજનિક પુસ્તકાલયની રચના અને વિકાસ માટેની સઘળી નાણાંકીય જવાબદારી ઉપાડી લેવાનો કોલ આપ્યો. સર્તુ સાહિત્ય કાર્યાલયના સ્વામી અખંડાનંદ તરફથી ૮૮૬૧ પુસ્તકો ભેટમાં મળ્યા. શેઠ શ્રી રસિકલાલ માણેકલાલ તરફથી પુસ્તકાલય ભવન માટે રૂ. ૫૫,૦૦૦/- ની ઉદાર સખાવત મળી. પૂજ્ય ગાંધીજીના આશીર્વયનો સાથે ૨૧ સપ્ટેમ્બર, ૧૯૩૮ના રોજ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અને ભારતના લોખંડી પુલષ, ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના શુભ હસ્તે ૧૫ એપ્રિલ, ૧૯૩૮ના રોજ ‘શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય’ જાહેર જનતાના ઉપયોગ માટે ખૂલ્લુ મૂકવામાં આવ્યું.

દાતાશ્રી રસિકલાલ શેઠ તરફથી પુનઃ સખાવતો મળતા માતાના નામે ‘સુભદ્રાબેન માણેકલાલ વાચનાલય’ અને પુત્ર કિશોરના નામે ‘ભાળકિશોર વિભાગ’ ની રચના કરવામાં આવી. ભાળકિશોર વિભાગનો પ્રારંભ મુંબદ્ય રાજ્યના પંત પ્રધાન મોરારજી દેસાઈના હસ્તે ૧૪ જુન, ૧૯૫૮ના રોજ થયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પુસ્તકાલય ભવન વિસ્તરણ માટે અનુકૂળ ગ્રંથભંડાર (૧૮૫૦), સંલગ્ન ભવન વિસ્તરણ (૧૮૭૫) અને વધુ મજલાનું બાંધકામ (૨૦૦૧), વર્ષ ૨૦૦૪-૦૫માં રૂ. ૨૨.૦૦ લાખની કેપિટલ રકમાંથી રેફરન્સ એન્ડ રીસર્ચ સેક્શન તથા જ્ઞાનવિહાર - વિદ્યાર્થી વાચનાલય વિભાગ અસ્થિત્વમાં આવ્યો. અ.મ્યુ. કોર્પો. દ્વારા વર્ષ ૨૦૧૨-૧૪માં રૂ. ૫.૩૫ કરોડના ખર્ચે પુસ્તકાલયના નવિનીકરણ અને રીટ્રોફીટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી જેમાં વાતાનુકૂલિત ઓડિટોરિયમ અને લીફટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.

શહેરના દૂરના અને પરાવિસ્તારોમાં પણ આ પુસ્તકાલયની સેવાઓ ઉપલબ્ધ બની શકે તે હેતુસર વિજયનગર, નરોડા, સરસપુર, હિમતલાલ પાર્ક - આંભાવાડી ખાતે શાખા પુસ્તકાલયો, મણીનગર ખાતે આત્મા સાચંસ એન્ડ ટેકનોલોજી લાયબ્લેરી વાસણા ખાતે ગચ્છાધિપતિ આચાર્યશ્રી સુબોધસાગર સૂર્યિશ્વરજી મહારાજશ્રી લાયબ્લેરી, વેજલપુર ઓવરફ્રીજ નીચે ડૉ. શ્યામાપ્રસાદ મુખજી લાયબ્લેરી, અમરાઈવાડી વાચનાલય, વાસણા - ધરણીધર દેરાસર પાછળ વાચનાલય વિકસના રહ્યા છે. તા. ૦૧-૦૬-૨૦૨૧થી શેઠ મા.જે. પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયોમાં ડિજિટલ લાયબ્લેરી ઓનલાઈન સેવાઓનો પ્રારંભ કરવામાં આવેલ છે.

પુસ્તકાલય ભવનનું ખાતમુહૂર્ત : રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીના હસ્તે તા. ૨૧-૦૬-૧૯૩૩

પુસ્તકાલય સેવાઓનો પ્રારંભ : ભારતના લોખંડી પુલષ પૂ. સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે તા. ૧૫-૦૪-૧૯૩૮

બાળ કિશોર વિભાગનો પ્રારંભ : મુંબદ્ય રાજ્યના પંત પ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના હસ્તે તા. ૧૪-૦૬-૧૯૫૮  
પ્રથમ લાયબ્લેરી કમિટીની રચના : તા. ૦૩-૦૮-૧૯૩૩

સંચાલન : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્વાચ્છ સંસ્થા અને ટ્રસ્ટ ડીડ સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય છે.

અનુદાન : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

ટ્રસ્ટ ડીડ : શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય ટ્રસ્ટ ડીડની નોંધણી કમાંક : ૬૦૮૦ તા. ૨૨-૧૧-૧૯૩૭ મુંબદ્ય રાજ્ય બોઝે પલ્લિક ટ્રસ્ટ એકટ નીચે ચેરીટી કમિશનરશ્રીની કચેરીમાં નોંધણી પ્રમાણપત્ર કમાંક : ૪૫૮૮ અમદાવાદ તા. ૧૬-૦૬-૧૯૫૩

ઇન્કમટેક્ષ એકટ ૧૯૬૧ના સેક્શન ૧૨ એ એ નોંધણી પ્રમાણપત્ર કમાંક DIT(E) / 12AA / 464 / 04-05 તા. ૦૮-૦૫-૨૦૦૫

ઇન્કમ ટેક્ષ એકટ ૧૯૬૧ કલમ ૮૦ જુ (૫) નીચે મળેલ પ્રમાણપત્ર

કમાંક DIT (E) / ૮૦ જુ (૫) / ૬૦૭ / ૦૫-૦૬ તા. ૧૧-૧૦-૨૦૦૬

ઇન્કમટેક્ષ એકટ ૧૯૬૧ કલમ ૨૪૮ નીચે ટીડીએસ કપાત એકગેમ્પશન (મુક્તિ) પ્રમાણપત્ર

કમાંક ADIT (E) / ૨૪૮ / ૦૫-૦૬ તા. ૨૦-૦૬-૨૦૦૫

### **કર્મચારી ગણા :**

પુસ્તકાલયમાં હાલમાં એસ્ટાબિલશમેન્ટ શિડ્યુલ પર કર્મચારીઓની કુલ ૧૧૮ જગાઓ મંજૂર થયેલી છે, જે પૈકી ૫૧ જગાઓ ભરાયેલી છે અને ૬૭ જગાઓ ખાલી છે. મોટા ભાગના કર્મચારીઓ વ્યવસાયિક શૈક્ષણિક લાયકાતો અને અનુભવ ધરાવે છે. તમામ કર્મચારીઓ સોંપવામાં આવેલ કામગીરી અને જવાબદારીઓ નિભાવે છે.

### **-: પુસ્તકાલય અધિકારીગણા :-**

ગ્રંથપાલ : ડૉ. બિપીન જે. મોટી

જુનિયર સહાયક ગ્રંથપાલ : શ્રી યોગેશભાઈ જે. પટેલ

ઇન્ચાર્જ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ : શ્રી મયુરબેન એચ. નિનામા

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડિસ્કલોગ્ર નં. ૧૬

જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદાઓ અને બીજી વિગતો

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

- : પ્રો-એક્ટિવ ડિસ્કલોગર - ૧૬ :-

માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ અન્યે જાહેર માહિતી અધિકારીઓના નામ, હોદ્દા, સરનામા અને ફોન નંબર

વેબસાઈટ : [www.mjlibrary.in](http://www.mjlibrary.in) ● E-mail : [mjlibrary@ahmedabadcity.gov.in](mailto:mjlibrary@ahmedabadcity.gov.in)

ક્રમ	નામ	હોદ્દો	ફોન નંબર ઓફિસ ફેક્સ નંબર	ઘર	મોબાઇલ નંબર	સરનામું
અપીલ અધિકારી						
૧.	ડૉ. બિપીનભાઈ જે. મોદી E-mail : <a href="mailto:mjlibrary@ahmedabadcity.gov.in">mjlibrary@ahmedabadcity.gov.in</a>	ગ્રંથપાલ	૦૭૯-૨૬૪૭૮૪૯૩ ૦૭૯-૨૬૪૭૪૪૮૨ ફેક્સ - ૨૬૪૮૬૬૦૮	-	૮૩૨૮૩૦૩૩૬૬	એમ.જે. લાયબ્રેરી, એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.
જાહેર માહિતી અધિકારી						
૧.	શ્રી યોગેશકુમાર જે. પટેલ E-mail : <a href="mailto:vrajraj2001@gmail.com">vrajraj2001@gmail.com</a>	જુનિયર સહાયક ગ્રંથપાલ	૦૭૯-૨૬૪૭૪૪૮૨	-	૮૪૨૬૩૪૪૨૨૫	એમ.જે. લાયબ્રેરી, એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.
જાહેર માહિતી અધિકારી						
૧.	શ્રી મગનલાલ સી. ગામેતી E-mail : <a href="mailto:mgameti9@gmail.com">mgameti9@gmail.com</a>	ઓફિસર ઈન્ચાર્જ ઓફ લાયબ્રેરીજ (મ્યુ. પુસ્તકાલય ખાતું)	૦૭૯-૨૬૪૭૪૪૮૨	-	૮૪૨૭૪૫૫૦૫૧	એમ.જે. લાયબ્રેરી, એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

વિષય : શેઠ મા. જે. પુસ્તકાલય તેમજ અ. મ્યુ. કોર્પોરેશન સંચાલિત શાખા પુસ્તકાલયો / વાચનાલયોની અને બાલભવનોની માહિતી બાબત.

# શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડિસ્કલોગ્ર નં. ૧૭  
ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી

# શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નં. ૧૭

અન્ય ઉપયોગી માહિતી

૧૭ : ૧ લોકો દ્વારા પૂછતા પ્રશ્નો અને તેના જવાબો

૧૭ : ૧ નિયત કરેલ સમય મર્યાદામાં જવાબો આપવામાં આવે છે.

૧૭ : ૨ માહિતી મેળવવા અંગે

૧૭ : ૨ અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયત કરવામાં આવેલ પદ્ધતિ અને ફી મુજબ

- અરજીપત્રક (સંદર્ભ માટે ભરેલા અરજી પત્રકની નકલ)

- ફી

- માહિતી મેળવવા માટેની અરજી કઈ રીતે કરવી કેટલીક ટિપ્પણી

- માહિતી આપવાનો ઈન્કાર કરવામાં આવે તેવા વખતે નાગરિકના અધિકાર અને અપીલ કરવાની કાર્યવાહી

૧૭ : ૩ જાહેર તંત્ર દ્વારા લોકોને અપાતી તાલીમની બાબતમાં

૧૭ : ૩ - **NIL** -

- તાલીમ કાર્યક્રમનું નામ અને તેનું સંક્ષિપ્ત વર્ણન.

- તાલીમ કાર્યક્રમ / યોજનાની મુદ્દત

- તાલીમનો ઉદ્દેશ

- ભૌતિક અને નાણાંકીય લક્ષ્યાંકો (છેલ્લું વર્ષ)

- તાલીમ માટેની પાત્રતા

- તાલીમ માટેની પૂર્વ જરૂરિયાતો (જો કોઈ હોય તો)

- નાણાંકીય તેમજ અન્ય પ્રકારની સહાય (જો કોઈ હોય તો)

- સહાયની વિગત (નાણાંકીય સહાયની રકમ જો હોય તો જણાવો)

- સહાય આપવાની પદ્ધતિ

- અરજી કરવા માટે સંપર્ક માહિતી

- અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)

- અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં)